

૭૦૮

શ્રી

નુરાળ સુરિ



— : સંપાદક : —

અનું શ્રી કેશર મુનિલ ગણ્યવર વિનેય

બુધિસાગર ગણ્ય.

શ્રી ગણ્યવર માટે
નુરાળ સુરિ

ફોન નંબર : ૦૭૨૪-૨૫૦૩૮૮૮
એમાસ, ગુજરાત.
દાદરાથનગર, ગુજરાત.

શ્રીમત્મોહનયશઃ સ્વમારક શંથમાલા, શંથાંક ૧૬

અધ્યાત્મિક નૂતન શાબક વિદ્યાયક મહાન શાસન
પ્રકાશક, પ્રગાઢપ્રલાભી

૬૧૬। શ્રીજિનકુરીલસૂરિ

મૂળ ડિલ્લી બેખક—

શ્રીમાનુ અગરચંદળ તથા ભાવચાલળ નાહટા.

ગુજરાતી અતુવાદક—

ઉપાધ્યાયણ શ્રીસુખસાગરણ મહારાજના શિષ્ય
સુનિ શ્રીકાંતિ સાગરણ

સંપાદક—

સ્વઠ અતુયોગાચાર્ય શ્રીકેશરમુનિણ ગણિવર વિનેય
બુદ્ધિ સાગર ગણિ

પ્રકાશક-વિલિન શાબક સંઘની દ્વારા સહાયથી

શા. રતનચંદ કુરતૂરચંદ અવેરી. સુરત.

વીર સં.૦

૨૪૭૬

પ્રતિ ૨૦૦૦

મૂ. ૦-૪-૦

નિ.૦ સં.૦

૨૦૦૬

મુદ્રક-શા. કૃતીરચંહ મગનલાલ બદ્ધામી
ધી “નૈનવિજ્ઞાનં” પ્રી. ગ્રેસ.
દવાદિયા ચકલા-સુરત.

દ્રોધસહાયકોની શુલ નામાવદી

- ૩૦ ૭૦૦) ગામ ચૂડા (મારવાડ) શ્રીસંઘ તરફથી
૩૦ ૫૦૦) પાલી અરતરગચ્છ શ્રીસંઘ તરફથી.
હસ્તે. શેઠ વસ્તીમલાલ બદાઈ.
૩૦ ૭૫) પારેણ મોહનલાલ ટોકરસી, રાધનપુર.
૩૦ ૬૧) શા. નાથલાલ મોહનલાલ, મુંબઈ.
૩૦ ૫૦) જામનગર અરતરગચ્છ શાવિકાસંઘ વતી
બમકુખાઈ. હસ્તે-શા. હીસંગ આનસંગ
પારેખ.
૩૦ ૩૧) કોડારી લીખમચંદળ ચિમતાળ,
ધીમેલ (મારવાડ)
૩૦ ૨૫) શા. અચરતલાલ શિવલાલ, રાધનપુર.

પુસ્તક મળવાના ટેકાણાએ—

શ્રીજિનહનસૂર્ય જ્ઞાનલંડાર

૩૦ ગોધીપુરા,		૩૦ પાયધૂની.
શીતળવાડી ઉપાશ્રય,		મહાવીર સ્વામીનું ડેરાસર,
સુરત. (દ. ગુજરાત)		મુંબઈ નં. ૩



સંપાદકીય વક્તવ્ય

પ્રિય સજ્જનો ! શાસનનાયક ભગવાન શ્રી મહાવીર હેવના પાછળા આ એંચમ કાળમાં એવા મહાન् પુરંધર શાસન પ્રભાવક આચાર્યો મેંડો નહીં, બદકે હળરો આઈ ગયા છે કે નેમણે કૈન શાસનની વિવિધ પ્રકારે એકેકથી અધિક મહાનું પ્રભાવના કરી છે. નેમાં આ ચાર આચાર્યોનું સ્થાન બહુ ઉચ્ચું છે. તેમાં પહેલા અંબિકાદેવી પ્રદાન 'યુગપ્રધાન' પદ્ધતી વિશ્વૂપ્ઠિત આં શ્રીજિનદાસુરિ મહારાજ કે નેમણે પોતાના સાંચુ જીવનકાળમાં એક લાખ અને ત્રીસ હળર અન્નેનોને કૈન ધર્મની દીક્ષા દ્ધરે આવક કુલમાં દાખલ કર્યા હતા. ત્રીજા અંબિકારી શ્રીજિનયંદ્રસુરિજી મૃહારાજ કે નેઓ ઉપર્યુક્ત આં શ્રીજિનદાસુરિજી મહારાજના ખાસ પદ્ધતર શિષ્ય હતા, એએઓએ અંતિ સ્વદ્ધ વયમાં સ્વર્ગવાસી થવા છતાં અનેકો કૈનેતરોને ઉપર્યુક્ત દ્વારા સત્ય-ધર્મનો બોધ દ્ધરે કૈનુંધર્મમાં દાખલ કર્યા હતા. ત્રીજા આચાર્ય શ્રીજિનયુશ્માસુરિજી કે નેમણે પોતાના અપ્રતિબદ્ધવિહારથી દેશવિદેશમાં વિચરી અનેકો અન્નેનોને પણ કૈનુંધર્મનો તત્ત્વ સમજવીને પચાસ હળર નવીન આવકો બનાવ્યા હતા, અને ચોથા અફલરોપહેશક આં શ્રીજિનયંદ્રસુરિજી કે નેમણે બાદશાહ અફલરને ઉપર્યેશ દ્ધરે અધાર ચોમાસીની અઠાડીના હિવસોમાં સમગ્રહિંદની આંદર સદ્ગાને માટે અમારી ધોષણા કરાવી હતી તેમજ બાદશાહ જહાંગીરના સાંખુવિહાર પ્રતિથંઘક હુકમને રદ કરાવી કૈનશાસનની મહાનું પ્રભાવના કરી, એટલંજ નહીં, હિંતુ સમગ્ર અન્ય ધર્માવલંખી સાંચુ સતો પર પણ મહાનું ઉપકાર કર્યો હતો, એ ચારે આચાર્યો આખા કૈન સમજમાં દાદસાહેબના નામથી અતિ ઘ્યાતિપ્રાપ્ત છે.

સજજનો ! કૈન સમજનો એવો ડોઈ મતુષ્ય વિરલજ દસે
 કે જેણે દાદસાહેબનું નામ સાંભળ્યો ન હતો, કારણ ? તેઓઓએ
 મતુષ્ય જીવનમાં રહી વિશેષત : વિશુદ્ધચારિત્ર બણે, યથાવતસત્ગેપદેશના
 અણે તેમજ કવચિત તથાવિધ પૂર્વભવન્નિત પુણ્યના યોગે પ્રાપ્ત થયેલ
 વિવિધ ચમતકાનેના અણે ભાખેના પ્રમાણમાં અન્નેનોને કૈન ધર્મનો
 એધ આપીને કૈન ધર્માતુયાયી અનાબ્યાસ. એટલું નહીં પણ તેમનો
 અધાનો સ્વર્ણ જાતિ પાતિનો સંબંધ છોડાવીને કૈનધર્માતુયાયી એસવાળ
 જાતિની સાથે સંબંધ જોડાવી કૈન સમજની સદાને માટે ખૂબજ
 અભિષ્ટક્ષિકી કરી અને તે વડે મહાનમાં મહાન શાસન પ્રભાવના કરીને
 મહાન શાસન પ્રભાવક તરીકેની અધ્યાત્મિને પ્રાપ્ત થયા હતા. અને
 સ્વર્ગવાસી થયા પછી પણ જેણે ભક્તજ્ઞનો સાચી અદ્ઘાયે સેવા-
 અદ્ધિત અર્થન પૂજન સાથે સ્મરણ કરે છે તેમને સંકટથી સુકૃત
 થવામાં વગર વિલંઘે અચૂક સહાયક અને છે, એટસે દેશમાં શું
 પણ શહેરે શહેરમાં એમના ચરણું પાડુકાયો મૂર્તિએ સ્થાપિત છે.
 હિંદુભરમાં લાઘેજ ડોઈ શહેર દાદાવાડીથી વા અન્ય ડોઈ પણ
 સ્થાને દાદસાહેબના ચરણુાહિની સ્થાપનાથી રહિત હોય, એટસે તત્ત્વથે
 વગર નિભતાએ શું તો હોવાસી અને શું સ્થાનકવાસીએ યાવત-
 તેરાપંથીએ સુધાં પણ અટલ શ્રેષ્ઠાએ અદ્ધિતપૂર્ણ ભાવે એઓઓના
 ચરણુાહિની પૂજા લાદિત કરીને સ્વકામના સફળ કરે છે.

આ ભક્તજ્ઞનોએ આવા મહાન શાસન પ્રભાવક આચાર્યોનું
 જીવન ચરિત્ર જાણી તેમની અતુલ્ય શાસન-પ્રભાવકતા આદિ વિશિષ્ટ
 શુણોનું સ્મરણ કરવું અત્યાવસ્યક છે. આ વાતને લક્ષ્યમાં લઈને
 ખીફારને (રાજસ્થાન) નિવાસી ધતિહાસ તત્ત્વના પ્રખર અનુભવી
 નિરંતર સાહિત્ય સેવા રસિક શ્રીમાન અગરચંદ્ર તથા સંવરલાલજી
 નાહટાએ ઉપર્યુક્ત ચારે દાદા ગુરુદેવોના જીવન ચરિત્રો ઐતિહાસિક
 તથાન-વૈષણવપૂર્ણ તઠ્યાર કરી પ્રકાશિત કર્યા છે. તેમાંથી દાદા શ્રીજિત-

દ્રોશળસૂર્જિનાં જીવન ચરિત્રનું આ ગુર્જરાતુવાદ કેવળ ગુર્જર ભાષા-
ભાષીઓના નિમિત્તે ખાસ તથાયારે કરાવીને ગુણુગ્રાહી પાડકેના
કરક્રમણમાં સમર્પણુ કરાય છે.

આ અતુવાદ સાહિત્ય પ્રકાશનમાં સતત પ્રેરણશીલ અનેક અંગ્રોના
સંપાદક ઉપાધ્યાયજી શ્રી સુખસાગરજીમં ના યોગ્ય શિષ્ય મુનિ શ્રી કાંતિ-
સાગરજીએ પોતાની અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓમાંથી ટાઈમ
લઈને કરી આપવાનો અતુયાહ કર્યો છે, તર્ફ અમો અહિં તેમનો
આલાર પ્રદર્શિત કરીએ છીએ.

આના પછી રોષ ત્રણુ ચરિત્રો પણ આવી રીતેજ કુમસઃ પ્રકાશિત
કરાવવાની આજના છે, તદ્દુસાર તેઓના ગુર્જરાતુવાદ મુનિવર શ્રીગુણાય-
મુનિજીએ સુંભર્માં તથાયાર કરાવી લીધા છે અને યોડાજ સમયમાં
પ્રકાશિત થઈને પાડકેના કર કરક્રમાં સમર્પિત કરાશે.

અંતે આ સંપાદનમાં છિદ્રરથતાના સહજસ્વભાવે થબેલ મુશ્કેલ
સંસોધનની કે બીજુ કોઈપણ પ્રકારની જે રખલના પાડકેની દિશિમાં
આવે તેને સુધારી વાંચવાની અસ્યર્થના સાથે આ વક્તવ્યને સમાપ્ત
કરીએ છીએ.

નિં. સં. ૨૦૦૮

કંચિ લુઝ

} સ્વ. અતું શ્રીકેશરમુનિજી
ગણ્યિવર વિનેય
બુદ્ધિસાગર ગણ્યુ.



કિંચિત् વક્તાવ્ય

વર્ષોથી અમારી ઉત્કંદા હતી કે ખરતરગમ્ભીના દાદાજી નામથી પ્રસિદ્ધ ચારે તથા અન્ય પ્રલાવક આચાર્ય હેઠોના સ્વતંત્ર ઈતિહાસિક જીવનચરિત્ર લખી પ્રકટ કરવામાં આવે, સર્વ પ્રથમ ચતુર્થ દાદાજીના ચરિત્ર સંબંધી વિપુલ સામની પ્રાપ્ત થવાથી “યુગપ્રધાન શ્રીનિનંદસુરિ” નામક અન્ય, આજથી ચાર વર્ષ પૂર્વે પ્રકાશિત કરવામાં આવ્યો હતો। તથાંતર શ્રીનિનંદસુરિનું મહારાજનું ગવેષણાપૂર્ણ ચરિત્ર તૈયાર કરવામાં આવ્યું, પરન્તુ પાછળાની પદ્ધતિલિયોમાં ઉલ્લેખાયેલી જીનેક ધરનાઓને ઈતિહાસની ફ્રેસ્ટી પર કસવામાં સમય અને સાધનોની વિશેષ અપેક્ષા જણ્યાઈ, માટે એ કામ અવિષ્ય ઉપર છોડી મુક્યું।

પ્રસ્તુત ચરિત્ર સામની

અતિશય પ્રલાવક ચારિત્ર ચૂડામણી દાદાસાહેબ શ્રીનિનંદસુરાનંદસુરિના ચરિત્રની આવસ્થક સાધન-સામની ન મળવાથી અમારા મનમાં સદ્ગુરૂ એક પ્રકારનો પદ્ધતાત્ત્વ રણા કરતો, પણ અન્તે અમને છૃપાદ્યાય શ્રીક્ષમાકલ્યાણુજીના જીનલંડારમાંથી ૮૬ પત્રની પ્રાર્થિત ગુર્વાવલી મળી ગઈ. ને જૈન સાહિત્ય અને ઈતિહાસની અમુલ્યનિધિ છે। એમાં ગુરુદેવના સ્વર્ગવાસથી ૪-૫ વર્ષ બાદ-એટલે શ્રીનિનંદસુરિના સમય સુધીની ધરનાઓનું વર્ણન મળી આવે છે। એ ઘરથી નિશ્ચિત થાય છે કે ધરનાઓ સાથે જ લખાયેલી એક પ્રકારની દૈનિની આધાર પર જ અનેલી આ ગુર્વાવલી છે, અતઃ એની પ્રચીનતા જીને પ્રામાણિકતામાં લેખાત્મક પણ જાંકાને સ્થાન નથી। યથપણી આ પ્રતિ ધણ્યાંયે સ્થાનો પર ખવાયેલી છે, પણ બીજી પ્રતિ ઉપલખ ન થવાથી પ્રસ્તુત પ્રતિને આદર્શ માનીને ચારિત્ર તૈયાર કરતું પડ્યું છે।

શ્રીયત મોહનલાલ દલીયંડ હેશાઈ સામ્પ્રાણિત “નૈન ગુજરાત કવિઓ” ના ભાગ ઉલામાં જ્યસાગર ઉપાધ્યાય રચિત શ્રીજિન કુરુક્ષણ-સૂરિ ચતુર્પદિકા પૂનાની ડેઝન કેલેજ પુસ્તકાલયમાં હોવાના સમાચારે અમોને મણ્યા કે તરતજ ત્યાંના મંત્રી મહેદ્ય સાથે પત્રઅનહાર કરી મૂળપ્રતિ હસ્તગત કરી, ગત માગશરમાં સિલાફટ આવતા સમય ઉપર્યુક્ત ચતુર્પદિકા આદિ પરિશીષ્ટ અને અન્ય ચોખ્ય બીજી સામગ્રી સ્વરૂપ આવસ્થક ટિપ્પણો વગેરે સાથે શ્રીમદ્ હરિસાગર સુરિણી ચુર્ણવલી વાળી નકલ તથા તેમનાં કરાવેલા અનુવાદની પ્રતિ આકાનેરથી સાથે લઈ આવ્યા। ગુરુદેવની સ્વર્ગતિથિ સમીપ હોવાને કારણે અન્ય અતિ શીધ લખી પ્રકટ કરવાની તીવ્ય આવના જાગૃત થઈ, એટલે તરતજ કેલેજન કાર્ય શરૂ કરી હેવામાં આવ્યું। અનેક પ્રકારની વ્યવહારિક અડયનો રહેવાં છતાં પણ ગુરુદેવની પૂર્ણ કૃપા હોવાથી ૪-૫ દિવસમાં ચરિત્ર લખાઈ તૈયાર થઈ ગયું।

નૈન ધીતિહાસિક સામગ્રી અને અમારો સમાજ

ગુરુદેવનું જીવન અર્થાતું ૬૦૦ વર્ષોનો પ્રાચીન ધીતિહાસ, ઉપલભ્ય ચુર્ણવલી વગર આવા ઇપમાં લખાવો અશક્ય જ હતો। એનું કારણ એક માત્ર એટલુંજ કે અત્યિહાસિક સાધન સામગ્રી જવલ્લેજ મળે છે, ગુરુદેવને સેંકટો પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી જેમાંની આજ તો માત્ર સાતથી આહ જ મળે છે, જ્યાં સુધી અમારા ધ્યાનમાં વાત આવી છે ત્યાં સુધી આ પુસ્તકમાં એ પ્રતિમાઓનો ઉલ્કેખ કરવો ચૂક્યા નથી। ગુરુદેવની રચનાઓ પૈકા ને મળી તેનું વર્ણન “અન્ધ-રચના” નામના પ્રકરણમાં આપ્યું છે। ધર્મિણે પ્રતિષ્ઠિત મૂર્તિઓ અને કૃતિઓ-માંથી કેવલ અદ્ય જ પ્રતિમાઓ અને રચનાઓ મળે એ અમારે માટે આછે દુર્ભાગ્યનો વિષય નથી। અમારી ઐરાગીને લાયી હણરો અન્યો નષ્ટ અપ્ય થઈ ગયાં। યવનરાજ્ય કાલમાં અનેક સુન્દર કળાપૂર્ણ અંદિરો જમીનહોસ્ત થઈ ગયાં। અવશિષ્ટ સામગ્રી પણ ઉચિત

શોધકોના અભાવને લાંબે દૈનિન્હન નાણ થઈ રહી છે અભવા તો અમો એના મહત્વથી જ અપરિચિત છીએ ।

પૂર્વ પુરુષોએ અમપૂર્વક સંચિત કરેલી સમૃતિની આ પ્રમાણે દુર્દીશા જોઈ અમારું હૃદ્ય પરિતાપની વિષમ જવાલામાં લસમ થઈ જાય છે । આવા મહત્વપૂર્ણ કાર્યમાં પૂર્ણત્યા મદદ આપવા માટે સેકડો સુનિ અને વિદ્ધાનોતી આવસ્યકતા છે, જેના અદ્દે આજ તો ગણ્યા-ગાંધ્યા વિદ્ધાનોને જ અમે આ પુનીત કાર્યમાં રત જોઈએ છીએ । એવા લોકો પર અમને આંસુ આવે છે જેની પાસે આવસ્યક સાધન બળ અને ધન હોવા છતાં પણ આજના પ્રગતિશીલ યુગમાં ચુપ થઈને જોડા છે ।

રાષ્ટ્રભાષા(ઢિંદી)માં જૈન સાહિત્યનો પ્રચાર નહિ બરોઅર છે. ગુજરાતી સમાજમાં જરૂર જગૃતિ છે, જ્તાં પણ વિશાળ જૈન સાહિત્ય માટે તો મણુમાં કશુ સમાનજ છે, હજુ અ-વેષણુ અને પરિશીળનની અત્યારે આવસ્યકતા છે, એ સ્વર્ણયુગ કયારે આવશે ? જ્યારે અમો ભારતના પ્રત્યેક સંઘાલયને જૈન સાહિત્ય રત્નમાલાથી વિભૂતિત જોડશું અને પ્રાચીન અવશેષોનો સંઘાલમણ “ભૂજિયમ” પણ દેખીશું. ક્ષમા કલ્યાણુણ કૃત પદ્ધાવલી અને જીવન પ્રલા પર વિચાર.

દાદસાહેબના સમ્બન્ધમાં અનેક અમલાર વિષયક પ્રવાહો પ્રચલિત છે, મહોર રામલાલજ યતિ કૃત ‘દાદજની પૂજા’માં અનેક વાતો લખી છે. પરંતુ પાછળની પદ્ધાવલિયોમાં વિશુદ્ધ ઐતિહાસિક વાતોનો અભાવ જેવામાં આવે છે. શ્રાન્જિનવિજયની સંગ્રહિત “ભરતરગચ્છ-પદ્ધાવલીસંગ્રહ”માં ઉ પદ્ધાવલિયો અને એક સૂર્ય પરંપરા પ્રશાસ્ત છપાઈ છે. અધારયમાં મોટી કૃતિ ઉપાધ્યાય શ્રિક્ષમા કલ્યાણુણ કૃત પદ્ધાવલી છે. આતું નિર્માણ સંં ૧૮૩૦માં થયું । તેને જેતાં જણ્યાય છે કે પ્રાચીન ગુર્વાવલી-જે અત્યારે તેમના ભંડારમાં છે. તેમની દૃષ્ટિમાં આવી નહીં હોય, જે આવી હોત તો ધખુંએ દંતકથાએ.

અને ખાં ધારણાએનું નિરસન થઈ જત અને તેઓ ચોતાની કૃતિ પદ્માવતીમાં પણ એઠે હપ્પેણ કરત. પદ્માવતીને આધારભૂત માનીને મુનિરાજ શ્રીયુદ્ધ મુનિજીએ “જિનકુશબળવનપ્રભા” નામની પુરિતકા પ્રગટ કરી છે। પ્રાચીન ગુર્વાવતીમાં વર્ણિત ઘટનાએ સાથે ને અન્તર પડે છે તે આ પ્રમાણે છે.

૧ શુરુહેવના જ્ઞનમ સંવતનો જૂનામાં જૂનો ઉદ્દેખ જ્યસાગર ઉપાધ્યાય કૃત “શ્રી જિનકુશબળસુરી ચૌપાઠ”માં છે। એમાં “જસુ તેર સેંતીસેં જ્ઞનમ”ને સ્થાને “તેરસે તીસે” થઈ જવાથી જ્ઞનમ સંવતનો આમક પ્રચાર થઈ ગયો। અરી રીતે ૧૩૩૦ સંવત કેાઈ પણ પ્રાચીન અંથ કે રાસમાં નથી, એટલે ૧૩૩૭ જ વાસ્તવિક રીતે જ્ઞનમ સંવત છે। પ્રાચીન ગુર્વાવતીમાં આચાર્યપદના સમયે ૪૦ વર્ષની અવસ્થાનું સૂચન છે, સુરિપદ ૧૩૭૭માં મળ્યું, એટલે જ્ઞનમ સંવત ૧૩૩૭ અરોધર છે.

૨ ક્ષમાકલ્યાણુજીની પદ્માવતીમાં લીમગાઠીમાં શેઠ લુચનપાલ દ્વારા નિર્માપિત ૭૨ હેવકુલિકાવાળા જિનમંહિરની પ્રતિષ્ઠાનો ઉદ્દેખ છે. કિન્તુ ગુર્વાવતીમાં સં. ૧૩૧૧ વૈ. શુ. ૧ને રોજ શેઠ લુચનપાલના દ્વયવ્યયથી મહામહોત્સપૂર્વક શ્રીજિનેશ્વરસ્થરિજીદ્વારા શ્રીમહાવીર પ્રભુની પ્રનિષ્ઠાનો ઉદ્દેખ છે।

૩ પદ્માવતીમાં જેસલમેરમાં જસથુવલ દ્વારા નિર્માપિત શ્રીચિન્તા-મણ્ય પાર્વતનાથ મંહિરની પ્રતિષ્ઠા કરવાનો ઉદ્દેખ છે। આ અન્યમાં ૫૪, ૪૫ સંવત ૧૩૮૩માં જેસલમેર પથારવા પર સ્વહરસ્ત પ્રતિષ્ઠિત પાર્વતી પ્રભુના દર્શન કરવાનો ઉદ્દેખ છે તે કદાય જુદી રહી હોય તેવે સંબંધ છે, કેમકે ગુર્વાવતીમાં જસથુવલવાળા પ્રતિષ્ઠા સં. ૧૩૨૧ જ્યેષ્ઠ સૂદી ૧૨ સે શ્રીજિનેશ્વરસ્થરિ દ્વારા થવાનો ૨૫૪ લેખ છે।

૪ પદ્માવતીમાં જાલોરવાળા પાર્વતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવાનું બખ્યું છે. અને ગુર્વાવતીમાં સં. ૧૩૮૩ જાલોરમાં સ્વપ્રતિષ્ઠિત

મહાવીર ભગવાનને વંદના કરવાનું સ્વયન છે, તથા દ્વાગણ્ય વદ એને પ્રતિષ્ઠાદિનો વિરાટ મહોત્ત્સવ થયાનું વર્ણિન છે ।

૫ ક્ષમા કથાણજીની પદ્માવતીમાં આગરાસંધના આયહથી સંપ્રસાયે શ્રી સંધસહિત શંતુજ્ય યાત્રા માટે જરૂર લાદના વહિ જેને દિવસે પાઠણ આબ્યાનું જણાયું છે । અતે આગરાના સ્થાને દિલ્હી જોઇએ અને તિથિમાં પણ ચાર (૫) દિવસનું અન્તર છે । જુઓ પ્રકરણ ઉજ્ઞું પૃ. ૩૨.

૬ પદ્માવતીમાં લખ્યું છે કે એમને ૧૨૦૦ સાંધુ ૧૦૫ સાધિયો હતી, આ કથન સત્ય જણાય છે । કારણ કે એમના હસ્ત દીક્ષિતોની સંપ્રયા પણ બહેળા પ્રમાણુમાં હતી, અને બીજું કારણ એ પણ છે કે એ સમયમાં રનશિષ્યોર્થ અતિરિક્ત બીજાના શિષ્યોને પણ વડી દીક્ષા ગર્ભનાયકજ આપતા ।

૭ પદ્માવતીમાં દ્વાગણ્ય વદ અમાસના દિવસે દેરાવરમાં સ્વર્ગવાસ અને સોમવતી પુર્ણિમાએ ગુરુદેવે પ્રથમ દર્શાન આપ્યાનો ઉત્કેભ આએંનો છે, ત્યારે શુર્વાવતીમાં દ્વા. વ. ૫ ગ્રિલકુલ સ૪૪ છે વિશેષ માટે પ્રકરણ ૫ મું જોવા વિનંતિ છે ।

૮ શ્રીજિનદુશલસ્થરિ જીવન પ્રભામાં ડાગા ગોત્રની ઉત્પત્તિ અને દાદળ દ્વારા ૫૦૦૦૦ રૂતન વૈન નિર્માણનું વર્ણિન છે ।

૯ હુપર સ્થાનિત અન્યમાં બૃહદ્ધિપાનિકામાં બંદનકુલકરૂત્તિર્જિન-કુશલસ્થરિકૃતા (શ્લોક ૪૩૭૬) ને ચૈત્યવંદન કુલક વૃત્તિથી લિન્ન લખી છે પણ અમારે મને એકજ કૃતિ છે ।

ગુરુદેવના જીવન ચરિત્ર સમ્બન્ધી વધારેમાં વધારે પ્રાચીન પદ્માવતિયે ભજ્યેથી ધણી નવી વાતો જાણવામાં આવી શકે તેમ છે । જ્યાસાગર ઉપાદ્યાયે સિન્ધ પ્રાંતના ભલિકબાહુપુરમાં ૭૦ ગાથાનો શ્રીજિન-

કુશલસ્કરિ રાસ રવ્યો હતો કે આ અન્ધના પરિશિષ્ટ ‘ગ’ માં આપવામાં આવ્યો છે। દરેક લખને સ્વાધ્યાયની સરળતા માટે તેમાંથી ૧૫ ગાથાઓનો સંક્ષિપ્ત રાસ બની ગયું જણ્યાય છે.

પ્રચલિત રાસમાં તે મેઠા રાસની ૧, ૮, ૬, ૫૮, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ગાથાઓ છે। સંચત ૧૫૦૫-આ. શ. ૮ શુક્રવારને રોજ ર૦ નીલકંઠની લખેલી પ્રતિમા ‘આઠમી ગાથા નથી। એટલે ૧૪ ગાથા જ રહી ગઈ.

ને આ ચરિત્રાન્ધતું લખાણું અમારા મૂળ સ્થાન બીજાનેરમાં થયું હોત તો વિસ્તારપૂર્વક લખાત અને છતિહાસ વિષયક સામયીનો સમુચ્ચિત ઉપયોગ થાત, પણ સિલહટમાં લખાવાથી અમે પૂરી રીતે ઔતિહાસિક સાધનોનો ઉપયોગ કરી નથી શક્યા, બીજુ આવૃત્તિમાં તેમ કરીથું.

આલાર

શ્રીજિનયંકુશરિણ ચતુ સમાનિકઃ (ચરિત્ર નાથક શ્રીજિનકુશલસુરિણું કૃત) ને પરિશસ્થ અભિમાં આપી છે. તેની મૂળ નકલ લીખડી જ્ઞાન બંડારમાં છે. અમને પૂજ્ય મુનિ શ્રીયુદ્ધિસાગરજી તરફથી પ્રતિ મળી હતી અતઃ તેમનો આલાર માનીએ છીએ. શ્રીજિનકુશલસુરિ ચતુષ્પદિકાની પ્રતિલિપિ ડેક્કન ડાલેજના પુસ્તકાધ્યક્ષ તરફથી મળી, નેને અમે ધન્યવાદપુર્વક આ અન્યમાં પ્રકાશિત કરી રહ્યા છીએ. ચરિત્ર લેખન કરે 'ચૈત્યબંહન કુલક વૃત્તિ' ની પ્રતિ અમારી પાસે નહોંતી અતઃ ઉ. સૂર્યમલજી યતિએ ઉપરોગ માટે આપી હતી. તેમને પણ ધન્યવાદ : આપીએ છીએ.

આ પુસ્તકની સારગાર્ભિત પ્રેરતાવના સુપ્રસિદ્ધ ભતિહાસ પુરા તત્ત્વવેતા અધ્યેત્ય શ્રીજિન વિજયજીએ લખી આપવાની કૃપા કરી છે. તર્ફથી અમે તેમના પ્રતિ કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ.

દાદા સાહેબને થયે આજે ૧૦૬ વર્ષ થઈ ગયાં અતઃ એમનું બધ્યાર્થચિન્દ મળું મુશ્કેલ છે, પરંતુ એમના રવર્ગવાસ બાદ ૮૭ વર્ષ પછી પ્રતિષ્ઠિત માલપુરાના ઝડપમદેવ ભગવાનના માહિર સ્થિત શ્રીજિન કુશલસુરિણુ મૂર્તિનો* ડેટો લેવાનું કાર્ય શ્રીનથમલજી સાહેય ડેટો આઝે કરી આપવાની કૃપા કરી છે અતઃ એમને ધન્યવાદ આપવાની સાથે અમે અમારું કિચિતું વક્તવ્ય સમાપ્ત કરીએ છીએ.

નિવેદન

અગારચેન્દ્ર નાહદા

અંવરલાલ નાહદા

*મૂર્તિ પર આ પ્રમાણે લેખ ઉત્કોષ્ટુત છે—

- १ સં. ૧૪૮૬ વર્ષે જ્યેષ્ઠ શુદ્ધ ૫ શુક્ર સા. રામદેવભાર્યા મૂલાદે પુત્ર।
- ૨ સા. સાહણકેન બ્રેયોર્થ શ્રીજિનકુશલસુરિ મૂર્તિઃ કા૦
- ૩ શ્રીસ્વરતરગઢે શ્રીજિન વર્દ્ધનસુરિ પણે પ્ર૦ શ્રીજિન ચન્દ્રસુરિભિઃ ||૦

પ્રસ્તાવના



જીવેતાંભર જૈન સમુપ્રદાયના જેટલા અચ્છોના ધર્તિહાસ પ્રાપ્તેના
આય છે તે બધામાં ભરતરગચ્છનો ધર્તિહાસ વિશેષ વિસ્તૃત અને વિવિધ
સાધન સમ્પન્ન છે। ભરતરગચ્છીય પદ્માવતિયોના સંઘ્યા પણ સારા
પ્રમાણુમાં મળે છે અને રચનામાં પણ યેષટ્ પુરાતન પદ્માવતિયો શિવાય
ભિન્ન લિન પ્રકારની સંસ્કૃત, પ્રાકૃત અને દેશી ભાષામાં નાની મોટી
શુવ્વાવતિયો, રતુતિયો અને રાસ ભાસ આવિ કૃતિયો પણ અનેક
ઉપલબ્ધ થાય છે। અન્ય પ્રશસ્તિયો, પુરુષ પ્રશસ્તિયો, મહિર
પ્રશસ્તિયો અને સુર્તિયો તથા પાહુડાયો પર ઉત્કીર્ણ નાના મોટા લેખો
પણ સેંકડોની સંખ્યામાં નિધમાન છે। આ બધા સાધનોનો વ્યસ્થિત
સંયુક્ત સંકલન કરવામાં આવે અને સુંદર રીતે સમ્પાદન કરી પ્રકાશિત
કરવામાં આવે તો ભરતરગચ્છના વિસ્તૃત ગૌરવનો પ્રભાવોત્પાદક અને
વાસ્તવિક ધર્તિહાસ વિદ્ધાનો સંમુખ ઉપસ્થિત કરી શકાય તેમ છે।

અમને આ જોઈ આનન્દ થાય છે કે આ ગચ્છના એક અનુષ્ઠાનિક-
શાલી બન્ધુ-યુગલ-સાર્થકી અગદયંદ્રુ નાહટા અને લંબરલાલજ
નાહટા આ હિંદુમાં ખુઅજ પ્રશાસનીય પ્રયત્ન કરી રહ્યા છે। અને
પૂર્ણાચાર્યો તથા પૂર્વજનોની કીર્તિને પ્રકાશમાં લાવવાનું પુણ્ય ઉપોર્જન
કરી રહ્યા છે।

ઇતિ: પૂર્વ શ્રીજિનયંત્રસ્તરિ ચરિત્ર અને ઐતિહાસિક જૈન કાવ્ય-
સંયુક્ત નામક એ અન્યો સુંદર રીતે સમ્પાદિત કરી તેઓ પ્રકાશિત કરી:
સુધ્યાં છે। હવે દાદી શ્રીજિનકુશણસ્તરિનું ચરિત્ર પ્રકટ કરી રહ્યા છે।
એ સિવાય પણ આ બન્ધુ યુગલ વિભિન્ન પત્ર-પત્રિકાઓમાં સમય
સમય પર નાના મોટા નિષ્ઠાંધો પ્રકટ કરી ધર્તિહાસના વિદ્ધાનો માટે

-નવીનતમ સામગ્રી પિરસી અલિનન્ટનીય ઉદ્ઘમ કરતા રહે છે । રાજુ-
સ્થાનના ગામડાઓમાં પરિષ્ઠમણું કરી જુના હસ્ત લિભિત અન્યો-પત્રો
આદિ સામગ્રીનો વિશાળ સંગ્રહ પોતાના નિવાસ-સ્થાને કર્યો છે અને
કર્યો જાય છે । પોતાના વ્યવસાયી જીવન નિમિત્તે અંગાળ અને આસામ
નેવા દૂરવર્તી પ્રદેશોમાં બ્યાપારિક કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં પણ
આ અનુધુ યુગલ નિરંતર સાહિત્યક સેવામાં પોતાનો યોગ આપી રહ્યા
છે અને યથા શક્ય તન મન એવાં ધનનો સદૃષ્યોગ કરતા રહે છે.
એ અન્ય નૈન અનુધુઓ માટે અવક્ષ્ય અનુકરણીય અને અનુમોદનીય છે.

શ્રી જિનકુશલસૂરિણું આ ચરિત્ર પ્રાયઃ ઐતિહાસિક તથ્યોથી
પરિપૂર્ણ છે । વિશુદ્ધ ઐતિહાસમાં ચમત્કારિક અને અમાતુષિક ઘટના-
ઓની કોઈ પ્રતિષ્ઠા નથી । પરંતુ અમારા દેશના પ્રતિહાસના ઉપાદાન
પ્રાયઃ ચમત્કાર મય વર્ણનથીજ એતપ્રોત છે । અમારા બૌદ્ધિક અને
માનસિક સંસ્કાર પરાપર્વથી આવા ચમત્કારમય વાતાવરણુથી એટલાં
વ્યાપત છે કે જે અમારા કોઈ પૂર્વન્જ કે મહાપુરુષના જીવનદ્વારાંતમાં
કોઈ ચમત્કારમય ઘટનાનો નિર્દેશ જે અમો ન જોઈ શક્યે તો
અમને એ વ્યક્તિત્વી વિશેષતામાં કોઈ વિશેષ પ્રકારની શક્ષાજ ઉત્પન્ન
થતી નથી. માટેજ અમારા પૂર્વન્જેના છતિહાસ આદેખનમાં પદ પદ
પર ચમત્કાર અને અલંકારના દર્શન થાય છે અને ખુદ્ધ તથા નિયાર
શક્તિદાર અથાદ તત્વો પર પણ શક્ષ શક્ષ અને સંસ્કારના કારણે તેમાં
અકિંત રાખવાની ભાવના જાગૃત થાય છે ।

શ્રી જિનકુશલસૂરિણું આ ચરિત્રમાં એવી કોઈ ભાસ ચમત્કારિક
ઘટનાનો નિર્દેશ દર્શિગોચર થતો નથી અને પ્રાયઃ જેટલું વર્ણન છે
તે અનુધુયે ઐતિહાસિક વાસ્તવિકતાનું વિધાયક છે । ચરિત્ર લેખકોએ
“સ્વર્ગવાસ પણી” વાળા પ્રકરણમાં આચાર્ય મહારાજના પ્રભાવતું
મહત્ત્વ બતાવવા માટે થોડાંક ચમત્કારિક વૃત્તાન્તોનો ઉદ્દેશ્ય કર્યો છે પણ
એનો સમ્બન્ધ ચરિત્રનાયકના પોતાના માનવી જીવન સાથે કશોયે નથી । તે

બધીએ મૃત્યુ પછીની વાતો છે ને તેમના ભક્તોએ પ્રસ્તુત કરી છે । શ્રાજિનંડુલસ્થરિજીના જીવન સાથે સમબન્ધ રાખવાવણી બધીએ વ્યક્તિત્વ અને પ્રવૃત્તિએ પ્રાયઃ સમકાળીન ઉલ્લેખો અને પ્રમાણો વડે સિદ્ધ થાય છે તેમ સમર્થન પણ મળે છે । એટલે આ ચરિત્ર એક પ્રકારે શુદ્ધ ચલિહાસ સિદ્ધ જીવન વર્ણાન છે । એમાં લેશ પણ શાંકા નથી: કે શ્રાજિનંડુલસ્થરિજી ઉત્કૃષ્ટ ચારિત્રવાન અને પ્રમાવશાળી પુરુષ હતા. એવું ન હોત તો ખરતરગંધાતુથાયી વર્ગમાં આજે સેકંડો વર્ષોથી તેમના તરફ ને ઉત્કૃષ્ટ ભક્તિ અને અધ્યા પરંપરા ચાલી આવે છે તે ન હોત.

આ ચરિત્રના પરિશિષ્ટ (૩) માં ને કૃતિ આપવામાં આવી. છે તેના વર્ષાનથી શાત થાય છે કે મારવાડ, મેવાડ, માલવા, ગુજરાત કાર્ડિયાવાડ, સિંધ, કર્ણાટક, પંજાબ અને દિલ્હી આહિ પ્રદેશોના કેટલાંચે. સ્થાનોમાં, જેની સંપ્રાય એકસે આઠ થાય છે-એમના સ્તુત્ય અનેલાં છે. અને ત્યાં ભક્તો એમના ચરણુ સ્થાપનાની શ્રદ્ધા પૂર્વક પૂજા-અર્ચા ફરે છે । એ લક્ષ્ણનોની ભજયું આશા છે કે એમની ઉપાસના કરવાથી મનોવાધિતની સિદ્ધિ થાય છે એવી અધ્યા અને તદ્વસાર સિદ્ધિની પ્રાપ્તિ એમના ઉત્કર્ષ ચારિત્રની શુદ્ધિકા છે । ચારિત્ર બળ સાથે એમનામાં શાન બળ પણ એવું જ ઉચ્ચ કાઢિનું હતુ. આ વાત એમના અન્યને રત્નોના સુક્રમાવલોકનથી સિદ્ધ થાય છે । નાની મોટી કૃતિએ ને ઉપલબ્ધ થાય છે તે પરથી જાણી શકાય છે કે સંસ્કૃત, પ્રાકૃત અને પ્રયલિત દેશી ભાષાઓ પર તેમનું ભારે પ્રભુત્વ હતું । કવિત્વ શક્તિ પણ સુરિજીમાં ધણી જિતમ પ્રકારની હતી । પ્રસ્તુત ચરિત્ર લેખકોએ આમાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય અલંકાર નાટક, જ્યોતિષ, મંત્રતંત્રાહિ અનેક વિદ્યાઓમાં સિદ્ધ હરત હોવાનો ને ઉલ્લેખ કર્યો છે એમાં કંઈક અત્યક્તિનો અંશ ભલે હોય પણ એમાં અસંભવ નેવું કંઈક નથી.

એમની નહાની મોટી અનેક અન્ય રચનામાં ચૈત્યવંદન કુલકૃતિ સુખ્ય છે, એ ટીકાનો સ્વાધ્યાય કરવાનો અમને પ્રસંગ મળ્યો છે, એના.

અવલોકનથી જણાયું કે એમનામાં ફરજિત અને વડતૃત્વ. આ એ પ્રકારની અનેડ શક્તિઓ વિધમાન હોવી જોઈએ। આ વૃત્તિમાં પ્રસંગવસ્તાત કેટલીક કથાઓ લખવામાં આવી છે તેમાં તેમનું પાંડિત્ય અને પ્રગતા સૂચક અમલકારિક પંડિતઓ રથાન રથાન પર મળે છે। શુગાલ (શિયાળ) અને સર્પપુષ્ટ દ્વારાન્ત જેવા ભાળપ્રિય દૌદિક આભાષુકેને પણ કેવી. મનોરમ અને સુંદર રીતે પદો તથા આલાંકારિક વાક્યો દારા ગુણ્યાં છે, જેને જેતાં સહૃદયોનું છુદ્ય ચકિત થઈ જાય છે. કંઈકા તો યાય છે કે અહીં જરા વિસ્તાર સાથે ઉપર્યુક્ત વૃત્તિમાંથી પાંડિત્ય નિર્બાંક યોગ્ય અવતરણો ઉકૂટ કરું, પરંતુ આ નાની સરખી પુરિલકાની મોદી ભુગ્ભિકા લખી એના ફને વધારવું એટે નાના માથા પર મોદી પાંચી રાખવા જેવું અસંગત લાગશે એ ભયથી એ કેલ જતો કરવો પડે છે.

અન્યમાં આચાર્ય મહારાજે સિદ્ધસેન દ્વિબાકર અને પરમાર્થત મહાકવિ ધનપાલની કથાઓ લખી છે જેમાં એમની કંઈક અન્તિહાસિક પ્રિયતા પણ દૃષ્ટિગોચર થાય છે. નૈતન સમાજમાં પારસ્પરિક એકતા અને સમાતાનો વ્યવહાર જોઈએ આ વાતનું પણ એમણે સ્પષ્ટ વિધાન કર્યું છે—જે વર્તમાન જૈન સમાજને “સાધ્મિક રીત્યા” મનન—અતુકરણું યોગ્ય છે। આ વિષય ઉપર “સાધ્મિક વાતસદ્ય” વાળા પ્રકરણમો તેમણે કર્યું છે કે—જૈન ધર્મનું અતુષ્રત્તન કરવાનાના સર્વ મનુષ્યોએ પરસ્પર સપૂર્ણ બન્ધુભાવે અને સમાન વ્યવહારથી વર્તવું જોઈએ. પણ જેને કોઈ દેશ અથવા કોઈ જાતિમાં કેમ ન ઉત્પન્ન થયો હોય, જે કોઈ ભાષ્યકાર મંત્રનું સમરણ કરે છે, તે જૈન છે અન્ય જૈનનો અન્ધું છે માટે એના સાથે કોઈ પણ પ્રકારનો લેદ ભાવ ન રાખવો જોઈએ, વૈર વિરોધ પણ ન કરવો જોઈએ. ધાર્મિક એકતાની દૃષ્ટિએ આ વિચાર કેટલા ઉદાર અને અતુકરણીય છે સાધ્મિક વાતસદ્યના વિષયમાં શ્રીનિનદુશાલરિસ્થુલ્લતું વિધાન આ છે “તથા સ્વપુત્ર-મિત્ર કલત્રાદિ બન્ધુભોડપિ સાધ્મિકેષુ

स्नेहबन्धः प्रचुरतरो विद्येयः, यत उक्तं—

साहस्रिमयाओ अहिंयं, बंधुसुयाईसु जाण अणुराओ

तेसि न हु सम्मतं, विक्षेयं समयनीईए ॥१॥

तथा ये भिन्नभिन्नजातयो भिन्नदेशसमूतयो भवन्ति ते
जिनधर्मपपन्नाः परस्परं बान्धवा एव, तथा चोक्तं-
अन्नन्नदेसजाया, अन्नन्नदेसवड्डियसरीरा
जिणसासणं पवन्ना, सव्वे ते बंधवा भणिया ॥२॥

तम्हा सव्वप्पयत्तेण, जो नमुक्कारधारओ ।

सावगो सो वि दट्टब्बो, जहा परमबंधवो ॥३॥”

જુઓ ચैत्यવंહन કુલક વृત्ति પૃ. ૩૨૩-૪

કुथवस्सरिजुनी यरथ પૂજા કરવावाणા ભક्तजનો જે તેમના
ઉપરુક્ત કથનનું ખુદ્દિપૂર્વક અનુપાતન કરે તો થડ પૂજાનું વિશેષ
ક્રિયાપ્રાપ્ત કરી શકે છે તેમ સમય નૈન સમાજનું યા એભામાં એઝું-
પોતાના ગચ્છનું તો અવસ્થય ગર્વરવ વધારીજ શકે છે ।

અન્તમાં સાહિત્યપ્રિય ભાઈ શ્રી અંવરલાલ નાહટાએ આ પુસ્તિમના
પ્રારંભમાં એ ચાર પંક્તિઓ અવસ્થય લખવાને માટે સાચે અનુરોધ
કરી, આપણું પૂર્વાચર્યોની સુતિ પૂજા કરવામાં મને પણ સહૃદોગ
આપવાનો જે અવસર આપ્યો તદ્વારા હું તેમનો કૃતરા છું અને આશા
રાખું છું કે આ નાહટા બન્ધુએની માફક અન્ય નૈન બન્ધુએ પણ
નૈન સાહિત્ય અને ધતિહસને પ્રકાશમાં લાવવા માટે યથાશક્તિ-પ્રયત્ન
કરે કરવે ધતિશભ ।

વૈશાળી પુષ્ટેમા ૧૯૬૬

અનેકાન્ત વિદાર, અમદાવાદ.

}

જિનવિજાચ

श्रीपालचरित्र-द्वादशपर्वकथा-सुसढचरित्राचनेक संस्कृत

शोकबद्धग्रथमणेता—

उपाध्याय श्रीअलंधमुनिजी महाराज रचित

गुरुदेवस्तुति—

स्वात्मानं वरसंवरेण तपसा सम्भावयन् यो गुरु
रार्थक्षेत्रगतं महान् प्रतिपुरं सम्पावयन् भूरिशः ।

भव्यप्राणिगणान् विवोध्य सुपथे द्वास्थापयच्चार्हते,
जीयाच्छ्रीकुशलारुबसूरिमुगुरुः स्व्यातः सतां वत्सलः ॥१॥

येषां देशनया धनैः सुविहितैः वृत्त्युतमोपासकै—
रहद्वर्मपरागशुद्धहृदयैः सङ्घाश्च निष्काशिताः ।
नन्तु स्थावरज्ञमामलमहातीर्थानि पूतानि च,
जीयासुः कुशलार्यसूरिकुशलास्ते भासुराः सत्तमाः ॥२॥

शिष्यत्वेन च दीक्षिता भविजनाः संवेगरज्ञात्मिताः,
बैरिद्वैर्मुनिपुज्ज्वैश्च बहुशश्चत्यपतिष्ठाः कृताः ।

येषां सन्ति महाप्रभाविचरणान्यद्यापि पुर्यादिषु,
देवासुः कुशलं जिनादिकुशलाचार्या सदा ते मम ॥३॥



अर्खलक्ष नूतन आवक विधायक चरित्र नायक
हाहाश्री जिनकुशाणसुरिल महाराज
पापाशमूर्ति आदिनाथ महिर-मालपुरा (नवपुर २८)

દાદા શ્રી જિનકુશલસૂરી

પ્રથમ-પ્રકરણ



જન્મ અને દીક્ષા

ગાટપ્રભાવી, પરમતારક, કામિતકલ્પતરુ,
લક્ષ્માજનષ્ટસલ, પરમપિતામહુ આચાર્ય-
વર્ય શ્રીજિનકુશલસૂરિજી મહારાજ જૈન

શાસનના એક અત્યંત સુપ્રતિષ્ઠિત અને સુપ્રસિદ્ધ મહાપુરુષ
હતા. એમને જૈન સમાજના આભાલવૃદ્ધ ખધાએ હાઢાસાહે-
અના નામે એળાખે છે. ભારત વર્ષના એકેએક ખુણ્યામાં એમના
સમૃતિ મંદિરે, કયાંક પ્રતિમા અને બાકી સર્વત્ર પાહુકાએ
પ્રતિષ્ઠિત છે. જે એમની મહાન् વ્યાપક પ્રતિષ્ઠા-માન્યતાનાં
ઘોટક છે. મહાપુરુષેને શોભા પમાડે એવા એમના શુણોઝું

વર્ણન કરતાં એવાં સેંકડો સ્તવન-સ્તુતિ-સ્તોત્રો વિવિધ ભાષા ઓમાં નિર્માણ કરી અનેક પ્રતિલાસંપત્ર સુકનિયો. પોતાની હાઈક અક્ષિતકુસુમાંજલિ સમર્પિત કરી કૃતકૃત્ય થયા છે, એવા શાસનપ્રલાબક ગ્રાતઃસ્મરણીય શુરૂહેવના પરમપવિત્ર જીવન-ચરિત્રને જનસાધારણુ સમક્ષ પોતાની નૈતિક ઉન્નતિ માટે મૂકવાનો આ અમારો લઘુ પ્રયાસ છે. અમે આશા કરીએ છીએ કે આ પ્રયાસથી સર્વ સાધારણુ લાલાન્વિત થશે.

૭૮મ

રાજસ્થાનની વીરભૂમીએ અનેક નરવીરો, નરરતનો અને આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રવાહુને વેગ આપનાર ધર્માચાર્યોને ઉત્પન્ન કરી સ્વકીર્તિકૌમુદી ચારે દિશાઓમાં વિસ્તારી છે. અહીંના ધર્માચાર્યોએ મરુસ્થળ જેવા પ્રદેશમાં પણ માનવસંકૃતિના ઉચ્ચ્યતમ સિદ્ધાન્તો વિકસાય્યા હતા. અને સ્વલાવિકનિર્મણ ચારિત્રના અણે મોટમોટા રાનામહારાનાઓ પર પણ પોતાનો પ્રલાવ પાડી જીવ ડિંસાનો નિષેધ કરાયો હતો. તે ઉપરાંત ધર્માચાર્યોને જૈન ધર્મની દીક્ષા પણ આપી હતી. “થથા રાના તથા પ્રણ”ની ઉકિત પ્રમાણે તે સમયમાં જૈન ધર્મનો પ્રલાવ રાજસ્થાન પ્રણમાં સર્વ-સાધારણુ સમાજમાં પણ જખરદસ્ત હતો આજે પણ ત્યાં આપણુને એ અનુભવ થાય છે.

મરુસ્થળ દેશના સમિયાળ્યા(ગઢસિવાણ્યા) ગામમાં છાંકે^૧

૧ આ ગોત્રનાં શાહ ઉદ્ડરણ શેઠ શ્રીજિનપતિસ્થરિજીના સમયમાં ખરતરગંગાનુયાયી થઈ ગયા હતા; આ સંબંધમાં અમારા સંચિહ્નમાંના એક પ્રાચીન પત્રમાં મનોરંજક પણ ઐતિહાસિક વર્ણન વર્ણિત છ,

ગૌત્રીય મંત્રો શ્રીહેવરાજના પુત્ર મંત્રીરાજ શ્રીજેસલ-જેદ્હાગર નિવાસ કરતા હતા, એમની ધર્મપત્ની સુશીલા પતિલક્ષ્મિ-મરાયણું જ્યંતશ્રીની રતનકુલ્કીથી વિ. સંવત् ૧૩૩૭ માં આપણા ચરિત્રનાયકનો જન્મ થયો ને કર્માયુકુમારના નામથી સમેાધિત થયા. શુક્ર પક્ષની દ્વિતીયાના ચંદ્રમાની પેઠે અહુર્નિશ વૃદ્ધિ પામતા સ્વજનોના ચિત્તને આદહારિત કરવા લાગ્યા.

જ્યારે આપ હશ વર્ષના થયા ત્યારે ભરતરગચ્છનાયક પરમપ્રભાવક સુવિહુતશિરોમણિ આચાર્યવર્ય શ્રીજિનપ્રભોધ-સૂરિજીના પદ્ધત કલિકાલકેવલી **“શ્રીમાન જિનચંદ્રસૂરજિનુ”**

નેની પ્રતિલિપિ પરિશિષ્ટમાં આપનામાં આવી છે, શ્રીજ કુશલ-સૂરિજ અને એમના ગુરુ શ્રીજિનચંદ્રસૂરિજ. તથા શ્રીજિનપદ્મસૂરિજ, શ્રીજિનલક્ષ્મિસૂરિજ આહિ મહાન પ્રભાવક આચાર્યો આજ વંશના હે. ભરતરગચ્છની વેગડ શાખામાં તો અધિકાંશ આચાર્યો આજ વંશના હતા. વર્તમાનમાં પણ છાન્ડે જોત્ર ભરતરગચ્છાન્યાથી છે, આ જોત્રની એક એતિહાસિક પ્રશારિત અમદાવાહી પ્રકાશિત “નૈત પ્રશાસ્ત સંગ્રહ”માં પ્રગટ થઈ છે, બાયુ પૂર્ણચંદ્ર નાહર સંગ્રહિત “નૈત લેખ સંગ્રહ” લેખાંક ૨૫૦૫ માં આ જોત્રની મહત્વપૂર્ણ સામગ્રી મળે છે.

૧ ગૃહસ્થાવાસમાં આપ શ્રીજિનકુશલસૂરિજના પિતૃબ્ય (કાકા) હતા. નેમકે ચરિત્રનાયક હૃત “જિનચંદ્રચતુસમિતિકા” અન્યપરથી ઇલિતથાયછે આ અન્યના એતિહાસિક સાર અમારા “એતિહાસિક નૈત કાંય સંગ્રહના” સાર વિલાગ (પૃ. ૧૧)માં આપેલ છે અને મૂલ આ અન્યના અંતિમ લાગમાં પ્રકાશિત છે. “યુગપ્રધાનાચાર્યિંગુર્વાલી”માં એમનું જીવન વિગતવાર વર્ણિત્વું છે. ને છતિહાસની દર્શિએ મહામૂર્ખયાન છે. જૈસલમેર નરેશ કર્ણહેવ નેતરસિંહ, સમિયાણા (ગઢસિયાણા)ના સમરસિંહ શીતલહેવ આહિ આપના પરમભક્ત હતા. આપે સમાર, કુતુંઘીનને પોતાના

શુલાગમન સમિયાણુ (ગઢસિવાણુ) માં થયું શુરૂહેવના અમૃત-
મયી ધર્મપદેશનો પ્રભાવ બાળકના સુકુમાર મસ્તિષ્ક પર એવો
પડયો કે જેથી એચો સાંસારિક-ભौતિક કાર્યો પ્રતિ ઘૃણા કરવા
લાગ્યા, એમણે તત્કષણ પોતાનું સમય જીવન સંયમારાધનમાં વ્ય-
તીત કરવાનું નિશ્ચિત કર્યું. કહેવાનું તત્પર્ય એટલું જ છે કે
એમના મસ્તિષ્ક અને હૃદયમાં એવી ડેસ લાગી કે પૂર્વજનમના
સુંદર સંસ્કારોનો પ્રવાહ આંતર્મુખી પ્રવાહિત થવા લાગ્યો,
જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળભૂત તત્વોપર એમતું
ધ્યાન ચોંટયું. નિવાસસ્થાને આવી માતેશ્વરી જ્યંતકીને
વિનયયુક્ત વચ્ચેનો વડે વિજસિ કરી કે “માતેશ્વરી ! શુરૂહેવના
સહૃપહેશથી પ્રતિષોધ પ્રાસ કરી સંયમમાર્ગ અહુણ કરવાની
મારી પોતાની આંતરિક પ્રભલ મનોભિલાખા છે માટે હે
માતાજી ! કૃપા કરીને મને આજા આપો જેથી હું મારું
તથા જગતમાં નિવાસ કરતા એવા અનેકો જીવેનું પણ
યત્કિંચિત કલ્યાણ કરી શકું.” લાડકવાયા પુત્રનાં આવાં
વચ્ચેન શ્રવણ કરવા માતા જરાયે તૈયાર નહોતી. એટલે
તેણીના હૃદયપર માર્મિક આધાત થયો, કહેવા લાગી કે
“વત્સ ! તારાં વચ્ચેન ધ્યાણાંજ પ્રિય અને સુંદર છે પણ મારા
માટે એક માત્ર તુંજ આધાર છે, તારા વિના મારું જીવન
અસ્તર છે, વળી તું તો હમણું બાળક છે. ચાર્નિ પાલન
કરવું એ તારા જેવા સુકુમાર બાળકના માટે અતિકઠણ છે.
સંયમ માર્ગમાં પગપગ પર અનેક કષ્ટો વહેરવાં પડશો. પરીષહેણા

સહયુણોવડે આશ્રમાનિત કર્યો હતો. ખરતરગંધની પદ્માવલિએ તથા
પ્રાર્થીન ગીતોમાં આપ કલ્યાણકેવલી વિરોધભૂત થી વિલૂષ્ણિત છે.

સહેવાં પડશે, માટે અત્યારે એ વિચારને છોડી સુખ પૂર્વક ધરમાં રહે. તારાથી તો મને ધણી ધણી આશાઓ છે. કોઈ સુલક્ષણસમ્પત્તા-કન્યાને પુત્ર વધુના ઇપમાં જેવાની મારી ઉત્કંઠા છે. ઉપરનાં શબ્દોમાં માતૃહૃદયની વાસ્તવિકતા પ્રકટ થાય છે. ખરેખર સર્વસાધારણુત્યા પ્રત્યેક નાગરિક સીની પોતાના જીવનમાં મોટામાં મોટી બે જ અભિવાષાઓ હોય છે. “એક તો કન્યા ધરમાં આવે અને બાળ જમાઈ તોરણ વીધે.”

પાઠકો ! જરા વિચાર તો કરો. કે આ નાની વચ્ચના બાળકની આત્મકલ્યાણુકર માર્ગમાં જેડાવાની કેટલી તીવ્ર મનઃકામના છે ? સારી રીતે જે આપણે વિચાર કરશું તો જણાશો કે બાળક અને માતા બન્નેનો ઉદ્દેશ તો સુખ-પ્રાપ્તિ હુતો પણ બાળકનું ધ્યેય માતાની અપેક્ષાએ વિશેષ વ્યાપક હતું, એટલે કે સ્થાયી સુખની પ્રાપ્તિ માટે હતું.

માતાના મોડયુક્ત વચ્ચનો સાંભળી કરમણુકુમારે પોતાનો સુદૃઢ નિશ્ચય આ શબ્દોમાં વ્યક્ત કર્યો—“માતાલુ ! આ સંસારમાં કોણું કોનું છે ? બધાંયે સ્વાર્થનાં સંગી છે. ધણીવાર આ કૌદુર્યિક સંબંધે પ્રાપ્ત કરી આત્માની ઉજ્જ્વલિને બહલે સંસારનીજ વૃદ્ધિ કરી છે. માટે હુવે એવા સંબંધેમાં મારી લેશમાત્ર પણું આસ્થા નથી. હું તો જીવસવમાં એકાન્ત હિતકારી કાગવતી પ્રવન્યાનોજ સ્વીકાર કરી આત્મકલ્યાણુ કરીશ. જે સમય અત્યારે વ્યતીત થઈ રહ્યો છે તે પાછો આવનાર નથી. આયુષ્ય તો ક્ષણલક્ષણમાં ઘટી રહ્યું છે. કેળું જણું કાલે શું થશે ? માટે કૃપા કરીને શીગ્રતાથી અનુમતી આપો.” પુત્રના આત્મકલ્યાણુર્થે આવા નિશ્ચયાત્મક વચ્ચનોથી માતાની ધરછા ન હોવા છતાં પણું આજા આપવીજ પડી.

દીક્ષા

વિ. સં. ૧૩૪૭ ફ્રાગષુ શુદ્ધ ૮ શુભ મુહૂર્તમાં શ્રીજિનયંદ્રસૂરિલુના કરકમલોદ્વારા ધામધૂમ પૂર્વક કરમાણુકુમારે દીક્ષા અંગીકાર કરી અને કુશલકીર્તિનામ રખવામાં આંધુઃ આ પ્રસંગે શ્રીદેવવલ્લલાલ તથા ચારિત્રતિલક સાધુ અને રત્નશ્રી સાધ્વીની દીક્ષા તથા માલારોપણ આદિ સુકારોં થયાં, સાથે સાથે ચૌહાણ શ્રીસોમેશ્વર મહારાજ દ્વારા કરાવેલા વિસ્તૃત પ્રવેશ મહોત્સવ સહિત શ્રીશાંતિનાથ સ્વામીની સ્થાપના પણ સાઠો ખાહુડ. લાંંલીમા. લાં. જગસિંહ. લાં. એતસિંહ દ્વારા નિર્માપિત ચૈત્યમાં કરવામાં આવી.

વિદ્યાધ્યયન

તે સમયમાં આચાર્યવર્ય શ્રીજિનયંદ્રસૂરીશ્વરલુનો શિષ્ય સમુહાય ફોળા પ્રમાણમાં હતો. જેમાં ઉચ્ચકેટિના વિદ્ધાન અને અન્યકારે પણ વિશોષ પ્રમાણમાં હતા. સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષાઓના પ્રકાંડ વિદ્ધાન મુનિપુરુંગવોની છગ્રછાયામાં કુશલકીર્તિનો વિદ્યાધ્યયન પ્રારંભ થયો. અંધ્યાપકોમાં પ્રધાનપદે 'વિવેકસમુદ્ર ઉપાધ્યાય કચોવૃદ્ધ ગીતાર્થ' અને પ્રકાંડપ્રતિલાન

૧ આ ઉપાધ્યાયલુણે શ્રીજિનયંદ્રસૂરિલુણ મહારાજ પાસે વિ. સં. ૧૩૦૪ મિતિ વૈશાખ સુદ્ધ ૧૪ના રોજ દીક્ષા અદાણ કરી હતી. એજ આચાર્ય મહારાજે વિ. સં. ૧૩૨૩ ભીજ જ્યેષ્ઠ શુદ્ધ ૧૦ના રોજ જેસલમેરમાં વાચાનાચાર્ય પદથી અલંકૃત કર્યો, સં. ૧૩૪૨ વૈશાખ શુક્રાંતિ ૧૦મી એ જાલોરમાં શ્રીમહાવીરચૈત્યમાં શ્રીજિનયંદ્રસૂરિલુણે આપશીને ઉપાધ્યાય પદ સમર્પિત કર્યું. સંવત્ ૧૩૭૬ જ્યેષ્ઠ કૃષ્ણા ૧૪ પારશુમાં અનશન કરી જ્યેષ્ઠ શુદ્ધ રના હિવસે સ્વર્ગવાસી થયા.

સંપન્ન વિક્રાન હતા. કે જેમની પાસે શ્રીજિનયંત્રસુરિણુ
‘શ્રીરાજેન્દ્રચંત્રસુરિ’ રહ્લિવાકરાચાર્ય રોજરાચાર્ય વાચક

જેનું વર્ણન અત્રે ભીજ પ્રકરણમાં આપ્યું છે. આ વાચનાચાર્યની દૃતિઓ-
માંથી સમ્યક્તવ પર નરવર્મચરિત્રની ૧૩૮ પત્રની પ્રાચીન પ્રત-શ્રીજિનય
ધમંસૂરાળ ગાન મંહિર આગરામાં સુરક્ષિત છે, પુણ્યસારકથા (પ્રકાશિત
શ્રીજિનાટસુરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ઇડ સરત) સંવત ૧૩૩૪
જેસલ્મેરમાં રચિત ઉપલબ્ધ છે. ઉપરની બન્નેય દૃતિઓ વાચનાચાર્યની
પ્રતિબાના મહાન સુચક છે. સંકૃતાદિ દરેક ભાષાઓ પર આપનો
સમાનાધિકાર પ્રશંસનીય હતો.

૧ શ્રીજિનયંત્રસુરિણુએ સં. ૧૩૪૭ નેટું વહિ સાતમે ભીમપદીમાં
આપને દીક્ષા અહણુ કરાવી હતી, ઉપાધ્યાય શ્રીવિષેકસમુદ્ગણુ પાસે
આપે વ્યાકરણ, તર્ક, ન્યાય, અલંકાર, જ્યોતિષ અને સ્વપર સિદ્ધાંતોનું
તલસ્પર્શી અધ્યયન કર્યું હતું, વિ. સં. ૧૩૭૩માં જ્યારે આચાર્યવર્ય
શ્રીજિનયંત્રસુરિ દેવરાજપુર(દેરાદુર)માં હતા ત્યારે ત્યાંથી શેઠ વીસલ
અને મહણસિહને પાઠણ મેઢલી ત્યાંથી બોલાવ્યા ત્યારે ઉપાધ્યાયજીને
પુણ્યકૃતિને સાથે દર્શિ આપને આચાર્યશ્રીપાસે પાઠવ્યા, આચાર્ય મહારાજે
આપને નિનિ મૃગશિર કૃષ્ણા દના રોજ આચાર્ય પદ સમર્પણ કર્યું હતું.

૨ આચાર્ય શ્રીજિનપ્રભેષસુરિણુએ જલ્દોરમાં વિ. સં. ૧૩૩૧ કૃષ્ણ
શુહિ ૫ ના રોજ આપને દીક્ષા આપી રિથરક્ષાર્તિ નામથી પ્રસિદ્ધ કર્યા,
વિ. સં. ૧૩૪૪ માગશર સુહિ ૧૦ ને જલ્દોરના મહાતીરચૈલમાં શ્રીજિન-
યંત્રસુરિણુએ આચાર્યપદ આપી દ્વિવાકરાચાર્ય નામથી પ્રદોષિત કર્યા.

૩ આપે વિ. સં. ૧૩૪૪ ચૈત્ર સુહી ૧૪ ના રોજ શ્રીજિન-
યંત્રસુરિણુ પાસે ચારિત્ર અહણુ કર્યું. સં. ૧૩૪૨ વૈ. સુ. ૩ ને હિસે
શ્રીજિનપ્રભેષસુરિણુએ જલ્દોરમાં વાચકપદ આપ્યું અને વિ. સં.
૧૩૬૪ વૈશાખ વહિ ૧૩ ને રોજ જલ્દોરમાં શ્રીજિનયંત્રસુરિણુએ

“રાજકીયન ગણિ. બાયક સર્વરાજ રાજાનિ આહિ અનેક વિદ્યાજ્ઞનમાન્ય અપ્રતિમ પ્રતિભાસંપન્ન વિદ્યાનોએ પણ હૈમ-વ્યાકરણ બૃહદ્વચ્ચિ (૩૬૦૦૦), મહાતર્કલક્ષણ. સાહુલ્ય અદાંકાર જ્યોતિષ અને સ્વપ્રસના દર્શન શાખોનું સુનુચ્ચિત અધ્યયન કર્યું હતું. આપણા ચરિત્રનાથકનો પણ અદ્યાસ ઉપર્યુક્ત ઉપાધ્યાયલું પાસે થયો હતો. એ વાત તેમની સ્વયંનિર્મિત “ચૈત્યબંદનકુલકુચ્છિ”ની પ્રશાસ્ત્રના નિભલિભિત હોલોકથી સિંગ થાય છે.

‘तन्मौक्तिकस्तबकसेव्यपदोऽनुवेल-मस्ताघसंवरधरः कुपथप्रमाथी ।
विद्यागुरुर्मम विवेकसमुद्रनामो-पाध्याय इद्वत्गरलनिधिर्भूव ॥११॥

આચાર્ય નામનું મહા ભૂત્યવાનું પદ અપીઠ હ્યું. આપનો વિદ્ધાર પ્રદેશ બહુજ વિસ્તૃત હતો. બિદ્ધારના રાજગૃહ આહિ તીર્થોની યાત્રાએ પણ આપે કરી હતી. એમનો શાબક સમુદ્ધય પણ વિદ્ધાન હતો. હ. ફેરાગ આજ વાચનાચાર્ય પાસે વિ. સં. ૧૩૪૭માં “યુગપ્રધાન ચળપઠ” ની રચના કાન્દાળામાં ડૉ. વિશેષ માટે જુનુંએ ‘વિશાલ ભારત’ મે-જુન ૧૯૪૭

૧ આપ ગાલનપુરમાં વિ. સં. ૧૩૨૫ અષાઢ સ્વદી ૧૦ના હિવસે
શ્રીજિનેશ્વરસુરિના હસ્તક્રમલ દ્વારા દીક્ષિત થયા. વિ. સં. ૧૩૪૬
વૈશાખ કૃષ્ણા ૧ જાલોરમાં શ્રીજિનાનંદસુરિએ વાચનાર્થ પહું આપ્યું.

૨ સંં ૧૩૨૨-માધ્યમસુહિ ૧૪ના રોજ વિક્રમપુર-(આજનું ખીડી-
નેર નહીં કિંતુ જેસલમેરસ્ટેટ સ્થિત)માં આપની દીક્ષા થઈ, સં. ૧૩૪૨
વૈશાખ સુહિ ૧૦ જાન્યુરમાં શ્રીમહાવીર ભગવાનના મંદિરમાં શ્રીનિ-
યાંદ્રસુરિણુએ વાયક પદ આપ્યું. આપની કૃતિ ગણ્યધરસાર્થકલદ્વિવૃત્તિ
પ્રસિદ્ધ છે જેનું પ્રકાશન શ્રીનિનદત્તસુરિણાનભાડાર સૂરતથી થયું છે.

વાચનાચાર્ય પદ

સંવત ૧૩૭૫માં કુલવર્દીંડા—^૧કુલોધી—પાશ્વનાથજીની અભિજીવનચંદ્રસૂરીશ્વરજી નાગપુર—નાગોર—પદ્ધાર્યાં ત્યારે ત્યાં મિતિ માહ સુહિ ૧૨ ના રોજ ^૨મંત્રીહલીય ઠ. વિજયસિંહ ઠ. સેદુ સા. રૂઢા આદિ ચોગિનીપુર—હિલ્વી સંઘના પ્રમુખ શ્રાવક તથા ડાલામજીના ^૩મંત્રીહલીય ઠ. અચલ આદિ સમુદ્ધાય કન્યાનયન—કલ્પાણા—(હાહરીથી ૪ માછલી) આસિકા—હાંસી, નરભટાદિ વિલિન્ઝ સ્થાનોના નિવાસી સમર્સ્ત વાજજડ—વાગડ—હેશના સંધ, મં. મૂધરાજ આદિ ડોશવાણાના સમુદ્ધાય તથા સમય સપાહલક્ષ હેશના સમૂહ, જવાલિપુર—ળાલોરના શાહુ સુલટ શર્મયાનયન આદિ મારવાડના શ્રીસંદો એકત્ર થવાથી વિરાટ ઉત્સવ પ્રારંભ થયો, લિન્ઝ લિન્ઝ સ્થાનો પર સહાત્રતો ખોલાયાં જિનચૈત્ય—મંહિરોમાં નૃત્ય, વાજિંત્રાદિ—સહુ પૂજન થયાં. અને સ્વધાર્મિક વાતસદ્ય આદિ અનેક ધાર્મિક સુકૃત્યો થયાં. બધુ સંખ્યક શ્રાવક શ્રાવિકાઓએ યથાશક્તિ પ્રતો અંગીકાર કર્યાં માલા રોપણાદિ માટે નંદી મહેત્સવ કર્યો તેસમયે મુનિ શ્રીસોમચંદ્ર અને સાધ્વી શીલસમૃદ્ધ હુર્મભસમૃદ્ધિ, બુવનસમૃદ્ધિ એ ચારને દીક્ષા આપવામાં આવી.

૧ અહીંના વિધિચૈત્યમાં વિ. સં. ૧૨૩૪ માં શ્રીજિનપતિસૂરિજીએ શ્રીપાશ્વપ્રભુની સ્થાપના કરી, નિશેષ માટે જૂઓ—(નૈન સત્ય પ્રકાશ)

૨ આ જાતિના સંબંધમાં “મહત્ત્વાણુભાતિ” નામનો અમારો લેખ જોવા લભામણુષે જે “ઓસવાલ નવયુવક” વર્ષ ૭ અંક ૧માં છે.

પંડિત ૧જગતચંદ્રને વાચનાચાર્ય એ અને ૨ધર્મમાલા તથા
૩પુષ્ટયસુંદરી ગણિનીને પ્રવતિની-પહો આપ્યાં.

ભાલકાલથીજ પ્રતિલાને વિકાસ અત્યધિક હોવાથી આપણા
ચરિત્રનાચક વિદ્યાધ્યયનમાં અત્યન્ત હતાચિત હતા. અત્યારે
એઓ પોતાના અને અન્ય દર્શનોના સાહૃત્ય વિષયક મૂલગત
રહુંચેનું ગંભીર અવગાહુન કરી ચુક્યા હતા. એટલે ન્યાય અને
વ્યાકરણ જેવાં અસાધારણ વિષયોમાં એમના ગતિમતિ અતિ
આશ્ર્ય ઉત્પન્ન કરે તેવી હોવાથી અને ઉચ્ચકોટિના સુનિ
ચોષ્ય શુણેનો. વિકાસ થયો હોવાથી આચાર્ય શ્રીજિનચંદ્ર-
સૂરિજીએ તેમની ચોષ્યતાનું સર્વાંગીણું પરીક્ષણ કરી તેઓને
વાચનાચાર્ય પહેથી અલંકૃત કર્યાં.

ઉપરના મહોત્સવાનાંતર કલિકાલકેવલી શ્રીજિનચંદ્ર-
સૂરિજી ઠકુર વિજયસિંહ ઠ. સેઠૂ. ઠ. અચલસિંહ ઈત્યાહિ
વિશાળ શ્રીસંધ સાથે ઇલોધી આવી લગવાન શ્રીપાશ્વનાથજીની
ત્રીજી વાર ચાત્રા કરી વિસ્તૃત સંઘમાં ધર્માં શ્રીમતો હોવાથી
તીર્થસ્થાનમાં આર્થિક આવક પણ સારી થઈ. તફનાંતર વિ.સ.ં ૦
૧૭૭૫ વૈ. કૃ. ૮ ને દિવસે પૂજય આચાર્યવર્ય નાગૌર પદ્ધાર્ય.
મહુત્તિયાણુ ઠ. અચલસિંહ સભાએ હુતુખુદીન પાસેથી રસ્તામાં
કોઈ પણ રાન્ધ્ય તરફથી વિઝો ઉપસ્થિત ન થાય એવા પ્રકારનું

૧ એઓએ શ્રીજિનપ્રમોધસૂરજ પાસે વિ. સ. ૧૩૪૦ જેઠ વહિ ૪
ના દિવસે જાલોરમાં દીક્ષા અહણુ કરી હતી.

૨ શ્રીજિનપ્રમોધસૂરજ પાસે વિ.સ. ૧૩૩૩ જેઠ વહિ ૭ ના રોજ
પરમપુનીત શરૂન્જય તીર્થમાં એમણે દીક્ષા લીધી હતી.

૩ વિ. સ. ૧૩૪૧ જેઠ વહિ ૪ને દિવસે શ્રીજિનપ્રમોધસૂરજ
પાસે જેસલમેરમાં આપણીએ દીક્ષા લીધી હતી.

કેરમાન-આજ્ઞા પત્ર પ્રાપ્ત કરી હુસ્તિનાપુર, મથુરા મારે વિશાળ સંઘ કાળી કુમશઃ આમાનુથાન વિહાર કરતાં હુસ્તિનાપુર આય્યા. લક્ષ્મિપૂર્વક તીર્થવંદના કર્યા બાદ હિલ્લીસમાટ કુતુખુદીનને પણ પોતાના ઉત્કટ ચારિત્રભલ તથા ઉપરેશના પ્રભાવથી પ્રલાભિત કરી ખંડાસરાયમાં રોકાયા, લાંથી મથુરાની ચાત્રા કરી પુનઃ હિલ્લી આવી ખંડાસરાયમાં ચાતુર્માસ રહ્યા.

અતે અમારે પ્રસંગવશ નોંધવું જેણું કે ઉપર્યુક્ત સમયમાં પણ કોઈ કોઈ હેકાણે ચૈત્યવાસિઓનું અધિક પ્રાબલ્ય અવશ્ય હતું એટલે આચાર્ય મહારાજ ને આ સંઘયાત્રામાં થોડું-ધણું કષ્ટ પણ અવશ્ય સહેવું પડયું. જેનો વિસ્તૃત ઉલ્લેખ શુગપ્રધાનાચાર્ય ગુર્વાવલીમાં આપેલ છે. તેનો માત્ર સાર આ પ્રમાણે છે—હિલ્લી નિકટ દ્રમકુપુરીના ચૈત્યવાસી આચાર્ય પાદશાહના કાનમાં ચદ્રાતદ્રા વાતો લરાવી આચાર્ય સહિત શ્રીસંઘને કેદ કરાયા. પરંતુ ગમે તેવાં વાદળાં કેમ ન હોય પણ સૂર્યનું તેજ કંઈ છાનું થોડું રહ્યો શકે ? જાહેર થઈજ જાય.

તેમ થોડીવારમાં તો મૂળસ્થિતિ સામે આવી ગઈ, એટલે બાદશાહે ચૈત્યવાસી આચાર્યને ખંધાવી તાડના-તર્જના કરાવી, પરંતુ આચાર્ય મહારાજ શ્રીજિનયંત્રસૂરિજી એક અનેડ સમલાવી મહાપુરુષ હતા, એટલે અપકારીની પણ ચાતના જેઠ તેમનું હદ્દય દ્રવિત થઈ ગયું અને પોતાની લાગવગ વડે પ્રયત્નનો કરાવી ચૈત્યવાસીને છોડાયો, અરેખર અપકાર કરનાર પ્રતે પણ ઉપકારની લાવના રાખવી એજ હિચ્ચ પ્રકારની વિચારધારાનું લક્ષણ છે. ઈતિહાસમાં આવા મહામૂલા ઉદ્ઘારણો થોડાંજ જડશે.

પ્રકરણ અનુભૂતિ

સૂર્યિપહ અને પ્રતિષ્ઠાઓ



પાછળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે પરમોતૃપૂર્ણ વ્યાખ્યાતા આચાર્ય મહારાજ શ્રીજિનથંડસૂર્યિઅનુભૂતિલું સમુજ્જ્વલ અને અનુકરણીય હતું એ ડેવલ ચારિત્રિક સંપત્તિનાજ સ્વામી નહોટા પણ જ્ઞાન અને ક્રિયાને અપૂર્વ સંગમ-સમન્વયને ઉત્કૃષ્ટ આદર્શ ઉપસ્થિત કરનાર મહાપ્રકાબક પુરુષ હતા. એમની વક્તૃત્વ શક્તિ નિસ્સનાહેલ વિદ્ધાનો ને આક્ષર્ય ચકિત કરે એવી હતી, ૫૦ ક્રીએ તો એમના માટે લખે છે કે એમણે ચાર રાજાઓને પ્રતિબોધ આપ્યો હતો, એમનો શિષ્ય સમુદ્દ્રાય પણ વિશેષ-રૂપે આત્મકલ્યાણ પ્રગતિ સાધક માર્ગપર અવિરત ગતિએ પ્રયાણ કરનારો હતો માનવ સંસ્કૃતિના બૌદ્ધિક વિકાસમાં એમનું સ્થાન જીવું છે એ સમયનું પ્રતિબિંબ એમના અન્યોમાં વિદ્યમાન છે.

પ્રતિલા એ અત્યંત મહત્વની વસ્તુ છે, ગમે તે ક્ષેત્રમાં કોઈ પણ માણુસ કે વિદ્ધાન નિયરણ કરે, પરંતુ પુરુષાર્થ કરતાં એ પ્રતિલાની આવશ્યકતા અધિક રહ્યા કરે છે. અંતેચેતના કું બગટાડુપ જ્યાં સુધી આપણે ન કલ્પી શકીએ ત્યાં સુધી પુરુષાર્થ પણ શા કામનો ? મહાપુરુષો આ સંસારમાં જેટલા થયા છે તે પ્રતિલા લઈને જ અવતર્યા હતા. એમનું

કાયે હરેક રીતે સહ્ય થવામાં પ્રતિલાને ખાસ કારણું માનીએ તેઓ જરાએ અનુચિત નથી. શ્રીજિનયંત્રસૂરિજી સાક્ષાત્ પ્રતિલાસ્વરૂપ હતા, એમની આ પરંપરા આગળ પણ ચાલી હતી.

શ્રીજિનયંત્રસૂરિજી ખંડસરાયમાં ચોમાસું વિરાજતા હતા તે દરમ્યાન કર્મસંયોગવશાતું અચ્યાનક એમના શરીરમાં કંપરોગા ઉત્પન્ન થયો. ત્યારે સ્વજાનન્દયાન બળે પોતાને અદ્યાચું જાણી પોતાના હુસ્તદીક્ષિત લક્ષ્યણું, તર્ક, સાહિત્ય, અલંકાર અને જયોતિષાદિ શાસ્કોના પારંગત વિક્રતશિરોમણિ પરમ હાર્ષનિક શ્રીકૃશાળકીર્તિગણિને સ્વપહ યોગ્ય જાણીને આચાર્ય મહુરાજે આચાર્ય^૧ પછી પર એસાડવાની તથા એમનું સૂરિપદપ્રામિ પછીનું શુલાલિંગાન આદિ બાખતોની આવશ્યક, યોગ્ય શિક્ષા વળેરે પર પ્રકાશ પાડનારો એક પત્ર રાજેન્દ્રયંત્રાચાર્ય^૨ ઉપર લખી શ્રાવક શ્રીમાન ઠ વિજયસિંહને સુપ્રત કર્યો. આચાર્યાંદેવની પ્રકૃતિવિકૃત હોવા છતાં પણ રાણું માલદેવ ચૌહાણુંનું અત્યન્ત આશ્રહુલયું આમંત્રણ આવવાના કારણે હિલ્વીથી મેહિનીપુર-મેડતા તરફ પ્રયાણ કર્યું, માર્ગમાં એક માસ સુધી કન્યાનયન-કન્નાણુમાં સ્થિરતા કરી, લાં શાસાદિનો વ્યાધિ એકાએક વધી પડવાથી ચતુર્વિધસંધ સમક્ષ ખમત-ખામણું કર્યા અને પોતાના અધિક વિશ્વાસપાત્ર પ્રવર્ત્તક શ્રીમાન^૩ જ્યવહલક ગણિ સાથે સમુદ્દ્રાય વિષયક આવશ્યક વિચારણા કરી ઉપર્યુક્ત રાજેન્દ્રયંત્રાચાર્ય ઉપર ગર્ભનાયક પછ યોગ્ય સર્વશિક્ષાસૂચક એક ખીને પત્ર પણ લખી જ્યવહલક ગણિને આપી દીધું. ત્યારપછી

૧ એમની દીક્ષા સં. ૧૩૨૨ માધ્ય મુદ્રિ ૧૪ નિકમપુરમાં શ્રીજિન પ્રાણસૂરિજીના કરકમદો દારા થઈ હતી.

જ્યારે સ્વાસ્થ્યમાં થોડા ઘણો ફેરફાર થયો એટલે રાણુ માલ-હેવે આપેલ નિમત્તણું ધ્યાન રાખી મેડતા તરફ વિહૃદ લંખાયો અને કુમશા: ત્યાં પહેંચી રફિવિસની સ્થિરતા કર્યા બાદ કોશવાળું પધાર્યા. અહું વિકુમ સંવત રૂઢુજ આખાઠ સુદિ હને હિવસે હોઠ પહેંચ રાત્રિ વ્યતીત થયા બાદ અનશન આરાધના પૂર્વક આ અસાર સંસારથી સહાને માટે વિનશ્વરશીલ ભૌતિક શરીરની અપેક્ષાએ વિદ્યાય લીધી.

એમના સ્વર્ગવાસથી શ્રીસંધમાં ખૂજ ગમગીન વાતા-વરણ બન્યું ભક્ત શ્રાવક શ્રાવિકાઓને ઘણુંજ ફુંખ થયું, એવા સર્વગુણુસર્વપન આચાર્યનો વિરહ કર્યા ભક્ત પુરુષને ન સાલે ? પરંતુ કાળચક આગળ કોઈ શું કરી શકે ? જેટલું આચુષ્ય છે એ પૂર્ણ થયા બાદ મોટા ઋખિમુનિઓ તીર્થંકર મહુરાણનો પણ વધારી શકતા નથી તો પછી ભીજા સાધારણ માણુસનું તો કહેવુંજ શું ? શ્રીસંધની હાર્દિક ભક્તિ શુરૂ-મહુરાણ પર અગાધ હતી અતઃ એમની વિર સમૃતિ માટે સ્થાનીય શ્રીસંધે એક સુંદર સ્તૂપ બનાવરાવી પ્રતિષ્ઠિત કરાયો.

ત્યાર પછી કોશવાળુમાં ચાતુર્માસ રહેલા શ્રીજ્યવહૃપણ ગણું પણ ચાતુર્માસ બાદ સુરિજીપ્રદત્ત આચાર્ય પદ વિષયક પત્ર લઈ વિહૃદ કરી “લીમપહૃતી રાજેન્દ્રચંદ્રાચાર્ય” પાસે આયા.

૨ આ ગામ પાલણુપુર એજન્સીના ડિસ્કોમ્પથી ૧૯ માઇલ પદ્ધિમ દ્વિશામાં એપેલ છે જે અત્યારે ભીજી તરીકે વિખ્યાત છે. નિરોપ પરિય પ્રામ કરવા માટે “જૈન યુગ” ૧૯૮૫-૮૬ બાદ્રયન કાર્તિક અંકમાં મુનિરાજ શ્રીકટ્યાણ વિજ્યજીનો “લીમપહૃતી અને જૈન તીર્થ રામસૈન્ય” નામક નિઅંધ જેવા વિનાંતિ છે.

પત્ર વાંચી આચાર્ય શ્રી પ્રમુહિત થયા અને જ્યવહલબગણિ-
આદિ તમામ સાધુ સમૃદ્ધાય સહિત પાઠણું તરફ વિહુાર
કર્યો. અને કુમશઃ ત્યાં પહોંચ્યા, તે સમયે લ્યાં લયંકર હુંકાળ
હોવા છતાં પણ સજ્ઞાનખળે ચતુર્વિંદ્ય સંધનું કલ્યાણું જાણ્યી
પૂજયશ્રી ગુરુદેવની બહુમૂલ્ય આજા પ્રતિપાલનાર્થ આચાર્ય-
શ્રીએ સ. ૧૩૭૭ જેઠ વહિ ૧૧ કુલ લગ્નમાં સુરિપદ
સ્થાપનાનું શુલ મુહૂર્ત નક્કી કર્યું. આ વૃત્તાંત જાત
કરીને સુશ્રાવક જલ્દુણુના પુત્રરત્ન શેઠ *તેજપાલ ગુરુ-
લક્ષ્મિથી પ્રેરાઈ પોતાના નાના ભાઈ સુરપાલ સાથે પહેં સ્થાપના
મહેાત્સવ પોતા તરફથી કરવા માટે એકદમ ઉત્કંઠિત થઈ ગયા,
જ્યારે આચાર્ય શ્રી પાસેથી એમના શુલ મનોરથ્યો પૂર્ણ
થવાની આજા મળી એટલે તેજપાલે યોગિનીપુર-દીવલી-ઉચ્ચ-
નગર, દેવગિરિ-દૌલતાખાદ-ચિતોડ અને ખંભાત આદિ મોટા
નગરોમાં રહેલ ગુરુલક્ત શ્રાવકો અને સ્વપરિચિત મિત્રો
પર શીંગામિ પત્રવાહુકો દ્વારા આમંત્રણ પત્રિકાએ પાડવી,
યધપિ તે સમયમાં આજના જેવી ટપાલની લીન વ્યવસ્થા
તો નહોતી પણ શેઠ હર્ષિત થઇ એવી વ્યવસ્થા કરી કે
થોડા દિવસોમાં દેશ દેશાંતરે ઉપર્યુક્ત જંવાહ પહોંચી વજ્યો.
કુમશઃ ચારે દિશાઓથી શ્રીસંધ્ય પાઠણુમાં આવવા લાગ્યો, એજ

*એમના પિતા જલ્દુણ શ્રીજિનપ્રભોધસુરિણના નાના ભાઈ હતા
એમનાંજ વંશમાં મંત્રીશર કર્મચંદ્ર વર્ચાવત જેવા મહાપુરુષ થયા.
કર્મચંદ્રનાપત્રાંધ-વૃત્તિ અને પઢુાવલીએમાં એમના જીવન પરપર
પ્રકાશ નાંખનારી અનેક નૂતન ચિગનો જડે છે, ઉક્ત વંશપત્રાંધ મૂલ
હિંદી અનુચાદ સહિત મહામહેપાંધ્યાય સ્ન. ગૌરીશંકરજી હીરાયંદ એઝા
એ છુપાયો છે એટલે તેનું પિષ્ટ પેષણ અતેઅનુચિત છે.

સમયે હિલ્વીનાડો વિજયસિંહ પણ પૂરોદિલભિત શિક્ષા ચુક્તા
પહૃત્યવસ્થાપત્ર લઈ પાટણું આવ્યા. પાટણુમાં અત્યારે કોઈ
બુઢોજ રંગ જામ્યો હતો જ્યાં જુઓ ત્યાં આનંદ વિલીન
લોકસમૂહ દૃષ્ટિગોચર થતો હતો. અરેખર પુષ્યવાન
આત્માચ્યોનો જ્યાં નિવાસ હોય છે ત્યાં જનમહુદુઃખી પણ
પોતાના હુદાને કાળુંબાર માટે વીસરી જાય છે. (અનુવાદકના
જીવનમાં આ પંક્તિ સોણ આના જીતરી છે.) એ પવિત્ર
આત્માચ્યોનો અતુલનીય પ્રલાવ છે.

ચારે તરફના સંધો એકત્ર થયા જાણી રાજેન્દ્રચંદ્રાચાર્યે
મહામહેપાઠ્યાય વિવેકસમુદ્રગણ્યિ, પ્રવર્તક જ્યવલ્લભગણ્યિ
હેમસેનગણ્યિ, વાચનાચાયેં હેમભૂપણ્ય આદિ ઉત્ત મુનિઓએ અને
જ્યર્દ્ર્બિ મહાતરા, પ્રવર્તિની બુદ્ધિસમૃદ્ધિ ગણ્યિની, પ્રવર્તિની
પ્રિયદર્શના આદિ ત્રૈવીસ આર્યાઓ આદિ સમસ્ત શ્રીસંધ
સન્મુખ પ્રવર્તક જ્યવલ્લભગણ્યિ અને ૬૦ વિજયાંનિહુદ્રારા પ્રાસ
સ્વગર્ભીય શ્રીજિતચંદ્રસૂરિલુના આજાપત્રો વાંચી સંભળ્યાંય.

૧ એમની દીક્ષા સંં ૧૩૨૪ માર્ગશીર્ય દ્વિતીય શનિવારના રોજે
અલોરમાં શ્રીનિનેશ્વરસુરિણા વરદ હસ્તે થઈ, સંવત ૧૩૬૧ ખીલ વૈશા-
ખનિ ૧૦ ના રોજ સમયાણ(ગઢસિવાણ)માં શ્રીનિનયંડસુરિણુએ વાચક
પદ આયું, શ્રીનિનયુશાલસુરિણુએ સંવત ૧૩૭૮ માઘસુદ્ધિ તના દિવસે
ભીમપલ્લીમાં આપને ઉપાધ્યાય પદથી નિભૂષિત કર્યા.

૨ આપ ઠ. હાંસિન પુત્ર દેહડાના નાના ભાઈ ઠ. ચિરહેવની પુત્રી
હતાં, સંવત ૧૩૪૨ વૈશાખ મુદ્દી ૧૦ ને જાણોરાના મહાવિરમૈયમાં
અનિજનયદ્રસુરિ પાસે દીક્ષા અહણુ કરી, નામ રત્નમંજરી પાડયું
સ. ૧૩૬૮ શા. વ. ૧ લગભગ ભીમપદ્લીમાં ઉપર્યુક્ત આચાર્યવર્ષ
નિજનયદ્રસુરિજીએ મહાતરાપદ આપી જયદ્વિં નામ રાખ્યું હતું

શ્રીસંધ પણ કલ્યાણકારક આજાથી હંદોત્ત્વાસ વ્યક્ત કરે એ
સર્વથા સ્વામાર્ગિક છે. આધ્યાત્મિક સંસ્કૃતિની દીંગ્યન્યોતિને
કાયમ રાખનાર મહાપુરુષોના આવા મહામાંગલ્યકારી કાર્યનો
શુભ સંવાદ કયા ગુરુભક્તને પરમોત્કૃષ્ટ આનંદના મહાસાગરમાં
ઓલાં ન અવરોચે? કારણ કે પ્રાચીન કાલમાં જૈન સમાજમાં
પૂજયોના અનુશાસનનું પાલન ધ્યાનપૂર્વક કરવામાં આવતું હતું,
ગચ્છનાયકની આજાનું પરિપાલન મુંજિ અને ગુહુરથો આદર
પૂર્વક કરવામાંજ પોતાનું કલ્યાણ માનતા. જ્યારથી આવા
પ્રકારની સંધંગયવસ્થાનો લોપ થયો છે ત્યારથી જૈન શાસનની
સર્વભૌમિક ઉન્તિતમાં પણ ધારીધારી બાધાએ ઉપસ્થિત
થઈ છે અને થઈ રહી છે અસ્તુ.

શ્રીરાજેન્દ્રચંદ્રાચાર્યે પૂજયશ્રીગુરુહેવની આજાનુસાર
વાચનાચાર્ય શ્રીકુશલકીર્તિ ગણિને પરમતારક વીતરાગ
પરમાત્મા શ્રીશાંતિનાથ સ્વામીના ચૈત્ય (મહિરમાં) શ્રીસંધ
મદ્દસ અત્યન્ત વિશાળ માનવમેહની સમુખ ધામધુમ પૂર્વક
જૈનશાસનમાં પંકાયેલું એવું મહામૂલ્યવાન સ્કુરિપ્ટ સમર્પિત
કરી સ્વર્ગીય આચાર્ય મહારાજ દ્વારાજ સ્તુચિત “શ્રીજિન-
કુશલસૂરિ” નામ ઘોષિત કર્યું.

આચાર્યપદ સમયે આખુંચે પાટણ નગર એવજા-પતાકાચો
વડે શાખુગારવામાં આંધું, અનેક પ્રકારના વાજિંતોના સુમધુર
સ્વરેણ ગુજીત થઈ રહ્યા હતા, ભાટ અને બન્દીગણ બિરુદ્ધાવલી
ઉચ્ચારણું કરી રહ્યા હતા, શ્રીસંધની બાહુદ્યતાના કારણું
વિસ્તૃત રાજમાર્ગ પણ સંકુચિત થઈ રહ્યો હતો, આજે શેડ
દેજપાદનું પરમ સૌભાગ્ય હતું કે જેના યોગે સ્વભુજેપાર્નિત

વિતનો સદ્ગુર્યય કરવા આવો સુંદર સુચેંગ તેવણુંને પ્રાપ્ત થયો. યાચકોને મનોનુકૂળ સૌવર્ણી રૌષ્યમુદ્રાએ અને અશ્વાહિ વાહુન એવં સું અજ આભૂષણું આદિનું દાન મળ્યું, તે ઉત્સવ પ્રસંગે લ્યાં પાટણુમાં ૧૦૦ આચાર્યો ૭૦૦ સુનિઓ અને ૨૪૦૦ સાધીઓ એકત્ર થયેલા, તે બધાઓને વખ્ત પાત્રાહિ વહેંગારાવીને લ્યાંના બધાએ શ્રાવકોએ સુપાત્રદાનનો સારામાં સારો લાભ મેળવ્યો હતો.

આ પ્રસંગે કિન્નલિન્ન સ્થાનોથી આવેલા શ્રાવકોએ પણ ધાર્મિક કૃત્યોમાં સ્વવિતનો સારા પ્રમાણુમાં બ્યય કરી યશ અને પુષ્ટ્યોપાર્જન કર્યાં, જેમાં લીમપદ્ધીના શ્રાદ્ધશરોમણું સાધુરાજ સામલના પુત્ર વીરહેવ, શ્રીશ્રીમાલ શાહ બીજલના પુત્ર રાજસિંહ, એવં રાજમાન્ય દેવગુરુભક્ત પરમાર્હત મંત્રી-દલીય ઠ. વિજયસિંહ ઠ. કૈત્રસિંહ ઠ. કુમરસિંહ ઠ. જવન-પાલ ઠ. પાલહા આહિ સમૃદ્ધાયે અને સાધુરાજ સુલટના પુત્રરતન શાહ મોહુન મ. ધન્નુ ઊકા, આહિ જલોરના શ્રાવકો તે મજ શાહ ગુણુધર આહિ પાટણુના તથા વીજાપુરના શાહ તિહુણું આહિ, આસાપદ્ધીના ઠ. પઉમસિંહ, ખંભાતના ગો. કૈત્રસિંહ આહિ અચ્યગુણ્ય શ્રાવકોનો ઉલ્લેખ વિશેષ મહત્વ રાખે છે.

આ અવસરે માલારોપણું નન્હીમહેત્સવ તથા શ્રીશાંતિ-નાથજીના મંહિરમાં આષાનિહુકા મહેત્સવો થયાં. જેસલમેરીય જ્ઞાનસંડારના વિસ્તૃત સ્વર્ણીપવથી જણાય છે કે એજ વષંમાં શ્રીશ્રીમાલ દેહાના પુત્ર આનાએ સુરિજી મહારાજના ઉપરેશથી નૈષધ કાવ્યની તાડપત્રીય પ્રતિ ખરીદી જેની પ્રશસ્તિ “જેસલ-મેર લાંડાગારીય થંથાનાં સૂચિ” પૃ. ૧૪માં છપાઈ ચુકી છે.

ગરુછનાયક પદ પ્રાપ્ત કર્યા બાદ સુરિજી મહારાજ લીમપદ્ધી

તરફ પધાર્યા, ત્યાં વીરહેવ શ્રાવકે વિશેષ સમારોહ પૂર્વક પ્રવે-
શોત્સવ કરી ગુરુલક્ષિતિનો અભૂતપૂર્વ લાભ પ્રાપ્ત કર્યો. સંઘનો
વિશેષ આગ્રહ હોવાથી અને ધર્મોજ્ઞતિનો લાભ જાણ્ણીને
આચાર્ય થયા બાદ પ્રથમ ચાતુર્માસ અતેજ ચાપન કર્યું.

સં. ૧૩૭૮ માઘ સુહિ ઉ ના રોજ ભીમપદ્ધીના શેડ
વીરહેવ તથા અન્ય શ્રાવક સમુહાચે પાઠણુના શ્રીસંધ સાથે દીક્ષા
માલારોપણ નિમિત્તે નન્દીમહોત્સવો તથા સાધર્મિક વાતસદ્ધ્ય,
સંધપૂજા આહિ ધાર્મિક કર્યો કરાવી ધર્મની વિશેષ પ્રભા-
વના કરી, આ પ્રસંગે રાજેન્દ્રચંદ્રાચાર્યે પણ માલા અહુણુ કરી,
હેવપ્રલુ મુનિને દીક્ષા, વાચનાચાર્ય હેમભૂષણને ઉપાદ્યાયપદ અને
‘મુનિચંદ્ર ગણિને વાચનાચાર્ય’ પદ આહિ આપવામાં આવ્યા,
એજ વર્ષમાં પ્રતિજ્ઞાનું પાલન કરવામાં પ્રવીણુ પૂજયશ્રીએ
પોતાના ધ્યાન જ્ઞાનાહિ ખલથી સ્વસમુહાયના અનેક વિદ્ધાનોના
સ્તુતેણ્ય પાઠક પ્રકાંડપણંડિત શ્રીવિવેકસમુદ્ર ઉપાદ્યાયનું અદ્યાય
જાણી ભીમપદ્ધીથી યુનઃ પાઠણ આવ્યા, ત્યાં મિતી જેઠ
વર્ષ ૧૪ ના શરીર સ્વસ્થ હોવા છતાં શ્રીવિવેકસમુદ્ર ઉપાદ્યાયને
ચતુર્વિધસંધ સમક્ષ મિશ્યાહુષ્કૃત આપાવી ક્ષામણા પૂર્વક અન-
શન કરાવ્યું, પરમ કલ્યાણ કરાક પંચ પરમેષ્ઠી મહામંત્રનું
ધ્યાન કરતાં કરતાં આરાધના પૂર્વક જેઠ સુદી ૨ ના રોજ ઉપા-
દ્યાયજી સ્વર્ગવાસી થયા, પાઠણુના સંબે સમારોહ પૂર્વક
એમનો સ્વર્ગમનોત્સવ કર્યો, અર્જિસંકારના સ્થાન પર ઉપાદ્યા-
યજીની સુસ્મૃતિ કાયમ રાખવા માટે સ્થાનીય શ્રીસંધ તરફથી

૧ સંવત ૧૩૪૭ મિતી, જ્યેષ્ઠ વદ્દ ૭ ને રોજ ભીમપદ્ધીમાં
શ્રી જિનાયંદ્રસ્સરીધરજીએ એમને દીક્ષા અપિત કરી હતી.

એક સૌંદર્યસમ્પન્ન સ્તુપની સ્થાપના કરવામાં આવી જેની પ્રતિષ્ઠા આખાડ સુહિ ૧૩ ના રોજ આચાર્ય શ્રીએ કરાવી હતી. અને એ વર્ષનું આતુર્માસ પણ સ્ફુરિલુ મહારાજે સંઘના અત્યાશ્રહુથી પાટણુમાંજ કર્યું.

વિ. સં. ૧૩૭૬ મિતી માગશર કૃષ્ણા ૫ ને દિવસે મહાનુઝદ્વિવાળા અનેકો આવકેની ઉપસ્થિતિમાં શેડ તેજપાલે શ્રીશાંતિનાથ વિધિયૈત્યમાં જલયાત્રા પૂર્વક પ્રતિષ્ઠાત્સવ મનાંયો. તેમાં પાટણુના મોટા મોટા શ્રીમંતો અને સમસ્ત રાજ-કર્મચારીએ પણ સમ્મલિત થયાં હતાં અને આ સુંદર અવસર જાણી યથાવસરે સ્વવિત્તાનો સહૃપયોગ કરી કૃતકૃત્ય થયાં. યાચકોને દાન આપી સંઘ પૂજા કરાવી, અને સાધમિક વાતસદ્વ્યો. કરીને શેડ તેજપાલે પુષ્કળ દ્રવ્ય બ્યય કર્યો હતો. એજ દિવસે શ્રીશાંતુજ્ય પર્વત પર શેડ તેજપાલ તરફથી શ્રીયુગાહીદેવ પ્રભુના મંહિરની નીવ નાંખવામાં આવી. શાંતિનરસિંહના પુત્ર ર્ભીવિડશાહે ઉદ્ઘાપન કર્યું. આચાર્ય મહારાજ શ્રીજિનકુશલસ્ફુરિલુએ શિલા રત્ન અને ધાતુ પિતાલ-મય શ્રીશાંતિનાથાહિ જિનેવરેની ૧૫૦ પ્રતિમાએ, સ્વકીય મૂલ સમવસરણુદ્ધ્ય, શ્રીજિનચંદ્રસ્ફુરિ + શ્રીજિનરત્નસ્ફુરિ આદ્ય

*શ્રીશાંતિનાથના મંહિર (જેસલમેર)માં સ્થિરયાંદની બનાવરાબેળ શ્રીશાંતિનાથજીના પ્રતિમા સં. ૧૩૭૬ માર્ગશિર કૃષ્ણા ૫ ની પ્રતિષ્ઠાત્ત વિધમાન છે. નાહર લેખ સંયાદ લેખાંક ૨૩૮૮.

+ આ પ્રતિમા તીર્થાધિરાજ શ્રીશાંતુજ્ય પર વિધામાન છે. જેનો લેખ આ પ્રમાણે છે. સંવત ૧૩૭૨ વર્ષે માર્ગો વદિ ૫ શ્રીજિનેશ્વરસ્ફુરિશિષ્ય શ્રીજિન(રત્ન, સ્ફુરમૂર્તિ: શ્રી જિનચંદ્રમૂરિશિષ્યે: શ્રીજિનકુશલસ્ફુરિમિ: પ્રતિ ૦ બૃ ૦ ખરતરગઢે).

સહિત અનેકો અધિષ્ઠાતાએની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરી.

ઉપર્યુક્ત મહેતસવોમાં લીમપદ્મીના શેડ વીરહેવ અને લીમપત્તાન, લીમપદ્મી તેમ આશાપદ્મીના અન્યાયશ્રાવકોપણ સંધ્યા પૂજા સાહુમિવચ્છલ આહિધાર્મિક સુકૃત્યો કરવામાં સન્દ્રબ્યનો સહૃપચોગ કરી હુંચિત થયા, સાધુ સહજપાલના પુત્ર સ્થિરચંદ્ર અને શાહ ધીણુના પુત્ર ઐતસીએ ધન્દ્રપદ આહિ મહેતસવ એવં બીજ વિવિધ ધર્મકાર્યોમાં પુષ્કલ દ્રોધ બ્યય કરી જૈનશાસનની મહુતી પ્રલાભના કરી.

સુધેણ્ય પુરુષોની યોગ્યતાએનો અનુભવ જગત સ્વયં-
મેવ કરી લે છે, એ વાત દીપક તુલ્ય સ્પષ્ટ છે. શ્રીમાન
આચાર્ય મહારાજની વિદ્રોહ અને અભાવોત્પાદક વ્યાખ્યાન
શૈલીની સુવાસ ચારે તરફ ફેલાતાં વાર ન લાગી, જેના ફ્લ
સ્વરૂપ વિભિન્ન નગરોના સંઘો તરપ્રથી ચાતુર્માસ માટે નિમં-
ત્રણો આવવાં લાગ્યાં.

ઉત્સવો થયાં બાદ આચાર્ય શ્રી વીજપુર પદ્ધાર્યાં, ત્યાં ધામધુમ પૂર્વક લભ્ય પ્રવેશોત્સવ થયો અને શ્રીસંધ્યની અભ્યર્થનાથી તેઓ શ્રીને ચૌમાસું પણ ત્યાંજ કરવું પડયું. વીજપુરમાં શ્રીવાસુ-
પૂજય લગ્નાના મહુતીર્થની ઉક્તિ પૂર્વક ચાત્રા કરી સુરિલુ
મહારાજ ત્રિશૂંગમ પદ્ધાર્યાં, સાધુરાજ જેસલના પુત્ર જગધર
અને સલખણે અસંખ્ય નરનારીએના સમુદ્દ્રાય સાથે પદ્ધા-
એને આશ્ર્યચર્ક્તા કરે એવો લભ્ય પ્રવેશોત્સવ ઉત્સાહ પૂર્વક
કર્યો, ત્યાંથી પુનઃ વિજપુર આવી ત્યાંના તથા ત્રિશૂંગમના
સંઘો સહિત આરાસણ અને તારંગા જેવા મહાન् તીર્થોની

યાત્રા કરી મંત્રીહલીય ઠો આસપાલના પુત્ર જગતસિંહે
સંઘપૂજન સાધમિકવાત્સલ્ય, અવારિતસત્ર ધ્વજારોપણાદી બહુ
સંખ્યક ધાર્મિક ઉત્સવો કર્યા. યાત્રાથી પાછાં આવતાં સૂરિજી
મહુરાજે ત્રીજું ચોમાસું પણ પાઠણ કર્યું.

વિ. સં. ૧૩૮૦ કાર્તિક સુદ્ધિ ૧૪ના રોજ શેડ તેજપાલે
પોતાના નાના લાઈ દુર્પાલની સાથે તીર્થાધિરાજ શ્રીશત્રુ-
જયમાં સ્વનિર્માર્પિત નૂતન મંહિરના મૂળનાયક ચોણ્ય શ્રીત્રષ્ઠભ-
દેવ ભગવાનની કપૂરસમાન સમુજ્જ્વલ સત્તાવીશ આંગળ પ્રમાણ
પ્રતિમાની અંજલશલાકા સૂરિજીમહુરાજના હુસ્તકમલ દ્વારા
કરાવી, આ પ્રતિષ્ઠા મહોત્સવ પર અનેક સ્થાનોના સંઘોને
પણ આમંગ્યા હતા. શ્રીજિનપણાધસૂરિ શ્રીજિનચંદ્રસૂરિ કપ-
હીંયક્ષ ક્ષેત્રપાલ અને અંભકાની પ્રતિમાઓ તથા જુહા જુહા
સદગુહુસ્થેદ્વારા નિર્માર્પિત અનેકો મૂર્તિઓની અને શત્રુજય
મંહિરના શિખર પર ચઢાવવા માટે ધ્વજહંડની પ્રતિષ્ઠાઓ.

x મુંખઠિના એક આવક પાસે આ પ્રતિમા છે નેતા પર આ પ્રમાણે
લેખ ઉત્કૃષ્ટિત છે.

“સંવત् ૧૩૮૦ શ્રીજિનકુશલસૂરિમિઃ શ્રીઅંબિકા પ્રતિષ્ઠિ[તા]તાં-

આજ સંવતની પ્રતિષ્ઠિત એક આદીશ્વરજીની ચૌવીસી પ્રતિમા
અત્યારે પણ બીજાનેરના શ્રીચિન્તામણી પાર્શ્વનાથના મંહિરમાં મૂળનાયક
તરીકે વિરાજમાન છે. તેનો લેખ આ પ્રમાણે છે.

A સંવત् ૧૩૮૦ વર્ષે શ્રીજિનકુશલસૂરિમિઃ પ્રતિષ્ઠિતં શ્રી.

મંડોવરમૂલનાયકમ્ય (?) શ્રીઆદિનાથાદિચતુર્વિશતિપદુમ્ય (?)

B નવલક્ષક રાસલ પુત્ર નવલક્ષક રાજધાની પુત્ર....રત્નેન નવ
લક્ષક સા. નેમિચંદ્ર સુશ્રાવકેન સા. વીરમ દુસા ઉદેવચંદ્ર કાનઢમહં

કરાવી, શાંત ધીણાના પુત્ર ઐતસિંહાદિ શાવકોએ ઈન્ડ્રપદ, શુગાદિદેવ મુખોહ્યાદન, માલાચહુણ આદિ ધાર્મિક કાર્યોમાં પુષ્કળ દ્રોધનો સદ્ગુણ્ય કરી આત્મકર્તાવ્યનો પરિયય કરાંદ્યો.

આવું પવિત્ર તીર્થસ્થાન અને સુચોણ્ય ચારિત્રપાત્ર શુરુનો સુસંયોગ એ એ વસ્તુએ હુર્લાલ છે, અતઃ આ પ્રસંગે મિતી માગશર વહિ દના રોજ ધણુંયે શાવકો સમ્બન્ધકત્વ ચહુણું. સમાયિક, પરિથિક, પરિમાણાદિ શાવકોચિત વતો અંગીકાર કરી માનવજનમની સંકળતાના માર્ગપર અપેક્ષાકૃત અભ્યસર થયા.

પ્રકરણ ત્રીજું



રત્વર્ષની રાજધાની હિલ્હીથી શ્રીમાલ જાતીના શેઠ હડના પુત્ર સુશ્રાવક રયપતિએ વિ. સં. ૧૮૮૦માં હિલ્હીશ્વર સાટ્ટ જ્યાસુદીન તઘલખની રાજસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર પોતાના પુત્ર ધર્મસિંહ દ્વારા પ્રધાન મંત્રો શ્રીનેણ સાહુણની પૂર્ણ સહાયતાથી આ આશાયનું એક શાહી ફરમાન (આજાપત્ર) કઢાંયું કે—“શેઠ રયપતિનો સંધ્ય તીર્થયાત્રાના શુભ હેતુથી જયાં જયાં જય ત્યાં ત્યાંની બધી પ્રાન્તીય સરકારો એમને આવશ્યક સગવડો પૂરી પાડવા વડે દરેક દરેક રીતે સહાયતા કરે અને સંધની તીર્થયાત્રામાં કોઈપણ પ્રકારના વિન્ધો અને બાધાએ ન આપે”.

ઉપરનું શાલી કરવાન પ્રાપ્ત કરી રાજમાન્ય શોઠ શ્રીમાન્દુ
 રયપતિએ શાનુંજ્ય ગિરનાર આહિ મહાતીથેંની યાત્રા કરવા
 માટે નિકળનાર સંધમાં સમ્મલિત થવા નિમિત્તે પારણુમાં
 વિરાજમાન પૂજય આચાર્યવર્ય શ્રીજિનકુશાળસૂરિલું પાસે
 વિજાપુર પત્ર લખી શીધગામી મનુષ્યો દ્વારા પહેંચાડયું
 સૂરિલું મહારાજે પોતાની બધીએ પરિસ્થિતિનો સારી રીતે
 ખ્યાલ કરી તીર્થયાત્રા માટે સંધ કાઢવાની આજા પ્રદાન કરી,
 શુરૂદેવનો આશીર્વાદ પ્રાપ્ત કરી શોઠ રયપતિ અત્યંત પ્રસન્ન
 થયા, અને પોતાના પુત્રો મહાણુસિંહ, ધર્મસિંહ, શિવરાજ
 અભયચંદ્ર તથા પૌત્ર ભીજમ અને બંધુ જવણુપાલાહિ પરિવારના
 તમામ લોકો સહિત શુરૂમહારાજ દ્વારા બતાવેલ વિધિઅનુસાર
 સંધની તૈયારી કરવામાં પૂર્ણત્વયા સંલઘ થયા. કારણ કે
 એ સમયમાં આખા વિશાળ સંધની આયોજના કરવી એ એક
 કઠળું કામ હતું, પરંતુ તીર્થલક્ત પરિવારે પોતાનો મૂલ્યવાન
 સમય લગાડી થોડા સમયમાં સંઘોચિત સર્વ પ્રકારની તૈયારી
 કરી લીધી, સંધવી શોઠ. રયપતિએ હિલ્લીના પ્રસુખ શ્રાવક મંત્રિહં
 લીય સાધુ જવનપાલ, હેવગુરુધર્મલક્ષ્મિ કારક શ્રીશ્રીમાલી
 શાંત ભોજન, શાંત ધીતમ એવં શિવપાહિ અનેક વિષયોના ધૂરનધર
 વિદ્રોહ રાજમાન્ય ડ. શ્રી.કે.રુ, ધામર્થ નિવાસી શાંત રૂપા, ધીજા
 આહિ લૂણાવિડી નિવાસી પંચાલી સાંત ક્ષેમધર આહિ હુર
 અને નળુકના શ્રીસંધને એકત્ર કરી સ્વનિવાસસ્થાન હિલ્લીથી
 મોટા આડંખર સાથે યાત્રાર્થ પ્રયાણ કરવાનો. વિસ્તૃત ઉત્સવ
 મનાંયો, ઉપર જણાવાયું છે કે શોઠ રયપતિના પુત્રરતન શ્રીમાન્દુ
 ધર્મસિંહનો પ્રકાવ રાજહરણારમાં બહુ સારો હતો, જેના અંગે
 એમના પ્રયાસથી રાજ્યના પ્રધાન માર્ગથી થઈ ૧૨ પ્રકારના

સુસ્વરોવાળાં વાજિંતોથી શાહી સેના સહિત પ્રથમ વૈશાખ વહિ
૭ ના રોજ નવીન નિર્માણ કરાવેલ હેવાલય લઈ સમસ્ત
ક્રીસંગ્રહ હિંદુથી પ્રયાણ કર્યું, એ વખતનું એ દૃશ્ય ખરેખર
હેઠવા ચોણ્ય મનોહર હતું. સધવા સ્થીએ સુંદર સ્વરે. સાથે
હુંષ પૂર્વક મંગલ ગીતો ગાઈ રહી હતી. અંકિચનોને ઈચ્છિત
વસ્તુઓની પ્રાપ્તિ મારે દરેક પ્રકારની વ્યવસ્થા સંઘમાં હતી.
તેમજ હીન હુઃખી યાચક જનોને મનોલિલબિત દાનહેવાતું હતું,
લાટો અને બન્ધીજનો ઉચ્ચયરવદે બિરુદ્ધાવલીનો ઉચ્ચયાર
કરી રહ્યાં હતાં, હર્ષ ડોની અપાર લીડ જામી હતી. કારણ કે
જ્યાં આવો મહાન् ઉત્સવ મંડાયો હોય ત્યાં અગણિત માનવ
મેદની ઉલ્લાય એ સર્વર્थા સ્વાલાવિક છે.

યાત્રાના પ્રથમ હિવસથીજ શેડ રયપતિએ અન્નકોત્ર
(દાન શાળા) ગોલી હીથું હતું, સંધ હિંદુથી. પ્રયાણ કરી
કુમશઃ ઉન્યાનયન (કન્ભાણા) આંથો, ત્યાં ચુગપ્રધાન
આચાર્ય શ્રીજિનનદત્તસ્કુરિલુ મહારાજના વરદ કરકમલોથી શુલ
મુક્તર્તમાં પ્રતિષ્ઠિત પ્રભુ શ્રીમહાવીર જિન તીર્થનાં હર્ષન કર્યાં,
ત્યાંથી ત્યાંના ક્રેષ્ટિ પૂના, પંચા, રાણ, રાનુ, ૬૦ હેપાલ, શાં કાલા,
ખારઈ પૂના આદિ સમુદ્ધાય તથા આશિકાના હેઠા આદિ શ્રાવક
સમુદ્ધાય સંધ સાથે થયા, એવી રીતે સ્થાન સ્થાન પર પૂજા
પ્રલાવના આદિ દ્વારા જૈન શાદીનાં પ્રભાવના કરતો કરતો સંધ
અનુકૂમે નરસટ પહેંચ્યો, ત્યાં પણ શ્રીજિનનદત્તસ્કુરિલુ મહા-
રાજ દ્વારા પ્રતિષ્ઠિત અતિશય ચુક્ત નવરૂપા પાર્શ્વનાથ લગ-
વાનની વિલિન પ્રકારે સહિત પૂર્વક શુદ્ધ હૃદયથી વંના કરી,
ત્યાંથી શાં ભીતા, હેવરાજ, અને ખાટૂથી શાં ગોવાલ આદિ

નવહા જુંઅણું નિવાસી શાંત કોણહેણા આહિ સમુદ્રાય સંધની સાથે થઈ ગયો, ધીરે ધીરે કૈનશાસનની અખંડ નચોતિ જગા-વતા જગાવતા સંઘે ફ્લોએધી આવી પાંચંનાથજીની યાત્રા કરી.

સંધવી શ્રીમાનુ રથપતિ દ્વારા પૂર્વ આમંત્રિત શેઠ હૃ-પાલ પુત્ર ગોપાલ શાંત પાસવીર પુત્ર નન્દન, શાંત હેમલ પુત્ર કન્દ્રયા, શાંત પૂર્ણચંદ્ર પુત્ર હરિપાલ, શાંત પેથડ, બાહુડ, લાખણુ, સીવા, સામલ, કીકટ આહિ ઉચ્ચનગરના શ્રાવકો તથા હેવરાજપુર(હેરાઉર)ના શાંત વસ્તુપાલ આહિ કયાસપુરના શાહ મોહણુ આહિ મર્ડકોટ(મર્ડોટ)ના શાંત તદ્હણુહિ સિન્ધુ હેશના સંઘે પણ આવી પહોંચ્યા, એવી જ રીતે નાગોર આહિ સપાહલક્ષ હેશના શાંત લખમસિંહ, મેડતાના શાહ આચા આહિ, કોશવાણુના મંંદ કેવહાહિ, જેવી રીતે નાની મોટી નહીંઓ મળી અંતે સસુદ્રમાં ભણે છે. એવી રીતે અનેકો ગામોના શ્રાવકો પણ તીર્થયાત્રાનો લાઢો લેવા આ વિશાળ સંધ રૂપી સસુદ્રમાં ભળવા લાગ્યા.

ત્યાંથી સકલ શ્રીસંધ ગુધહુના શાંત મેલૂ આહિને લઈ જાણોાર પહોંચ્યો, ત્યારે ત્યાંના સંધ તરફથી રાજકીય અધિકારી વર્ગના સહુયોગ સાથે સંધનું ભાવસીનું અતિ લભ્યસ્વાગત કરવામાં આંયું, યાત્રીગણે સમસ્ત જિનાલયોમાં શુદ્ધ ભાવથી દર્શન કરવા રૂપ ચૈત્યપ્રવાડી કરી, જાણોના શ્રાવક મહિરાજ, કોરંટકપુર(કોરટા)ના શાંત ગાંગા આહિ અનેક ભાઈ બહેનો સંધમાં ભજ્યાં, સંધ કુમશઃ શ્રીશ્રીમાલ (ભિન્નમાલ) નગરમાં શ્રીશાંતિનાથ અને ભીમપલી એવં કાયડમાં શ્રીમહુાવીર પ્રલુની યાત્રાએ કરી જેઠ વહિ ૧૪ના શુજરાત હેશની રાજધાની અણુહિલપુર પાઠણુમાં આવી પહોંચ્યો.

અહિ સ્થાવરતીર્થ શ્રીશાંતિનાથ લગ્વાન અને જગમતીર્થ શ્રીજિનકુશાલસ્યુરિજીના ચરણાવિદોમાં શાહુ રયપતિ, શાં મહણુસિંહ આહિ સંધના તમામ ભાઈ ણહેનોએ લક્ષ્મિ પૂર્વક વંદના કરી, શ્રીશાંતિનાથ લગ્વાનના વિશાળ દેરાસરમાં અણ્ટાનિકા મહેતસવ કરી પાટણ નગરના અમસ્ત જિનાલયેની વિધિવત્ ચૈત્યપ્રવાડી કરી.

સંધવી શેઠ રયપતિ, મહણુસિંહ, શ્રેણી ગોપાલ, જવણુપાલ, શાહુકાલા, હરિપાલ આહિ પૃથેરપૃથક દેશોના શ્રાવક અને સ્થાનીય શ્રીમંતો પૈકી શેઠ તેજપાલ એવં સંધના પૃષ્ઠરક્ષક શેઠ રાજસિંહ, શ્રીપતિ પુત્ર કુલચંદ્ર, ધીણુ પુત્ર ગોપાલ, આહિ પાટણ તથા હુમીરપુરના શ્રાવક સમુદ્દરે આવી આર્યાર્થ મહારાજને સંધમાં પધારવાની નિમન શાખોમાં વિનંતિ કરી.“પ્રબો! વર્ષાકાલ અત્યન્ત સમીપ છતાંએ સંધના કલ્યાણ નિમિત્તે આપ અતિશીધ પધારો, જેથી અમારા બધાએ લોકોની તીર્થયાત્રાની ઉત્કૃષ્ટ ભાવના સફલીભૂત થાય” સંધની પ્રાર્થનાજ એવી સચોટ હતી કે સૂરિજીમહારાજ તેને ટાળી ન શક્યા, પ્રત્યુત મિતી જેઠ સુદ્ધિ દના રોજ શુભ મુહૂર્તમાં શુરૂદેવ શ્રીજિનચંદ્ર સૂરિજીનું ધ્યાન મનમાં કરતા કરતા સૂરિજી મહારાજે ૧૭ સાધુ અને જયર્દ્ધિમહુતરા પુણ્યસુંદરી ગળિની પ્રમુખ ૧૬ આર્યાઓ સહિત ગિરિજાની શુભ યાત્રા નિમિત્તે સંધ સાથે વિહુર કર્યો.

આપણે ઉપર જેઠ ગયા છીએ કે આ સંધમાં અનેક મહાધ્યવાળાં શ્રાવક શ્રાવિકાએ હતાં જેમાંના આ પ્રધાનપણે છે, સહુથી પ્રથમ આ સંધસેનાના સેનાપતિ શેઠ રયપતિ, પૃષ્ઠરક્ષક શેઠ રાજસિંહ, પ્રખલ યોજ્ઞાએ શેઠ મહણુસિંહ, જવણુપાલ..

લોણ, કાલા, ફેરા, દેપાલ, ગોપાલ, તેજપાલ, હરિપાલ, મોહણ આહિ. સંઘ સાથે ૫૦૦ ગાડાં, ૧૦૦ ઘોડા અને બહુ સંખ્યક પાયદળ હતાં, સ્થાન સ્થાન પર કૈન શાસનની મહાન પ્રભાવના કરતો. સંઘ સંખેચરણ પહોંચ્યો, ત્યાં પુરુષાદ્ધાનીય શ્રીપાર્વતીનાથ પ્રભુની યાત્રા મહાપૂજા, ધ્વજારોપણાહિ શુલ્ક કાર્ય કરીને મુસલમાન સ્થોનેદારોની સહૃદયતા તથા અધિષ્ઠાયક દેવના સાન્નિધ્યથી સમસ્ત શ્રીસંઘ ગિરિજાજ શ્રીશત્રુંજ્યની તળેટી (પાલીતાણા) માં આવ્યો, ત્યાં શ્રીપાર્વતીનાથ પ્રભુની સમારોહ પૂર્વક યાત્રા પૂજા કરી અને આષાઢ વહિ દના રોજ સમસ્ત સંઘે પરમપુનીત ગિરિજાજની યાત્રા કરી તીર્થપતિ પરમ તારક વીત-સાગ પરમાત્મા શ્રીઆહિનાથ સ્વામીનાં ભક્તિસિક્તા હૃદ્યે દર્શન કરી ભવ્ય છુંબોએ સ્વજનમાંતરના મિથ્યાત્વાંધકારને દૂર કરી અનિર્વચનીય આનંદનો અનુભવ કર્યો.

આ ઉપર્યુક્ત સંઘમાં ધણ્ણા ખરા એવા પણ શ્રાવકો હુશે કે જેણે સર્વ પ્રથમજ આ અતિઉત્તમ તીર્થભક્તિનો લાલ પ્રાસ કર્યો હુશે. પોતાના પરમ આરાધ્ય દેવને નિહુણી કયા માણુસને અવણુંનીય આનંદ ન થાય ? એવા માણુસોના હૃદયમાં જે અતિ વિશુદ્ધ ભાવનાએનો ઉદ્ભબ થાય છે તે અન્ય શ્રદ્ધા વિદ્ધીનોને સંભવ નથીજ.

આ યાત્રા કરતાં શ્રીજિનકુશલસૂર્યા મહારાજની માન-સિક પરિસ્થિતિમાં ખૂબજ પરિવર્તન થયું હતું, પ્રભુની ભવ્ય પ્રતિમાના શુલ્ક દર્શન કરી હૃદયમાં ઉચ્ચાશ્રેણીની ભાવનાએનો પ્રવાહ વહેવા લાગ્યો. જે સર્વથા સ્વાભાવિક છે. પોતાની ઉત્કૃષ્ટ વિચારધારાને તરતજ એક સ્થાન પર કેન્દ્રિત કરી સ્વસૂક્ષમ-

પ્રતિલા વડે તરતજ નવીન શ્લોકોમાં ભગવાનની સ્તવના કરવા માંડી. એટલું તો દરેક માણુસે સ્વીકાર કરવુંજ પડશે કે જ્યારે કોઈ પણ માણુસ પવિત્રતમ સ્થાનોમાં પહોંચી જય છે ત્યારે તેના હૃદયની પરિસ્થિતિની વાત તો કોણું કરે ? પરંતુ યેડી ક્ષણે માટે આખાએ જીવનમાંજ આમૂલ પરિવર્તન થઈ જય છે. જ્યાં જ્યાં એવા મહુાન પુરુષોએ પોતાના જીવનો અહુમૂલ્ય ભાગ ગાળી કેવળ માનવ સંસ્કૃતિજ નહીં, પણ પ્રાણીમાત્રના સુખની ગંભીર ગવેષણા કરી છે, એવી જગ્યાએ ભાવનાશીલ વ્યક્તિ પહોંચવાથી આખુંચે એમનું કાર્ય આદર્શ આંખો સામે નાચવા લાગે છે, રોમાંચ થઈ જય છે, સારુંએ સંસાર શૂન્યવત્ત અવલાસે છે.

મુનિઓએ પોતાની ચિરકાળની ભાવના પ્રભુની ભાવપૂજા કરીને શાન્ત કરી ત્યારે શ્રાવકવર્ગે દ્રોય અને ભાવપૂજાએ વડે પોતાની લક્ષિત યત્કિંચિત રૂપેણું વ્યક્ત કરી તેમાં સર્વ પ્રથમ સંધપતિ શેઠ રથપતિએ સપરિવાર પ્રભુના નવાંગોની સ્વર્ણમુદ્રાએ વડે પૂજા-અર્ચના કરી, ત્યાર પછી અન્ય મહર્દીક શ્રાવક સમુદ્ધાયે પણ સ્વશક્તિ અનુસારે પૂજનો લાભ લઈ નર જનમની સક્ષળતા માની. એજ હિવસે સૂરજિએ શ્રીયુગાહિ હેવ સમક્ષ યશોભદ અને હેવલદ નામક ક્ષુલ્લકોને દીક્ષા આપી.

જ્યારે આવા વિશાળ શ્રીસંધનું આગમન પાહલિમપુર (પાલીતાણા)માં થયું ત્યારે અહીં રાજ મહિપાલનું આધિપત્ય હતું એમ યુગપ્રધાનાચાર્ય ગુર્વાંવલિથી ઇલિત થાય છે, સંધવી મહોદ્દે સૌરાષ્ટ્રનરેશનાજ અન્ય હેઠું સમા શેઠ મોખ-હેવ અને એમના નાના બન્ધું તથા શ્રીશ્રીમાલ છજજલ કુલ-

પ્રહીંપ રાજસિંહે નાના પ્રકારના મહેતસવો પૂર્વક સંધ્યપૂજા સ્વધર્મિવાત્સલ્યાહિ પવિત્ર કર્યો કરી મુણ્યોપાર્જન કર્યું આખાડ વહિ ટને દિવસે યુગાદિહેવના મૂલમંહિરમાં શ્રીનેમિનાથજી આહિની પ્રતિમાચો, સમવસરણુ, શ્રીજિનપતિસૂરિ શ્રીજિનેશરસૂરિ આહિ ગુરુભિંગોની પ્રતિષ્ઠા મહાનુ ઉત્સવ સહિત શ્રીજિનકુશલકસૂરિજી મહારાજે સ્વહુસ્તે કરી, એજ દિવસે પાટણુના શેડ તેજપાલે સ્વધાર્યુ રદ્રપાલયુક્ત પાટણુમાંજ પૂર્વ પ્રતિષ્ઠિત શ્રીયુગાદિહેવના બિંઘને સ્વનિર્માપિત નવીનતમ પ્રાસાહમાં સ્થાપિત કર્યું. તે સમયે પ્રાસાહ પ્રતિષ્ઠા આહિ અધિ સાધ્યુચિત ફિયાચો પણ આચાર્ય મહારાજે કરાવી.

આખાડ વહિ ટ ના દિવસે મૂળ મંહિરમાં માળારેાપણ સમ્યક્તવ અહુણુ, નવવિધપરિથહુ પરિમાણુ, સામાયિકાહિ શ્રાવકો-ચિત વતો અહુણુ કરવા માટે વિશાળ નંદીમહેતસવ થયો, ખીજાં પણ અનેકો શ્રાવક શ્રાવિકાચોએ પોતપોતાની શક્તિ અનુસારે વત અહુણુ કરી સંધ્ય યાત્રાની સમૃતિ કાયમ કરી, આ પ્રસંગે સુખકીર્તિ ૧ગણિને વાચનાચાર્ય પહ આપ્યું, નવનિર્મિત પ્રાસાહ પર ધ્વજદ્વાર ચઢાય્યો, આ રીતે પવિત્રતમ તીર્થ શત્રુંજય ઉપર હસ દિવસ પર્યાત મહેતસવોનો ભારે સામરોહ રહ્યો. તેમજ ઉપર્યુક્ત મહેતસવમાં ઉચ્ચ નગરના રોડુલ હેમલના પુત્રરત્ન માચે નામના કડુવા શ્રાવકે પોતાના લત્તીજા હરિપાલ સાથે ૨૬૭૪ દ્રમમની મોટી જોલાવી ઈન્દ્રપહ અંગીકાર કર્યું, ધીખુના પુત્ર ગોસલે ૧૦૦ દ્રમ વ્યય કરી

૧ એમની દીક્ષા સં. ૧૩૪૨ વૈશાખ શુદ્ધ ૧૦ને દિવસે જાયોરમાં શ્રીજિનચંપસૂરિજીના કરકમબો દારા થઈ હતી.

મંત્રીપદ લીધું. આ વિરાટ ઉત્સવના અંગે તીર્થલંડારમાં ૫૦૦૦૦ની આવક થઈ, બાદ ખાદ્યાય જણ્ણા ગિરનારણ તરફ પ્રયાણ કરી ગયા.

અનુકૂળે પ્રયાણ કરતા જ્યારે ખંગારગઢ આવ્યાં ત્યારે ત્યાંના અધિપતિએ ઉચ્ચરાજકર્મચારી તથા નાગરિકો સાથે સંઘના સામે જઈ ભાવસીનો સતકાર કર્યો. રાતખર ત્યાં નિવાસ કર્યા બાદ પ્રાતઃકાવ ખંગારગઢ ગામમાં ચૈત્યપ્રવાડી કરી આપાઠ સુદ્ધિ ૧૪ના રોજ રૈવતાચલના ઉપર આભાલથ્રદ્વારાચારી કન્હાર્પવિજેતા શ્રીનેમિનાથ ભગવાનની ચાત્રા કરી. અહીં પણ સંઘપતિ શેડ રચનાના સ્વર્ણમુદ્રાએથી નવાંગ પૂજા શત્રુંઝ પ્રમાણે કરી, આચાર્ય મહારાજે પણ નવીન સ્તુતિ સ્તોત્રાદિ રચીને ભગવાનની અક્રિત પૂર્વક ભાવપૂજા કરી. એજ પ્રસંગે માંગડોરના શાહુ જગતસિંહનો પુત્ર જ્યતા ધણ્ણાં અલિંગણો લઈને જિનવંદનાર્થ ગિરનારણ આવ્યો હતો. ખંગારગઢ નિવાસી મહાર્દીક રીહટુ. કાંદિણ રી૦ (?) પુત્ર રત્ન શા. મોખાદિ શ્રાવકોએ સમ્યક્તવ, સામાયક, પરિથ્રણ પરિમાણાદિ વ્રતો શ્રહુણ કર્યાં. સંઘપતિ આદિ શ્રાવકોએ શત્રુંઝની પેઠે ૪ દિવસ સુધી મહાપૂજા, ધજદારોપણાદિ મહોત્સવો કર્યાં. હુમીરપતન નિવાસી શા. ધીણાના પુત્ર ગોસલે ર૪૭૪ દ્રષ્ટમ સમર્પિત કરી ઈન્દ્રપદ તથા શેડ કાલાના પુત્ર બીજાએ ૧૦૦ દ્રષ્ટમ વ્યય કરી મંત્રીપદ લીધું, એવીજ રીતે અન્ય ધનવાનોએ પણ વિપુલ ધનરાશિનો ઉદ્ઘારભાવે સહ્ય કરીને સ્વભુલે પાર્નિત વિતનો લાહો લીધો. અહીંના લંડારમાં બધી મળીને ૪૦૦૦૦ રૂપિયાની આવક થઈ.

પોતાના સધળાં મનોરથો પરિપૂર્ણ થવાથી કયા માણુસનું
હૈયું હુર્વિત ન થાય? સંઘપતિ શેડ રયપતિએ પોતાની
મનઃકામના સંપૂર્ણતયા પૂરી થઈ જાણીને મુશ્તહસ્તે સ્વર્ણ,
વખ, અલંકાર આહિ ઉચિત વસ્તુઓનું હાન એવું કર્યું કે જેથી
સમસ્ત સૌરાષ્ટ્ર દેશમાં વસ્તા યાચકેાની મનોવાંચા પૂર્ણ થઈ.

સમસ્ત શ્રીસંધ સહિત વિહાર કરતાં શ્રીજિનકુશળ-
સૂરિજી મહારાજ શ્રાવણ સુદી ૧૩ સે નિર્વિક્ષતયા પાઠણ
પધાર્યા, આપોએ સંધ ૧૫ દિવસ નગર અહાર રહ્યો લાદ.
પછ કૃષ્ણા એકાદશીને દિવસે શુભ સુહૃત્તમાં શેડ રયપતિ અને
તેજપાલના પ્રયત્નોથી થયેલ મોટા ઉત્સવ પૂર્વક નગર પ્રવેશ
થયો. સંઘવીએ બીજી વાર પાઠણમાં યાચકેાને પુષ્કળ હાન
આપ્યું. બાદ પોતાના સમાદરખણીય પરમ મૂળય ગુરુમહારાજના
ચરણું કમલમાં મસ્તક નમાવી તેમની આજ્ઞા પ્રાપ્ત કરી સંધ
સાથે દિલ્હી પ્રયાણ કર્યો. માર્ગમાં આવતાં અનેકો જિનાલયોનાં
દર્શન કરતો કરતો સંધ શ્રીજિનચંદ્રસૂરિજીના નિર્વાણ સ્થાન
કોશવાણું આવી પહોંચ્યો. ત્યાં તેમના સ્તૂપ પર ધ્વજ ચઢાવી
મહાપૂજા કરી વિલેપનાહિ કર્યાં, ત્યાંથી ઝ્ળોધિ આવી પાર્વતી
નાથ લગવાનના દર્શન કર્યાં અન્ય દેશના માણુસો જે ઝ્ળોધિ
માં આવી સંધ સાથે જોડાયા હતાં તે બધાએ પોત પોતાના
સ્થાનો તરફ વળ્યા. સંઘપતિ શેડ રયપતિ જે માર્ગ આવ્યા
હતા તે માર્ગેજ ચાલતા ચાલતા કાતીક કૃષ્ણા ૪ ને દિને દિલ્હી
પહોંચ્યા. બાદશાહ દ્વારા સન્માનિત એવા પોતાના પુત્ર શ્રી
ધર્મસિંહ નિર્ગમન મહોત્સવ કરતાંએ વિશેષ સમારોહ પૂર્વક
નગરપ્રવેશોત્સવ કર્યો.

ગ્રંથાચળું

લી મ પ હતી નો સ ધ



ટણુમાં ચાતુર્માસ યાપન કર્યા બાદ
સં ૦૧૮૯૧ વૈશાખ વહિપના હિવસે શાંતિ-
નાથ જગવાનના વિધિચૈત્યમાં ચરિત્ર-
નાયક ગુરુહેવ શ્રીમાન् જિનકુશાળસૂર્જ મહારાજ સાહેભની
નિશ્ચામાં એક વિશાળ પ્રતિષ્ઠા મહેતસવ સંપત્ત થયો. જેમાં
દીલદીના શ્રીશ્રીમાલ રૂદ્રપાલ, નીંબા, જલોાર નિવાસી મંત્રી
બોજરાજના પુત્રરત્ન સલખણુસિંહ, રંગાચાર્ય લખણા એવ
સાચોાર નિવાસી મંત્રી મલયસિંહ, લીમપદ્લીવાળા શોડ શ્રીવીર-
હેવ, ખંલાતના વ્યવહારી છાડા, શ્રીથોથા તથા વેલાકુલ
(વેરાવળ)ના શાંત હેવપાલ, મંત્રી કુમર, શાંત ઝીમડ આહિ
શ્રાવકેનો સમૂહ આવ્યો હતો, પનદર હિવસ પર્યન્ત પ્રતિ-
ષ્ઠોત્સવની બહુજ ધામધૂમ થઈ, ચોથના હિવસે શોડ તેજપાલ
રૂદ્રપાલ, શ્રીશ્રીમાલ શાંત આના, રાજસિંહ, ભણુશાળી લુણા,
શાંત ક્ષેમસિંહ, હેવરાજ, ભણુશાળી પદ્મા, મન્ત્રા આહિ સમસ્ત
પાઠખુના સંઘે જલયાત્રા પૂર્વક પ્રતિષ્ઠા મહેતસવ કર્યો.

પ્રતિષ્ઠા સમયે આચાર્ય મહારાજે જલોાર માટે મહાવીર
દિંબ, હેવરાજપુર માટે આદિનાથ દિંબ, શરૂંજય ઉપર આવેલ

અનુહાવસહીના લુણોદ્ધારાર્થ શાંત છજજલ પુત્ર રાજસિંહ અને
માખડેવ કારિત શ્રેયાંસનાથાહિ જિનપ્રતિમાચો અને ભણશાળી
લૂણું કારિત શાનું જય ઉપરના અષાપદમાસાદ નિમિત્તે ચતુર્વિંશતિ
જિનબિંખ આહિ ૨૫૦ અઠીસો પ્રસ્તર (પાણાખુ)ની તથા
પિતાળની અગાંશુત મુર્તિએ, ઉચ્ચપુર અર્થે શ્રીજિનનદતસૂરિ
તથા જલોર અને પાટણુ માટે શ્રીજિનપ્રમોધસૂરિ,* હેવરાજપુર
(હેરાડર) ચોણ્ય શ્રીજિનચંદ્રસૂરિ અને ચાણિકા, બીજી પણ
અધિષ્ઠાયકાહિની પ્રતિમાચો અને સ્વલ્પાદરચોણ્ય સમવસ-
રણુપટની પણ પ્રતિષ્ઠાચો કીધી.

વૈશાખ વદી ૬ને હિને પ્રત અહુણુ માલારોપણ આહિ
નિમિત્તે નન્દીમહેતસવો અતિશય વિસ્તાર પૂર્વક કરવામાં
આયાં, તે પ્રસંગે હેવલદ્ર અને ચેશોભદ્ર, આ ખને સુનિએને
વડી દીક્ષા તથા સુમતિસાર, ઉદ્યસાર અને જયસાર, આ
ત્રણુ સુનિએને તેમજ ધર્મસુનદરી અને ચારિત્રસુનદરી, આ
ખને આર્યાએને દીક્ષાએ આપવામાં આવી. જયધર્મ ગણિને
ઉપાક્યાય પદ્ધથી અલંકૃત કર્યા તેમજ ખનું સંખ્યક સાધ્વી

*આ પ્રતિમા અત્યારે હેલગાડામાં નિધમાન છે, જેનો લેખ બાધુ-
પૂર્ખચંદ્રજી નાહરના લેખ સંગ્રહમાં ૧૧૮૮ લેખાંક તરીકે પ્રસિદ્ધ થયો
છે. મેહા નામના આવકે આ પ્રતિમા ભરાવી હતી.

૧ આ પ્રતિમા બીજાનેરના મહાવીરજીના (વેદોવાળા) મંહિરમાં છે,
જેનો લેખ આ પ્રમાણે છે.

“ સંવત् ૧૩૮૯. વૈશાખ વદી ૫ શ્રીજિનચંદ્રસૂરિશિષ્યૈ:
શ્રીજિનકુશલસૂરિમિરંબિકા પતિષ્ઠિ[તા]તમ્ (૧)”

અને શ્રાવિકાઓએ માળાએ અહુણુ કરી, અને ધણ્યાએ શ્રાવકોએ દ્વારા પતે અંગીકાર કર્યાં

ભીમપદ્લીના સુવિખ્યાત શ્રાવક શ્રીમાન् વીરહેવ આહિની વિનયાંકિત વિજાપુરિથી સૂરિલુ મહારાજ પાટણુથી વિહાર કરી વૈશાખ વહિ ૧૩ ને હિને ભીમપદ્લી પદ્ધારી મહાવીરસ્વામીની પ્રતિમાના હર્થન કર્યાં, તે પ્રસંગે શેઠ વીરહેવે મોટા ઢાઠમાઠથી પ્રવેશોત્ત્સવ કરી ગુરુભક્તિનો અપૂર્વ લાલ લીધેલું શુદ્ધ ગુરુનો જયાં સંચોગ અને વાહુની શ્રવણ કરવાનું સૌલાભ્ય પ્રાપ્ત થાયત્યાં આધ્યાત્મિક લાવનાએનાં અરણ્યાં છૂટે એ સ્વાભાવિક વાત છે, તદ્દનુસાર સૂરિલુ મહારાજના પદ્ધારવાથી ભીમપદ્લીની જૈન જનતામાં ધર્મધ્યાનની અનુપમ લહેરીએલ ઉછળવા માંડી હતી. શ્રાદ્ધવર્ય શ્રીમાન् વીરહેવે પોતાના લઘુખંડું શાં માલહેવ સાથે યવનસપ્રાટ જ્યાસુદીન પાસેથી શત્રું જય યાત્રા નિમિત્ત શાહી આજા પ્રાપ્ત કરી કંકુપત્રિકાએ દ્વારા દેશદેશાંતરના સમસ્ત શ્રીસંધને પોતાના તરક્કથો નિકળનાર યાત્રીસંધમાં લાગ લેવા નમૃતા પૂર્વક આમંત્રણ આપ્યું.

કુમશઃ અનેકો શ્રામનગરોનો સર્વ શ્રીસંધ એકત્ર થવાથી જેઠ વહિ પને શુભ સુહૂર્તમાં શેઠ વીરહેવને સંધસ્કપી સેનાને સંચાલિત કરવા માટે સૂરિલુએ સંધપતિ પદ પ્રહાન કર્યું. શેઠ રાજહેવના પુત્રરતનો ઝાંઝા, શાં પૂર્ણપાલ, શાં સુંટા, આ ત્રણે ભાઈએ અત્યાંત શક્તિસંપત્ત વીરયોધ્યાએ હતા, જેથી એએ સંધના પૃથ્વરક્ષક તરીકે નિયુક્ત થયાં. આચાર્ય લગ્નાન શ્રીજિનકુશલસૂરિલુ મહારાજ પુષ્પકીર્તિ, સુખ-

કીર્તિ આહિ ૧૨ ભાધુ તથા ગ્રવર્તિની પૃષ્ઠયસુનદરી આહિ અમસ્ત સાધ્વીએ સહિત સંઘની સાથે હતા, માર્ગમાં શ્રીસંઘને દર્શન એવં પૂજા કરવાની વ્યવસ્થા માટે શેડ વીરહેવ કારિત હેવાલયમાં ચતુર્વિંશતિજિનપૃષ્ઠક ર્થાપિત કરી સંઘની સાથે રાખ્યું, જે કે ચતુર્માસ અહુજ નણુક હતો. તો પણ આચાર્ય મહારાજ શ્રીસંઘની લાવલીની પ્રાર્થનાનો અસ્વીકાર ન કરી શક્યા, કારણું કે શ્રીસંઘ તો તીર્થીકર લંગવંતો માટે પણ આદરણીય હોય છે. આ સંઘ સાથે અનેકો જિંદ બોડા આહિ વાહુનો તથા અગણિત પાયદળ યાત્રિએ હતા.

અત્યન્ત સમારોહ (ડાઠ) પૂર્વક લીમપદ્ધીથી પ્રયાણ કરી અણે હિવસની સ્થિરતા કરતાં વાયડ નગરમાં પ્રલુબ શ્રીમહાદીર સ્વામી અને સેરીસામાં લગવાનું પાર્થનાથ સ્વામીની ધ્વજારોપણાહિ મહાપૂજા પૂર્વક તીર્થયાત્રા કરી ત્યાંથી અત્યન્ત સ્નિકટવર્તી આશાપદ્ધીના સુખીયા શ્રાવક સહયોગાલ, મંડળીક, ઐજલ આહિ વિધિસંઘની વિજાપુનિ. સ્વીકાર કરી સૂરિજ મહારાજ સંઘ સહિત આશાપદ્ધી પદ્ધત્યા અને ત્યાંના સંઘ તરફથી થએલ મોટા સમારોહ સાથે આહિનાથ લગવાનના દર્શન કરી માલારોપણોત્સવ કર્યો.

બાદમાં ત્યાંથી આગળ દરેકે દરેક સ્થળે ધર્મની મહાન પ્રભાવના પૂર્વક જૈન સંસ્કૃતિની વિજય વૈજ્ઞયન્તી કરકાવતો સંઘ કુમશઃ ખંભાત આવી પહોંચ્યો, તે સમયે ખંભાત જૈન સંસ્કૃતિ અને સસ્યતાનું એક મોટું કેન્દ્ર ગણ્યતું. સંઘપતિ શેડ વીરહેવે નગરના સર્વ લોકોને એકઢા કરી સંઘસહિત સૂરિજ મહારાજનો વર્ણનાશક્ય લંબ્ય પ્રવેશો-

તસવ કર્યો, જૈન શાસનના ધર્તિડાસમાં આ પ્રવેશોત્સવનું સ્થાન અત્યન્ત મહૃત્વપૂર્ણ ગણુવામાં આવે છે, ગુજરાતના હિન્દુ રાજ્યકાલમાં જેવી રીતે પ્રસિદ્ધ વીર તથા સાહિત્યિક મંત્રીશ્વર વસ્તુ પાલે સં. ૧૨૮૬ માં શ્રીજિનેશ્વરસૂરિજી મહારાજનું અને યવનોના રાજ્યકાળમાં શેઠ જેસલે વિ ૧૩૩૪ યા ૧૩૬૭ માં શ્રીજિનયંત્રસૂરિજીનો નગર પ્રવેશોત્સવ કર્યો હતો તેવીજ રીતે આ ઉત્સવ પણ પૂર્વની હિન્દુ રાજ્યકાલની સ્વર્ણમય ધર્મિઓનું સંદર્ભણું કરાવી રહ્યો હતો.

આચાર્ય શ્રીજિનકુશાલસૂરિજીએ શ્રીસંઘસહિત અજિતનાથ સ્વામીની અનેનવાંગી વૃત્તિકારક શ્રીઅલયહેવસૂરિજીએ સ્વનિર્મિત જ્યતિહુઅણુ સ્તોત્રદ્વારા પ્રકટ કરેલ શ્રીસ્તંભન પાર્થનાથ સ્વામીની નવનિર્મિત સ્તુતિ સ્તોત્રો વડે સ્તવના કરીને લક્ષ્મિ પૂર્વક યાત્રા કરી, લાર પછી નિરંતર આહુદ્વિષસ સુભી સંઘપતિશેઠ વીરહેવ આહિ સંઘના મહુદ્વિર્ધક શ્રાવકોએ અંભાતના શ્રીસંઘ સાથે જિનાલયમાં મહુદ્વનારોપણ પુરસ્સર મહાપૂજા, અવારિત અજસત્ર (દાનશાળા), સાહુમીવચ્છલ અને ઈંદ્રપદ અહુણું આહિ વિશાળ મહેાસવોમાં મુફ્કલ દ્રોધ વ્યય કર્યો. શેઠ કંડુઆના પુત્રરતન હોઠ ખામરાજના નાનાલાઈ હોઠ સામળે ૧૨૦૦ બારસો દ્રમ અર્પણ કરી ઈન્દ્રપદ અહુણું કર્યું, તેમ અન્યાન્ય શ્રાવકોએ પણ

૧ આ શ્રાવકે ખંલાતન્ન ડાઢિકા પાડામાં શ્રીઅજિતનાથ લગવાનતું વિધિચૈત્ય અને પૌષ્ઠ્રશાલા બનાવરાવી હતી. આ જિનાલયને લેખ નાહણુના પ્રાચીન જૈન લેખ સંગ્રહના ભીજ ભાગમાં પ્રકટ થયો છે.

સ્વસ્ત્વયોગ્યતાનુસાર મંત્રી આહિ વિવિધ પદો અહુણુ કર્યાં. આ રીતે ખંબાતની યાત્રા સાનંદ પૂર્ણ કરીને સમસ્ત સંઘે પરમખુનીત તીર્થાધિરાજ શ્રીસિદ્ધાચળજ તરફે પ્રયાણ કર્યું.

તે સમયે હેશની પરિસ્થિતિ અત્યન્ત લયંકર દશામાં
હતી. સ્થાને સ્થાને રાજવિભાગો ઉપસ્થિત હતા, જ્યાં જ્યુંઓ
ત્યાં ભયના કારણે આમતે, શું? પણ મોટા મોટા નગરો-શહેરો
પણ શૂન્ય થઈ રહ્યા હતા, છતાં ગુરુહેવની અનુપમ કૃપાથી આનંદ
પૂર્વક ચાલતો ચાલતો અમસ્ત શ્રીસંધ અનુકૂળે ધંધુકા
નગરે પહોંચ્યો, ત્યાંના પ્રધાન શ્રાવક મંત્રીદલીય ઠકુર ઉદ્ઘા-
કરણ આહિએ સંધની બકિત ખડુ સારી કરી.

અહીંથી વિહાર કરી પાલીતાણા પહેંચાંચી શુરૂ હેવે શ્રીસંધ્બ
સહિત ખીજુ વાર યાત્રા કરી અને અદ્વિતીય ભક્તિરસથી
પૂર્ણ સુન્દરતમ સ્તોત્રો વડે પ્રભુની સ્તુતિ કરીને કૃતાર્થ થયાં
સંઘાધિપતિ શેઠ વીરહેવ, પૃષ્ઠરક્ષક મંં૦ જાંગા, શેઠ તેજપાલ
ને મયંદ, દ્વિલ્હી નિવાસી શ્રીશ્રીમાલ રૂરપાલ, શાંત નીમહેવ,
મંત્રીહલીય ઠ૦ જવણુપાલ, શાંત લખમા, જાંલોર નિવાસી
શાંત પૂર્ણચંદ્ર સહજ, ગુ[૬]હાના શાંત વધૂ આહિ શ્રીમત
આવકોએ ૧૦ હિવસ પર્યન્ત ગિરિજાજ પર મહાંવાળરોપણ
મોટીપૂજા, અવારિતસત્ર સ્વધર્મીવાત્સલ્ય, સંધ્બ પૂજા અને
ઇન્દ્રપદાહિ મહાનુ ઉત્સવો કર્યાં. યાચકોને અજ્ઞ વસ્તુ અલંકાર
આહિ આપીને વૈન શાસનની મહુતી પ્રભાવના કરી.

શાહુ લોહટના પુત્રરતન શાંત લખમાણે ૩૭૦૦ રૂપિયા
સમર્પિત કરી ઈન્ડ્રપદ અહુષુ કર્યું. દિલ્હી નિવાસી શ્રીશ્રીમાણ
સુરજરાજના પુત્ર રૂપપાલના લધુ બાંધવ નીમહેવે ૧૨૦૦

ભારતો દ્રવ્યમ અરચી મંત્રી પદ લીધું તેમ અન્યાન્ય ધનવાન શ્રાવકોએ પણ ખીજાં વિવિધ પહોં લીધાં, ખધી મળીને ૧૫૦૦૦ રૂપિયાની યુગાહિદેવના ભંડારમાં આવક થઈ.

શ્રીઆહિનાથ ભગવાનના વિધિચૈત્યમાં નવનિર્મિત ચોવીસ જિનાલય હેવકુલિકાએ પર પૂજયશ્રી દારા પ્રતિષ્ઠિત કલશ ધ્વજાહિ ચઢાયાં. તહેનાંતર સૂરજિ મહારાજ સમસ્ત સંઘ સહિત તત્ત્વાર્થી આય્યા, લાંથી પાછાં કરતાં પુનઃ સેરીસામાં પાર્શ્વનાથની યાત્રા કરી સંચેષ્યર આય્યા. ત્યાં ચાર દિવસે રોકાઈ સંઘ તરફથી મહાપૂજા ધ્વજારોપણાહિ ઉત્સવો થયાં ત્યાંથી પા(માં)ડલ આમે આવી શ્રીનેમીશ્વર પ્રભુને સંઘ સહિત વંદન કર્યું; સૂરજિએ સ્વપ્રતિબા વડે નવીન સ્તોત્રો રચી આત્મગુણુની પ્રેરણાદાયક પ્રભુનાં ગુણગાન કર્યાં, ખાદ અનુ-કુમે ગામેગામ વિચરણ કરતાં કરતાં શ્રાવણ સુહિ ૧૧ ને દિવસે ભીમપહી પાછાં આય્યા, શેડ વીરહેવ કૃત અનુપમ જમારાહ સાથે નગર પ્રવેશ કરીને શ્રીમહાવીર ભગવાનની ભૂયતમ પ્રતિમાનાં હર્યન કરી ધન્ય થયા, સંઘના દેશાંતરીય યાત્રાળુએ સંઘપતિદ્વારા સમ્માન પ્રાપ્ત કરી સ્વસ્થાને ગયા.

વિ. સં. ૧૩૮૨ વૈશાખ સુહિ ૫ ના દિવસે શેડ શ્રીનીર-હેવે દીક્ષા માલારોપણાહિ નન્હીમહેતસવો કર્યાં સૂરજિ મહા-રાજે વિનયપ્રલ, નીતિપ્રલ, હરિપ્રલ, સોમપ્રલ, આ ચાર મુનિઓ અને કુમલશ્રી લલિતશ્રી, આ એ સાધીઓને દીક્ષા આપી, અનેક સાધી શ્રાવિકાએ માલા અહુણ કરી, સમ્યક્તવ આમાયિક. પરિશ્રહપરિમાણુહિ વતો લીધાં. આ ઉત્સવમાં

સ્થાનીય સંઘ તેમજ પાટણ, પાલનપુર, બીજાપુર, આશા પદ્ધતી આદિ નગરોના શ્રાવકોએ એકત્રિત થઈ શાસન શોભામાં અલિવૃદ્ધિ કરી અને ગ્રણુ હિવિસ લગી અમારી ઉદ્ઘોષણા કરવામાં આવી હતી. આચાર્ય શ્રીજિનકુશળસુરિલુ મહારાજના તત્ત્વાવધાનમાં આ સમારોહ હિન્દુ રાજ્ય કાલની માર્કિંગ ચિત્તમાં આર્થિક ઉત્પન્ન કરે એવો હતો.

ત્યાર પછી સૂરિલુ મહારાજ સાચોરના શ્રીસંધની લક્ષ્મિપૂર્ણ વિજસિથી ત્યાં પદ્ધાર્યાં, શ્રીસંઘે ભાવલીના સમારોહ સાથે પ્રવેશોત્ત્સવ કરી મહાવીર પ્રલુના દર્શન કરાયાં, અહિં માસ-કલ્પાંયતીત કરીને લાટહદ નામના સ્થાને પદ્ધાર્યાં, ત્યાં પણ સંઘના ભાવલીના સ્વાગત પૂર્વક શ્રીમહાવીર ભગવાનને વંદન કરી ૧૫ હિવિસ સુધી ધર્માપદેશ દ્વારા જૈનશાસનની મહુતી પ્રલાઘના કરીને અનુકૂળ બાડમેર પદ્ધારી આદિનાથ પ્રલુનાં દર્શન કર્યાં, અને સંઘના અત્યાખ્યાતથી ચોમાસું પણ ત્યાંજ યાપન કર્યું, અતેજ ચૈત્યવંહનકુલકૃતિ નામક અમૂલ્ય ટીકાઅન્થની રચના કરી જે સુરતથી પ્રકટ પણ થઈ ચૂકયું છે.

સંવત ૧૩૮૮ પોષ સુહિ ૧૫ ના દિને શાઠ પ્રતાપસિંહ આદિ સ્થાનીય શ્રાવકોના આગ્રહુથી જેસલમેર, લાટહદ, સાલ્ય-પુર, પ્રલુબાદનપુર આદિના શ્રાવકોની સમક્ષ અમારીદોષષ્ટ પૂર્વક ઉપસ્થાપના (વડી દીક્ષા). માલારેપણુ, સમ્યકૃત્વોચ્ચરણ પ્રલુટિ ક્રત અહુણુ નિમિત્તે નન્હીમહેલાત્સવો સર્વપજ્ઞ થયાં, એજ વર્ષે જાલોર શ્રીસંધની અનુરોધપૂર્ણ વિનંતિ પર ધ્યાન આપી સૂરિલુ મહારાજ બાડમેરથી બિહુાર કરી લક્ષ્મિપેટક

આવ્યા, ત્યાં સૂરિલુના પૂર્વજ વાહુત્રશાંત ઉદ્ધરણે શ્રીશાંતિનાથ જિનાલય નિર્માણ કરાવ્યું હતું અને સ્વયં ચરિત્રનાયકના શુદ્ધેવ શ્રીજિનાયંદ્રસૂરિલુનો જન્મ અને દીક્ષા પણ એજ નગરમાં થયાં હતાં, આ વાત એવે ખાસ નોંધ કરવા લાયક છે.

લવણુષેટકથી પ્રયાણુ કરી પોતાની જન્મભૂમિ શમ્યાનયન-સમિયાણુ (ગઠ સિવાણુ) પધાર્યાં ત્યારે ત્યાંના શ્રાવક સમૃદ્ધાયે કરેલ બહુજ લાવલીના સતકાર પૂર્વક શ્રીશાંતિનાથ પ્રભુનાં દર્શન કર્યાં. કોઈપણ પોતાના ગામનો વ્યક્તિ જ્યારે સર્વાંગપૂર્ણ ચોગ્યતાના બળે ઉચ્ચ સ્થાનપર પહોંચે ત્યારે એ ગામના લોકો એના પર ગૌરવ લે અને ડાંચા આસન પર એસાડે એ સર્વથા સ્વાભાવિક વાત છે.

આ રીતે ખાડમેરથી વિહાર કર્યાં ણાદ લવણુષેટક અને સમિયાણુના શ્રાવકોને સંતુષ્ટ કરી સૂરિલુ મહારાજ જાલેાર પધાર્યાં, સંઘે મોટા આડંબર વડે પ્રવેશોત્ત્સવ કરાવ્યો. સ્વપ્રતિષ્ઠિત લગવાન મહુવીર સ્વામીની પ્રતિમાના દર્શન વંદન કર્યાં, ત્યાં મંત્રીશર કુલધરના વંશમાં દીપક સમાન મંત્રી લોજરાજનો પુત્ર સલખણુસિંહ, શાહ વાહુડ પુત્ર જંગણુ વગેરે સ્થાનીય સંઘ તરફથી શેડ હુરપાલ પુત્ર ગોપાલ આદિ ઉચ્ચનગર અને હેવરાજપુરનો શ્રાસંઘ પાટણુના શેડ તેજપાલ, રૂરપાલ આદિ અને જેસલમેર, સમિયાણુ શ્રી-શ્રીમાણ (લિન્નમાણ) સાચોાર, ઝુંઢા પ્રલૂટિ અનેક નગરોનાં સંઘ સમસ્ત તરફથી ૧૫ દિવસ લગ્ની દીક્ષા શ્રદ્ધા અનુષ્ઠાની અલિલાકાવાળા વેસર્ણી મન્ડાતુલાબોને મુંદન સહારા

કરવામાં આવ્યો, અનેકો શ્રાવકોએ વિવિધ પ્રકારનું દાન કર્યું
અમારીઘોષણા દ્વારા જૈન શાસનની જગ્યાર પ્રલાવના કરતાં
વિ. સં. ૧૩૮૭ ફાગણ વહિ ૬ ને રોજ આચાર્ય મહારોજના
તત્ત્વાવધાનમાં વિરાટ મહેત્ત્સવ પૂર્વક જિનબિંબ પ્રતિષ્ઠા વ્રત-
અહુણું ઉપસ્થાપના પ્રત્રણ્યાઅહુણું, માલારેપણ અને સમ્યક્તવ
આરોપણ આહિ નનીમહેત્ત્સવો મનાવ્યા.

આ પ્રસંગે શ્રીજિનકુશલસૂરજુએ મંત્રોહલીય ૬૦
પ્રતાપસિંહના સુપુત્ર ૬૦ અચાલસિંહે ખનાવરાવેલાં બિહુાર
પ્રહેશાન્તર્ગત ધતિહુસવિશ્વુત રાજગૃહ પાસે વૈભારગિરના ચતુ-
વિંશતિ જિનાલયમાં મૂળનાયક યોગ્ય વીતરાજ પરમાત્મા
શાસનાધીશ્વર શ્રમણ લગ્નાન શ્રીમહાવીર સ્વામી વગેરે
અનેક પાથાણું તથા ધાતુમય બિમણો, શુરૂમૂર્તિઓ અને
અધિક્ષાયકોની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી, અને ન્યાયકીર્તિ,
લક્ષ્મિકીર્તિ, સૌમ્યકીર્તિ, જ્ઞાનકીર્તિ, અમરકીર્તિ, દેવકીર્તિ, આ
દ્વારા સાધુઓને દીક્ષા આપી તેમજ અનેકો શ્રાવક શાન્કિઓએ
માલા અહુણું સમ્યક્તવ મૂળ દ્વારાપ્રતાહિ ગૃહસથોચિત વ્રતો
અંગીકાર કર્યાં.

૧ ખીડાનેર સુપાર્થનાથ મહિરમાં ખાંવ્યપ્રભુની ધાતુમય પ્રતિમા
છે, તેના પર આ પ્રમાણે લેખ છે.

“સં. ૧૩૮૩ વર્ષે ફાળ્ગુન વદિ નવમીદિને સોમે શ્રીજિન-
ચન્દ્રસૂરિશિષ્ય શ્રીજિનકુશલસૂરિમિઃ શ્રીપાર્થનાથબિમ્બ પ્રતિષ્ઠિત-
કારિતં દો૦ રાજાપુત્રેણ દો૦ અરિસિહેન સ્વમાતૃપિતૃશ્રેયોર્ધ્વ”।

પ્રકેરણ પાંચમું



સિન્ધુ દેશમાં ધર્મપ્રચાર

આચાર્યવર્ય શ્રીજિનકુશલસૂરિજીનો લોકો—
તર પ્રલાવ હિન પ્રતિહિન વૃદ્ધિ પામવા લાગ્યો,
એમની ધવલકીતિંડ્પી વૈજ્યંતી સર્વત્ર ફેરફારી
થઈ ગઈ. મહુન આત્માચોના લક્ષણોમાંના થોડા
પણ લક્ષણોનો વિકાસ કોઈના લુધનમાં થાય તો એનું લુધન
અવશ્યજ ઉચ્ચ કક્ષાચે પહોંચે એ સ્વાભાવિક વાત છે.

આચાર્ય શ્રીજિનકુશલસૂરિજીએ તો પોતાનું સમય
લુધન સ્વપૂર્વનો દ્વારા નિર્માણિત પવિત્રતમ માર્ગ પરજ આધ્યાત્મિક
ક્ષું હતું, એમનો ઉપહેશ બ્યાપક હતો, માનવ સંસ્કૃતિ
અને સભ્યતાના આંતરિક રહુસ્યના ગંલીર તત્ત્વોનું પ્રદેશાદન
કરી સાર્વજનિક ઉજ્જ્વલ પથ નિર્માણ કરવાની એમનામાં અપૂર્વ
શક્તિ હતી. વાણીભળે જૈન ધર્મના અમૂલ્ય તત્ત્વોનો સર્વત્ર
પ્રચાર કરી વીતરાગ પરમાત્મા કથિત ધર્મનો પ્રચાર કરવા વડે
પોતાનું લુધન સાર્થક કરી તેમના સમકાળીન કહેવાતા
આચાર્યો આહિની આગળ એક ઉત્કૃષ્ટ આહર્ણી સ્થાપિત કર્યો
હતો. જ્યાં જૈનોના ઘરો બીજુલ નહોતાં ત્યાં પણ આચાર્ય શ્રીનો
વિહાર કોઈપણ સ્થળના રહિત નિરાણાધ પણ થતો હતો.

ભારતવર્ષના ઈતિહાસમાં સિન્ધુ દેશનું સ્થાન અત્યંત મહત્વ પૂર્ણ છે. સમાજ આર્યવર્તના સાંસ્કૃતિક ગૌરવને ઉજવાલ કરતા અનેક સાધનો સિન્ધુ દેશાન્તર્ગત “મોહેન જોયડોશો”નાં ખડેરામાં વિદ્યમાન છે, અહીંનું પુરાતત્વ સાધન સંસારમાં વિખ્યાત છે. સર્વ કલાચોરણ સમબન્ધયાત્મક પ્રાચીન કેન્દ્ર પણ છે. ભારતના નામકરણ હિન્દુસ્તાન સાથે પણ એજ દેશની નહીનો ઈતિહાસ સંકળાયેલો છે. જે કે લાં જૈન ધર્મનો સમબન્ધ સાંધનરા અવશેષો પણ મળ્યાં છે. પરંતુ મહાકાળચક્રના પ્રભાવથી કુમશઃ જેન ધર્મ ત્યાંથી ક્ષીણ થતો ગયો, અને ચરિત્રનાયક શ્રીજિનકુશાલસૂરિજી મહારાજના સમયમાં જે કે કૈનોનું થોડું ઘણું પણ આધિપત્ય અવશ્ય હતું. છતાંએ અપેક્ષાકૃત ત્યાં મિથ્યાત્વનો પ્રચાર વિશેષ પરિમાણમાં હતો, જ્યાં અજ્ઞાનનું સાંનાન્ય વ્યાપ હોય ત્યાં અંધારું સ્વાલાવિક રીતે હોય, એ સર્વ માન્ય સત્ય છે, ત્યાંની જનતાના વ્યાપક અજ્ઞાનનો ઉન્મૂલન કરવા સાથે વીતરાગ પરમાત્મા દ્વારા પ્રરૂપિત સન્માર્ગ પ્રવર્તનમાં આચાર્યશ્રીને અધીને રીતે ચોગ્ય અને સમર્થ જાણી ઉચ્ચનગર તથા હેવરાજપુર (બહુવલપુર સ્ટેટ)ના શ્રી સમપત્તિશી મહાનુસ્તુદ્ધ આવકોએ સિન્ધુ ગ્રાન્ટમાં પદ્ધારવા માટે આચાર્યશ્રીને વિનંતી કરી. સિન્ધુના ભાગ્ય સારાં હુતાં જેથી તેમની વિનંતીનો વગર આનાકાનીએ સ્વીકાર થઈ ગયો, શુરૂમહારાજે પણ જિનશાસનની પ્રભાવના રૂપ લાભ જાણી જાલોરથી વિહાર કર્યો, સમિયાણું એડનગરાદિ મરુસ્થલના પ્રમુખ જેસલમેર મહારૂંડી કે જે બારેમાસ ફુલકાળનું નિવાસ સ્થાન છે. ત્યાં

આંયા, ત્યાંના સંદે સારું સન્માન કર્યું, અને સૂરજિલાએ સ્વહુસ્તે પ્રતિષ્ઠિત થયેલાં પ્રલાવ પૂર્ણ પાર્વનાથ લગ્નવાનની પ્રતિમાનાં દર્શન વંદન કર્યાં. સમય થાડો હોવા છતાં પણ સંધની અત્યાગ્રહ પૂર્ણ ના વિનંતિને માન આપી સૂરજિ
 ૧૫ હિસે ત્યાં રહ્યા. આપના વિરાજવાથી અનેકો ધર્મ કાર્યો થયાં એટલે ધર્મ પ્રલાવના સારી થઈ. અતે પ્રાસંગિક રૂપે એક વસ્તુ અમારે ખાસ નોંધવી જોઈએ અને તે એ કે એ વખતે જે સલમેર ભરતરગચ્છની પરંપરાનું પ્રધાન કેન્દ્ર ગણ્યવામાં આવતું હતું. અને વર્તમાનમાં પણ આંશિક રીતે છે. અહીંના પ્રાચીન જ્ઞાન ભાંડારેમાંના ધણ્યાચેની સંસ્થાપના ભરતરગચ્છના આચાર્યોએ કરી અને મુનિઓએ સ્વશ્રમ વડે પોતાના ધણ્યા લખેલા અન્યો આભ્યા, લખ્યા અને લખાવી જ્ઞાન શ્રીની અભિવૃદ્ધિ કરી. આજે વિશ્વમાં પ્રાચીન તાડપત્ર અને કાગળો પરના અન્યોની સંખ્યા અધિક પ્રમાણુમાં જે મળે છે તે અત્યેનીજ છે, ભારતીય સાહિત્યની તમામ શાખાઓના સાહિત્યિક અન્યો આ ભાંડારેજ સાચવી રાખ્યા છે, એ કહેતું વધુ પડતું નથીજ.

ઉચ્ચનગર અને હેવરાજપુરના શ્રાવકોએ જે સલમેરમાં સૂરજિ મહારાજ પાસે પુનઃ શીશ્ર પદ્ધારવા વિજાપુર કરી, ત્યારે તે સંધના અનુરોધને લઈથી ભમઝતુ (ભરઉન્હાળા)ના હિવસો હોવા છતાં પણ રેળીસ્તાન ઓળંગી ઈર્યાસમિતિ આદિતું યથાવતુ પાલન કરતા કરતા ઉષ્ણસુતાદિ ઘોર પરીષહેલા વેઠી રેતાળ મહાસમુક્રને પતાનના રાજમાર્ગની માર્ગક સહેલાઇથી પાર કર્યો અને હેવરાજપુર આભ્યા, ત્યાં પોતાના હુાથે પ્રતિષ્ઠિત કરેલ ઋષભ-

હેવ અલુની પ્રતિમાનાં વિધિવતુ દર્શન વંદન કર્યાં. અહીંના આવકો ઘણું દ્વિવસથી સૂરિલુ મહારાજના આગમનની પ્રતીક્ષા ઉરતા હતા. અત્યારે પોતાનાં મનોરથ પૂર્વ થયાં જાણી આન-હોત્સવ મનાવવા લાગ્યા. અહીં આચાર્યહેવ માસકલ્ય કરી સદ્ગર્ભનો વિજય વાવટો ઝરકાવી મિથ્યાત્વનો અધિકાંશ નાશ કર્યો. આત્મોનાનિના પ્રશસ્ત માર્ગમાં સહાયક એવા ઉપદેશા-મૃતતું પાન કરવા અહીનો આવક સમુદ્દર હુમેશાં તત્પર રહેતો.

ત્યાર બાદ સૂરિલુ મહારાજ ઉચ્ચનગર આવ્યા, આપના શુભાગમનથી બધાએ નાગરીક જનોને અતિ પ્રસન્નતા થઈ. હિન્દુ સુખલમાનો બધાએ તેમના સ્વાગતમાં સારો ભાગ લીધો હતો, બારેય જાતના વાળું તો ખૂબ વાગી રહ્યા હતા. એટલે એમનો આ નગર પ્રવેશોત્સવ આરે દર્શનીય હતો. પૂર્વકાલમાં જયારે એટે હિન્દુ શાસન હતું ત્યારે શ્રીજિનપતિસૂરિલુ મહારાજના પુનિત પાદપદોથી આ નગર પવિત્ર થયું હતું, તેજ આ નગરમાં ચતુર્વિંશતિપદ્માંડાર શ્રીકૃપભહેવ સ્વા-મીની લંઘ પ્રતિમાનાં દર્શન શ્રીજિનકુશલસૂરિલુએ કર્યાં. અહીંના આવકોનાં હૃદ્ય આચાર્યશ્રી પ્રતે સ્વાભાવિક રીતે ઝેના હતાં જેથી આપની અમૃત શાંખિની વાણીના પ્રવાહુને સત્ત્વર જીલી લીધી, તદ્દનુસાર અનેકો મિથ્યાત્વ પ્રવૃત્તિઓ નાખૂં થઈ ગઈ, એટલે ત્યાં શ્રાદ્ધજનોએ અશુદ્ધ કુલાચારાદી અનેકો પ્રકારના મિથ્યાત્વનો બાહુદ્યતાએ પરિત્યાગ કર્યો.

વિ. સં. ૧૩૮૪ ના માહા સુહિ ૫ ને દ્વિવસે શેડ જોપા-લના પુત્ર નરપાલ, શાહ વયરસિંહ નન્દન મોખદેવ, લાઘુલ-આંણા, કરુચા, કુરિપાલ, વીકિલ, ચાહુડ અને ચાહુડ આહિ ઉચ્ચ-

નગરના અનેક ધનિક શ્રાવકો તેમજ હેવરાજપુર, ક્યાસપુર, અહિરામપુર, મલિકપુર પ્રલૂટિ અનેક સ્થાનોના રાજવર્ગી તથા નાગરિક તમામ ગૃહસ્થોના પ્રખળ અનુરોધથી અનેક લખિદ્દાં પરમ પ્રભાવક આર્યાં મહોદ્દેહે પ્રતિષ્ઠા નૃતબ્રહ્મણ માલારેપણાં પૂર્વ સૂચિત નન્દીમહોત્સવો વિસ્તારથી કર્યાં.

ઉપર્યુક્ત કાર્યક્રમમાં રાણુકકોટ તથા ક્યાસપુરીય વિધિ ચૈત્યના મૂળનાયક ચોચ્ચ યુગાદિ જિનના એ બિભ્ય તથા અનેકો પાણાણ તથા ૧પિત્તલમય પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ, તેમજ લાવમૂર્તિ, ઉદ્યમૂર્તિ, વિજયમૂર્તિ છેમમૂર્તિ, લદ્રમૂર્તિ, હર્ષમૂર્તિ મેઘમૂર્તિ, પદ્મમૂર્તિ વિગેરે ૮ મુનિઓ અને કુલધર્માં, વિનિયધર્માં, તથા શીલધર્માં, નામક ત્રણ આર્યાઓની લાગવતી દીક્ષાઓ થઈ. એજ શુલ પ્રસંગે ૭૭ શ્રાવિકાઓ માળા બ્રહ્મણ કરી પોતાને કૃતકૃત્ય માનવા લાગી. વિપુલ શ્રાવકસમુદ્દરે પણ પરિયહુ પરિમાણાદિ વ્રતો બ્રહ્મણ કર્યાં.

સિંધુ જેવા અનાર્યપ્રાય દેશમાં પણ સૂરિણુના આગમન અને ઉચ્ચય શ્રેષ્ઠીની ઔપદેશિક શૈલીને એવો સચોટ પ્રભાવ પડ્યો કે ત્યાં એક સર્વથા નૂતન પ્રકારનું અધ્યાત્મિક વાયુ મંડળ તૈયાર થઈ ગયું, કહેવાનું તાત્પર્ય કે મર્દભૂમિને પણ એમની વાણીએ લીલી છમ અનાવી દીધી.

૧ આ મૂર્તિઓમાંની એક ધાતુપતિમા બિકાનેરના ચિન્તામણી અંદરના ગર્ભગૃહમાં સુરક્ષિત છે. જેના પર આ પ્રમાણે લેખ છે.

સર્વત ? ૩૮૪ માઘસુદિ ૫ શ્રીજિનકુશલસૂરિમિઃ શ્રીઆદિ-નાથવિંબ પ્રતિષ્ઠિતં કારિતં ચ સા૦ સોમજ પુત્ર સા૦ લાલણ શ્રાવકેન ભાતૃહરિપાઢ્યુતેન ।

સંવત् ૧૩૮૫માં ઉત્ત્યપુર, અહિરામપુર, ક્યાસપુર આદ્દિઃ
અનેક સ્થાનોના ખરતરગચ્છ વિધિસમુદ્દાયની વિધમાનતામાં
ક્ષાગણુ સુહિ રના રેણુ શ્રીજિનકુશાલસૂરજ મહારાજાએ
ઉપર ઉલ્લિખિત નવહીક્ષિત ક્ષુલ્લક અને ક્ષુલ્લકાએને
વડી દીક્ષા આપી તથા કમલાકર ગણિને 'વાચનાચાર્ય' પદથી
નવજન્યા, ૨૦ શ્રાવિકાએને માળા અહુણુ કરી તથા અનેકો
શ્રાવક શ્રાવિકાએને વિવિધ પ્રતો લીધા.

વ. સ. ૧૩૮૬માં અહિરામપુરના ખરતરગચ્છીય વિધિ-
સંધના વિશેષ આભ્રહુથી સૂરજિ મહારાજ પોતાની સુયોગ્ય
શિષ્યમંડળી સાથે વિહાર કરી અહિરામપુર આંદ્યા, શાંત
મામા, હેદા, ધીર, ઇપાહિ સ્થાનીય ગૃહસ્થેએ ચુગપુરૂષનો
લાંબ્ય પ્રવેશોત્સવ કરી શાસનની સેવા કરી.

સૂરજિ મહારાજે અહિં ભગવાન પાર્વતાથ સ્વામીના
જિનાતયમાં પ્રભુપ્રતિમાના દર્શનવંદન કર્યાં, જ્યારે ગૃહમહારાજ
કોઈ પણ મોટા નગરની આનુભાળુ વિહાર કરતા ત્યારે
તજ્જિકટવર્તી આમવાસી શ્રાવકોનાં ટોળે ટોળાં દર્શન માટે
આવતાં, તહેનુસાર અહિં અનેક લાલુક જેનો ગૃહહેવના દર્શનાર્થ
આવેલાં, તેઓની લક્ષિત સ્થાનીય વિધિસંધ તથા કંબલા
આહિ ઈતર ગંધેણા ગૃહસ્થો પણ સારી રીતે કરતાં.

ક્યાસપુરીય ખરતર સંધના ખળવતર આભ્રહુથી જ્યારે
સૂરજિ મહારાજ તે તરફ આવતા હતા ત્યારે રસ્તામાં શિલાર-
ાખુણુ નામના ગામમાં ત્યાંના ગૃહસ્થો મુસલમાન શાસકને
સાથમાં લઈ આચાર્યમહારાજની સામે આંદ્યા અને વિવિધ વા-
જુ ત્રોણીધ્વનિ સાથે અહિરામપુરની માઝકજ પુરપ્રવેશનું સ્વાગતે

કર્યું, ત્યાં છ દિવસની સ્થિરતા કરી, તે દરમ્યાન છેચે દિવસ સ્વધર્મિવાત્સલ્ય, અવારિતિ દાનશાળા એવં સંઘપૂજાહિ નાના પ્રકારના પુષ્ટય કાર્યો નિરંતર થતાં રહ્યાં. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી કયાસપુર આવતાં રસ્તામાં ખોજવાહુન નામના ગામમાં પદ્માર્થી, ત્યાંના શ્રાવકોએ પણ બહુ સમારોહથી પ્રવેશોત્સવ ફરાંયો, ત્યાં માત્ર એકાહ દિવસની સ્થિરતા દરમ્યાન એણ આમ જનતા ઉપર સૂરીજ મહારાજના ઉપદેશને પ્રકાવ સારામાં સારે પડ્યો, એટલે જન સમાજમાં ધર્મલાવનાની જગૃતિ સારી થઈ.

ત્યાંથી વિહાર કરી કમણઃ કયાસપુર આવ્યા, સ્થાનીય શેડ ભેઠણું, અભિમલિંધ, નાશુ, જટ આહિ શ્રાવક સમુહએ પોતાના સ્વામી મુસલમાન નવાય તથા શાંત ચાચિગ આહિ ઉપકેશગચ્છીય ગૃહસ્થોને સાથે લઈને સૂરિજ મહારાજનો એવો ભન્યતમ પ્રવેશોત્સવ કર્યો, કે જેવો અંતિમ હિન્હુ સંગ્રહ શ્રીમાન પૃથ્વીરાજ ચૌહણે વિ. જં. ૧૨૩૮માં શ્રીજિનપતિ-સૂરિજ મહારાજનો દિવલીમાં કર્યો હતો. સૂરિજ મહારાજને સ્બહુસ્તે પ્રતિષ્ઠિત શ્રીકૃપાલદેવ લગવાનના અપૂર્વ ભાવે દર્શાન કર્યોં.

આ પ્રવેશોત્સવના સમારોહ નગરજનો ઉપર બહુ ઉંડી છાપ પાડી, તે લોકો સૂરિજ મહારાજના ચારિત્રયાલન એવં વિદ્ધતા આહિ ગુણોની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા, કંવલા આહિ અન્ય ગંધોના તેમજ વિપક્ષલાવ રાખનારાઓ પણ સૂરિજ મહારાજના ઉચ્ચતમ ચારિત્ર એવં અત્યુત્તમ જ્ઞાન ધ્યાનથી પ્રકાવાન્વિત થઈને આપશ્રીના પરમ લક્ષ્ય બની ગયા, કેમ ન હોય ? જ્યાં દેશના અધિપતિને આદર પૂર્વક માનતા હોય તેને ત્યાંની પ્રજા પણ અતીવ સર્વમાનપૂર્ણ દૃષ્ટિથી જુઓ

એ સર્વથા સ્વાભાવિક છે. “યथા રજા તથા પ્રજા” ની ઉકિત
અતે તો પોતાનું મૂર્તિપણ ધારણું કરી રહી હતી. એ સમયમાં
આજના જેવી ગવણોના નામે સાડમારી નહોંતી. માત્ર શુણોણી
પુણ કરવામાંજ મનુષ્યો પોતાનું કર્તાંય માનતા હતા.

કૌતુકવશ કેટલાક તુરણો પણ શુદ્ધમદારાજ પાસે આવવા
લાગ્યા, તેઓ પણ આપની નિષ્પક્ષપાતપ્રશ્ન વાક્ષૈલી અને
બહુશુદ્ધતા જેઠને ચમત્કૃત થઈ ગયા, આવકો પોતાના
શાસનની વિશેષ પ્રલાવનાનું તરવ સમજું નવાં નવાં મિષ્ટાનો
ચુક્તા સ્વધાર્મિકવાતસલ્ય કરવા લાગ્યા અને આમાયિકાહિ ધર્મ-
ક્ષયાન તથા તપશ્ચયાનો પણ સારો. ઠાક જામ્યો. ચોમાસું સંજીકટ
આવવાથી સૂરજિલ મહારાજ લાંથી વિહાર કરી પુનઃ દેવરા-
જપુર આવ્યા. બહુ સારા સ્વાગત સાથે શ્રીયુગાહિ દેવનાં દર્શન
કર્યાં. સાંચ ૧૩૮૫નું ચોમાસું અહીંજ યાપન કર્યું.

સંપત ૧૩૮૭માં શોઠ નરપાલ, આંખા, લાખણુ, વીકલ
વિગેર ઉચ્ચનગરના શ્રાવક વૃંદની વિશેષ આચહુલરી અભ્ય-
ર્થનાથી ખાર ઠાણાં સહિત ત્યાં પદ્ધાર્યાં અને એક માસ પર્યાતં
નિવાસ કર્યો, પરશુરારકોટ નામક આમ નિવાસી શાંત હરિપાલ
રૂપા, આસા, સામલ ઈત્યાહિ શ્રાવક સંઘના અત્યાચહુવશ
ઉચ્ચનગરથી બહેણા શ્રાવક સમુહાય સાથે વિહાર કર્યો.
માગેંમાં આવતાં અનેકો ગામેના જૈનોની વંદના સ્વીકારતાં
કુમશઃ પરશુરારકોટમાં લભ્યતમ સમારોહ પૂર્વક પ્રવેશ
કર્યો, વિવિધ ધાર્મિક કૃત્યો થયાં. અતેથી વિહાર કરી બડિ-
રામપુર પદ્ધારી લગવાન શ્રીપાર્વનાથ પ્રભુનાં દર્શન કર્યાં
અને પૂર્વવત્ત મહુતી શાસન પ્રલાવના કરી, ત્યાં થોડા ત્વિસ

નિવાસ કરી ક્યાસપુર આહિ સિંધના અનેકો ગામોમાં એક અને નગરોમાં પાંચ હિવસ, આ પ્રમાણે ઉત્તીજિત્ત વિહાર કરતાં કરતાં હેવરાજપુર પદ્ધાર્યા અને ૧૩૮૭નું ચોમાસું ત્યાં કર્યું.

સંવત ૧૩૮૮માં ઉચ્ચ્યપુર, ક્યાસપુર, શિલારવાહુણ, વગેરે સિન્ધુદેશસ્થ લિન્નબિન્ન ગામ—નગરોના વિધિસમુદ્દાયનું સમ્મેલન થવાથી અનેક હિવસો સુધી નાના અકારના ધાર્મિક ઉત્સવો થયા, મિતિ માગશર સુહિ ૧૦ને દિને પહુસ્થાપના, પ્રત અહુણ, માળારોપણ આહિ નિમિત્તે વિરાટ નનીમહેઠસવ થયો, આ શુભ અવસર પર વિદ્ધત શિરોમણિ શ્રીતર્ફણું/કીર્તિં ગણિને આચાર્ય પદ સમર્પિત કરી તર્ફણપ્રભાચાર્ય તરીકે જૈન સંઘમાં પ્રસિદ્ધ કર્યાં પં. રલભિધનિધાન ગણિને.

૧ સંવત ૧૩૯૮ શ્રાવણ વહિ ૧ને દિને ભીમપલ્લીમાં શ્રીજિનયંડું સ્થરિણુંએ એમને દીક્ષા આપી. શ્રીજિનયંડુંસુરિણું રચિત “ચૈત્યવદન-કુલક વૃત્તિ” ના આપ સંશોધક હતા. સં. ૧૪૧૨માં દીપાવલીને હિવસે પાઠણમાં મહતીયાણ ઠ. બલિરાજની અભ્યર્થનાથી “ધડાવસ્પદ બાલાવાણોધ” રચ્યો. જે સૂતો પર પ્રામ થતા દેશીભાષામય બાલાવાણોધમાં સર્વ પ્રાચીન અને પ્રથમ છે. ગંગાભાષાની દૃષ્ટિએ પણ આતું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ અંથના યોડી કથાએ “પ્રાચીન ગુર્જર ગદ્ય સન્દર્ભ”માં ઉપાયેલી છે. વિ. સં ૧૪૧૨ની પ્રાચીન હસ્ત લિખિત પ્રતિ બીડાનેરના શાનલાંડારમાં વિદ્યામાન છે, એમના વિદ્યાગુર રાજેન્દ્રયંદ્રાચાર્ય અને યશઃકીર્તિ ગણિ હતા, શ્રીજિનયંડસુરિણું, શ્રીજિન લભિસુરિણું નથી શ્રીજિનયંડસુરિણું આચાર્યને એમણેજ આચાર્ય પદ આપ્યાં હતાં. આપની ડેટલીએ સ્તોત્રાહિ કૃતિઓ જેણ છે.

૨ આ મુનિણુંએ પણ અરિત્રિનાથક શ્રીજિનયંડુંસુરિણું રચિત “ચૈત્યવદન કુલક વૃત્તિ” નું સંશોધન કર્યું હતું.

જીમાંયાય પદ, જયપિય અને પુષ્ટયપિય સુનિ તેમજ જયક્રી; કથા મર્મશ્રી સાધ્વીઓને હીક્ષા આપ્તવામાં આવી. ૧૨ શ્રાવિકા એણે માળા અહુણ ફરી અનેક્ષેચે વિવિધ ક્રતો. લીધા, ચિન્હા દેશમાં આ મહેત્તસવ અભૂતપૂર્વ હતો. મતવથ કે તે દેશમાં સૂરજિભૂતાજના વિહારથી જૈનશાસનની વિશેષ પ્રવર્દ્ધના થઈ.

પ્રકરણ છિટ્ટુ



સ્વર્ગવાસ અને ત્યાસ ખાદની
પરિસ્થિતિ

ચાર્યશિરોમણિ શુદ્ધદેવશ્રી જિનકુશાલ
સૂરજ મહાહાનાને વિ. સં. ૧૩૮૮
નું ચાતુર્માસ દેવરાજપુરમાં યાપના
ક્ર્યા. ત્યાં પ્રાચીન ગુજરાતી ગંધ લાષાના આદ્ય અન્થકાર શ્રી
તરણુપ્રલાચાર્ય અને લખિનિધાન ઉપાધ્યાયને સ્યાદ્વાદ-
રત્નાકર તથા મહુતાકરતનાકર જેવા જટિલ અન્થોનું પરિસ્થીતિના
કરોણું. જૈન દાર્શનિક શૈલીના અન્યન્ય ઉચ્ચતમ સિદ્ધાન્તોનું
રહસ્યાત્મક જ્ઞાન ઉપર્યુક્ત અન્થોના સૂક્ષમાતિસૂક્ષમ અસ્યાસ
પર અવલાભિત છે. અન્યાન્ય હુસ્તલિભિત અન્થોની પુણિકાઓ
પરથી ફળિત થાય છે કે આચાર્યશ્રીએ અહીં પોતાનું આસુષ્ય
અદ્ય જાણી સાહિત્યસેવાની સાખ્ત્યા આદરી હતી.

વિ. સ. ૧૩૮૮ ખાદના સુદિ છ ના. દ્વિસે સૂરજિના
ઉપરથી સુશ્રાવક કુમારપાલે કદમ્બસૂતરસ્થાની પ્રતિતું દેખાના

અર્થ સમાજિત કર્યું, જેની અશાસ્ત્ર કે સલભેરીય જ્ઞાન અંડાસ્ક્રોની
પ્રાકશિત સૂચિપત્રમાં આપવામાં આવી છે. સલબ છુ કુ આ
વખતે બીજાં પણ જૈન સાહિત્યના અન્યો લખાયાં હેઠળ અને સેં
કાળચકના લોગે નષ્ટ પણ થઈ ગયાં હેઠળ તો નવાએ વેબુ નથી:

ચાતુર્માસ સમાસ થયા પણી સૂરજિલુ મહારાજ પેતાનું
સુનનબાળથી સ્વર્ગવાસના સમયની અત્યન્ત નિકટતાનો અનુભૂ
લખ કરી ત્યાંજ રહ્યા, માદ્ય સુહિ ૧૩ ને હિને આપશીને
ચીત્ર કલવર અને ચાસાહિની મહાનું પ્રાણધાતક વ્યાધિ
ઉત્પન્ન થઈ. તે સમયે સ્વાવસ્ત્રન સમય સમીપ જાણી તરેણું
પ્રલાયાર્થ અને ઉપાધ્યાય લખિનિધાનને પણે એલાકીં
શ્રીમુખે ઇરમાંયું કે “મારા પાટની શોલા તથા અકિરુદ્ધિ
અન્યવામાં સર્વ રીતે ચોણ્ય શાંત લક્ષ્મીધરના પુત્ર આંખાની
ધર્મપત્રનિ ઝીકીના ઉચ્ચ ગુણુસમ્પન્ન પુત્ર ૧૫ વર્ષની લધુ
બયસ્ક મારા પ્રિયશિષ્ય પદ્મમૂર્તિનેજ ગચ્છનાયકત્વનું મહત્વ
અને ઉત્તરરાધિત્વ પૂર્ણ પદ સમર્પિત કરનો” બીજુ પણ
ગચ્છની આંતરિક વ્યવસ્થા વિષયક અનેક પ્રકારની ઉચ્ચ
શિક્ષાએ દઈ મિતિ કૃગણું વહિ × ૫ ના દિવસે પાછલા મહુરમાં

અપાછળની પદ્માવલિઓમાં સૂરજિલુ મહારાજની સ્વર્ગનિથિ દ્વાગણ વહિ
અમાસ લખી છે. એજ દિવસે એમની તિથિ આખાયે ભારતમાં આદ્ય
પૂર્વક ઉજવવામાં પણ આવે છે, પરંતુ પ્રાચીન અને પ્રામાણિક તથા
સમકાળીન સમયે રચિત ‘બૃહ્દુ ગુંવર્વિલી’માં “સંવત્ ૩૮૯ ફાલગુન-
કૃષ્ણપંચમ્યાં પાશ્ચાત્યપ્રહરે” આવે ૨૫૦ટોલેખ છે, તેમજ
જ્યસાગર મહેંદ્ર શિષ્ય સોમકુંજર શિષ્ય દેવરતન મહિમરતનાહિ લિખિત
૧૫ મી સહીની પદ્માવલીમાં પણ “સ ૩૮૯ ફાલગુન વહિ ૮તિથી

અતુવિધ સંઘની સમક્ષ મિથ્યાદૃષ્ટત આપી સ્વયમેવ અનશન અહણું પૂર્વક મહામાંગલ્યકારી પંચ પરમેણિના દ્યાનમાં તલ્લીન શહી એ પ્રહુર રાત્રિ વ્યતીત થયે આ ક્ષણું ગુર લૌટિક શરીરનો ત્યાગ કરી સ્વર્ગનો મહામાર્ગ સ્વીકાર કરી લીધો.

‘ઓદેવરાજપુરે સ્તુપનિવેશः’ લખ્યું છે. અમારા મંતવ્ય પ્રમાણે આ તિથિ હીડ છે. સંભવ છે કે લેખકની ભૂલને કારણે પ મને બદલે અમાસ લખાઈ જવાથી આ આનિત ફેલાઈ હોય? સમયસુનદરળ તથા તેથી પ્રાચીન પદ્માવલિએ પણ પાંચમનુજ એક સ્વરથી સમર્થન કરે છે. એમાં તો આઠ દ્વિવસના અનશનનો પણ ઉદ્દેશ છે. અતઃ આઠ દ્વિવસનું અનશન માધ શુદ્ધ ૧૩ સે આરંભ્યું હોય તો દ્વાગણ્ય વહિ પાંચમનાજ, નહિં કે તેનાથી આગળ, સમાપ્ત થાય છે. (મુળાલેખક)

(આ રથને અમારે નોંધવું જોઈએ કે બૃહદ્યુર્વાવલી તથા દેવશુનાદિ લિખિત ૧૬મી સહીની પદ્માવલી આદિના હૃપરોક્તત લખાણ મુશ્ય પાંચમનેજ હીડ માનતાં વાંદો એ આવે છે કે આવા મહાન શાસત્ર પ્રભાવક આચાર્ય મહારાજની સ્વર્ગતિથિ તપશ્ચર્યાદિ દ્વારા ઉજવવાની પ્રવૃત્તિ કાર્ય સાવ આધુનિક તો નજ હોય, અસલથીજ ચાલુ ચંદેલ હોવી જોઈએ. જે આ વાત બરાબર હોય તો પછી તે સમર્થથી તો સર્વત્ર પાંચમની પ્રવૃત્તિ પ્રવૃત્ત ચંદેલ હોવીજ જોઈએ, તેને સમૂહ પદ્માવીને સાવ નિર્મલ અમાવસ્યાની પ્રવૃત્તિ થઈ જવામાં કારણ શું માનવું? તે વાત મગજમાં બેસતી નથી. કોઈ એકાદ વ્યક્તિના ભૂલ લર્યી લખાણ માનના આપારે અસલથી ચાલતી આવેલ સર્વનિકિ પ્રવૃત્તિનું સાવ નિર્મલન થઈ જવું કોઈ પણ રીતે ઝડપ લાગતું નથી.

લેખકની ભૂલ થવાનું કારણ માનીએ તો પણ નિયારવાનું કે-પ્રાચીન જિપીમાં ‘સ્ય’ અને ‘સ્ય’નો લેદ સાવ નહીં જેવોજ હોય છે. એથી ‘સ્ય’ના બદલે ‘સ્ય’ વંચાઈ જવું કર્દી ફળ નથી. એટસે બૃહદ-

પ્રાતઃકલ થતાંની સાથેજ વિશુદ્ધવેગે ઉપર્યુક્ત શોક
સમાચાર આરે દિશાઓમાં હૈલાઈ ગયાં. આખુંએ નગર અહેમછા-
રાજના સ્વર્ગવાસથી શોકના સાગરમાં રૂપી ગયું. ગુરુપ્રત્યે સર્વા-
ધિકલકિત પરાયણુતા રાખનારાઓનાં ચ્યક્ષુઓમાંથી અશ્રુઓની
ધારાએ વહેવા લાગી ગઈ. જેણે કે હૃદયજ પીંગળી ને આંખો
દ્વારા વહી રહ્યું હોય ? તેવું શોકમય વાતાવરણ કરુણાતું મૂર્ત
રૂપ ખડું કરી દેતું હતું. પોતાના પરમ ઉપકારી અને
આત્મીય ન હોવા છતાં પણ આત્મીય રનેહ સમબન્ધ સૂત્રથી
જે સાથે બંધાયેલ હોય તેમના મનમાં કેટલો લીખણું વળા-
ધાત થતો હુશે એ વાત કદ્વાનામાં આવે એવી નથી. અનુ-
ભવનોજ વિષય છે. વર્ષો સુધી જેણે પોતાના શરીરનો
જરા પણ મોહુ કર્યા વિના અનેક કંઈ અને યાતનાઓનો

ગુર્વાનલીમાં દેખકની ભૂલના અગે “પંચદસ્યા” લખતાં ‘સ્યા’થી
પહેલાનો ‘દ’ છૂટી જઈને ‘પંચસ્યા’ લખાઈ ગયું હોય અને પાછળ
વાલાએએ તેને ‘પંચમ્યા’ સમજુને પાંચમ લખી દીધી હેઠ તો તે કાંઈ
નહીં બનવા જેવું નથી. પરંતુ સખલ કારણું નિના પંચમીની ચાલુ પ્રથા છૂટી
ને અમાવસ્યાની પ્રથા ચાલુ થઈ જવી કોઈ પણ રીતે કંઈ પણ લાગતી નથી.

શ્રીમાન સમયસુંદરજ વિગેર એ ८ દિવસનું અણુસણ કરવાનું કે
બૃહદ્યુર્નવલીમાં પણ ગણુ વિષયક શિક્ષા આપવા વિગેરનું માધ્યમ શું
૧૩ સેઝ લખ્યું હોય તો તો માનવાને કારણું છે કે ८ દિવસ હાં
વદ પંચમાએજ પૂર્ણ થતા હોવાથી તે દિવસે સ્વર્ગતિથિ માનવી ઢીક.
પરંતુ તેમતો છે નહીં, ૧૩ના તો બ્યાંધિ ઉત્પન્ન થઈ અને તેના તે
દિવસે અણુસણ કરવું પણ સંભવ ઓછું લાગે છે. તો પણી ચાલતી
સાર્વનિક અમાવસ્યાની પ્રથાને બાંત માનવીને પંચમીને પ્રામાણિક માનવી
ક્ષયાં સુધી ચોગ્ય કરી શકાય ? । ધ્રસવમ् । (સ'પાદક)

બાગ અની કેન શાસનની નોકા જીમારો અલાવે રાખી એવા અહુમહાંગના અધિકારીની કષ્ટું હદ્ય શોક વિહૃળ ન બને ! ! !

શુકુ મહારાજના પવિત્ર હેઠના અંતિમ દર્શન માટે તથા નિર્ણયમહોત્સવમાં ભાગ લઈ પોતાની ભક્તિ ભરી છાદિક શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આસપાસના બધાચે ગામોલા સંદેશ ચાગરના મોખાં જેમ ઉછળી પડ્યાં, ઉપ મંડપિકાચે મંડિતા છેન્દ્રવિમાન તુલ્ય સુંદર નિર્ણાણવિમાન શ્રીસંઘ નિર્માણ કરાયું. એમાં ગુરુહેવના હેઠને સંસ્થાપિત કરી વિરાટ ઉત્સવ પૂર્વક શૈક્ષાકુલ ચિત્તો શ્રીસંઘ સમર્પણ નગરના પ્રધાન પ્રધાન રાજ માર્ગો પર થઈને અણી સંસ્કાર નિમિત્ત શામશાને પહોંચ્યો, લાં અગર, તગર, કસ્તૂરી, મલય ચંદન, કપૂર આદિ સુગાંધિત દ્રવ્યોવદે હેઠની અંતેછિકિયા કરવામાં આવી, તે સમયનું શોકમય વાતાવરણ અવર્ણનીય હતું વજ્ઞહદ્ય પણ પીધળી જતું.

અમિ સંસ્કારના સ્થાન પર રીહુડ ગોત્રના શેડ હરપાલના પુત્ર જાંઝણું યશોધવલ આદિએ સ્વપરિવાર તરફથી સુંદર કલાપૂર્ણ સ્તૂપ નિર્માણ કરાયો. આ સ્તૂપ અત્યન્ત વિશાળ તેમ દર્શનીય અને મુદ્રિતમ પ્રધાન સિન્ધુ દેશમાં જૈન સંસ્કૃતિના શુભ્રતમ ગૌરવસ્વરૂપ હતો, એટલે હુરદ્વારથી યાત્રીગણ યાત્રાર્થ આવી શુરૂવાનનો લાભ મેળવી કૃતાર્થ બનતા. વર્તમાન કાણમાં આ સ્તૂપ-નગર બહુવલપુર રટેટમાં હોવાથી પાકિસ્તાનમાં આવી ગણું છે.

પ્રકારણ સાંસ્કૃતિક.

શ્રીનિતપદમસ્તુરિ પદ સ્થાપના—

ઓદં શિષ્ય પરંપરા



આચાર્ય મહારાજની આજા પ્રમાણે શ્રીતરણ.
પ્રલાચાર્યજીએ વિ. સં. ૧૩૬૦ જેઠ સુદ્ધિ ૬ સોમ-
વારે મિશ્યન લગ્નના શુલ સુહૃત્તમાં પદ સ્થાપના
કરવાનું નિશ્ચિત કર્યું. એટલામાં સિદ્ધું હેઠના
રાણું નગરનિવાસી રીડડ ગોળીય આવક પૂર્ણચન્દ્રના પુત્ર
હુરિપાલ હેરાઉર આવ્યા. તેમણે તરણુપ્રલસ્તુરિ પાસે આવી
પદસ્થાપન મહોત્સવ પોતેજ કરવાની મહાન ઉત્કંઠા બતાવી
તેઓશ્રી પાસેથી આજા પ્રાસ કરીને સમસ્ત ડેકાણે કુંકુમ-
પત્રિકાએ પાઠની દીધી. અનુક્રમે દૂરદૂરના અનેકો દેશોથી આવત્તે
ખર્ચ સ્થાનેના શ્રીસંઘો એકત્ર થયા. શેડ હુરિપાલે સ્વધર્મી
અંધુએનું અતિ પ્રશંસનીય સત્કાર-સમ્માન કર્યું, સ્થાનીય
શ્રીઆહિનાય લગ્નાના મંદિરને ધ્વજ પતાકાએ વિગેરદ્વારી
ખૂબ સન્નનવામાં આવ્યું. ધાર્યાએના હદ્દો હર્ષાવેશથી આદહા-
દ્વિત થઈ રહ્યાં હતાં, પૂર્વકૃત નિશ્ચય પ્રમાણે શુલ સુહૃત્તમાં
સરસ્વતીકંઠાસરણ શ્રીતરણપ્રલાચાર્યજીએ મહોપાચાય જ્યથેર્મ
અને લાણધનિધાન ગણ્ય આહિ ઉંઠ સાંધુ તથા બહુ સંખ્યક
આર્યાએ ભળી ચતુર્વિધ શ્રીસંધની સમક્ષ અગણ્ય માનવન-

મેહની તથા લાંના તુવાળના પુત્રની સમૃપસ્થિતિમાં શ્રીપદ્મૂર્તિસુનિને શ્રીજિનકુશળસૂરિજીના પાટ પર સંસ્થાપિત કરી નવીન ગણુનાયકનું નામ શ્રીજિનપદ્મસૂર રાજ્યાં.

આ સૂરિપદોત્સવમાં અમારિવૈષણુ, યાચકેને મનો-
લિલાપિત દ્વાન તથા એક માસ પર્યાંત નિય સ્વધમી વાત્સલ્ય
આદિ નાનાવિધ સુકૃત્યો થયાં. આચાર્ય શ્રીજિનપદ્મસૂરજી
એ જ્યાંદ્ર, શુભચંદ્ર, સાધુચંદ્ર, આ ત્રણુ સાધુઓ. તેમજ
મહાશ્રી. કંકાશ્રી નામક સાધીઓને દીક્ષા દીધી, અને પંડિત
અમૃતચંદ્ર ગણિને વાચનાચાર્ય પદ અર્પણ કર્યું. અનેક
શ્રાવક શ્રાવકાચોએ માળાશહણ સમ્યક્તલ, પરિશ્રદ્ધ પરિમાણ
સામાયિકાદિ પ્રતો ઉચ્ચારણ કર્યાં.

રીહુડ હુરિપાલે આ અતિ પૂનીત ઉત્સવ પ્રસંગે ઉદ્ઘાર
હિલથી હુલારેના બ્યયદ્વારા પોતાની ચંચલ સંપત્તિનો સદ્ગ-
પદ્યોગ કરી પરમ પ્રમેદાને પ્રામ કર્યો. શા. આંણા, આંઝા, મંભી,
ધૂરસ્થર, સુહુરણ, નાગહેવ, ગોસલ, કર્મસિંહ, ઐતસિંહ, બ્રાહ્મ-
જ્ઞાહ અનેક લિન્ન લિન્ન રથાનોના લક્ષ્મીનનદન શ્રાવકોએ
ઉદ્ઘાર ચિત્તથી પ્રચુર દ્રોધનો બ્યય કરી યશોપાર્જન, પુણ્યો-
પાર્જન કર્યો, તહનાંતર જન્યેઠ શુદ્ધ દના હિવસે શેઠ હુરિપાલે
કરાવેલ શ્રીયુગાહિ હેવ બિંખ આદિ કેટલાએક જિનબિંખો
તથા હેવરાજપુરના સ્તૂપ અને જેસલમેર, કયાસપુર નિમિત્ત
શ્રીજિનકુશળસૂરિજીની ત્રણ મૂર્તિઓનો ભવ્ય પ્રતિષ્ઠા

* ૧. વિ. સંવત ૧૩૫૪ નેઠ વહિ ૧૦ના રોજ જાંસોરમાં શ્રીજિનચંદ્ર-
સૂરિજીનાં વરદ હરતે આપની દીક્ષા થઈ હતી.

મહોત્સવ થયો, અને એજ હિંદુસે અતિ વિસ્તૃત આડંખર પૂર્વક ચતુર્વિધ શ્રીસંબે સ્વર્ગીય ગુરુહેવ શ્રીજિનકુશાલસૂરિલુ મહારાજની પ્રતિમા સ્તુપમાં પ્રતિષ્ઠાપિત કરી.

ઉપર સ્મૃતિંત તમામ મહાઉત્સવોના પ્રધાન નેતા શેડ હરિપાલનો પરિચય “ સરતરગઢાચાર્ય ગુર્વાવલી ” માં આ પ્રમાણે આપવામાં આંદોલન થયો. છે. રીહુડ કુલદીપક શાંત ધનહેવના પુત્રરત્ન હેમલના પુત્ર પૂર્ણચંદ્રના એઓ પુત્ર હતા. સ્વચ્છાશયવાદા શેડશ્રી જૈન શાસનની પ્રવર્દ્ધના કરવામાં અત્યંત પ્રવીણ હતા, એવણું ગિરનાર અને શત્રુભયની યાત્રા કરવાનું સહભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રીજિનચંદ્રસૂરિલુ (૧૩૭૩માં) અને શ્રીજિનકુશાલસૂરિલુને વિનંતી કરી એમણેસિન્દુપ્રાન્તમાં વિહૃાર કરાંદો હતો. જેથી જૈન ધર્મનું બહુ મહત્વ વધ્યું, ત્યાંના માંસલક્ષ્યઓએ પણ માનવતાનું સાચું મૂલ્ય જાણી અલક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કર્યો. શેડ હરિપાલ ડેવલ ઇપિયા પૈસાને ઠથ્ય કરીને સંતોષ માનનારો. શ્રાવક નહોતો. કિંતુ જૈન ધર્મ અને સંકૃતિના તત્ત્વો એમના જીવનમાં ખૂબ ઉડી રીતે ઉત્તર્યાં હતાં, જૈન સિદ્ધાન્તોને આત્મસાત કર્યાં હતાં. તેથી એમણે પોતાની પ્રિય પુત્રીને પણ સંસાર સાગર નિસ્તારિણી ભાગવતી દીક્ષા અપાવી હતી. ધન્ય છે એવા નરરતનોને !

આચાર્ય મહારાજ શ્રીજિનપદસૂરિલુ મહારાજના આચાર્ય પહોત્સવના અવસર પર જેસલમેરનો સંધ પણ ગુરુભક્તિનો લાભ લેવા આંદોલન હતો. તે સંબે અવસર જેઈને પોતાને નગર પધારવા આગ્રહભરી વિનંતી કરી એટલે ગુરુમહારાજે એ ઉપાર્થ્યાય તથા ૧૨ મુનિ ગણું સહિત ત્યાં જઈ એમાસું કર્યું.

સ્વર્ગ વત્તા ખાહ

શ્રીજિનકુશભસ્તુરિલુ મહુરાજ પોતાની એવિધમાનતામાં પણ કુશળ મંગળ વરતાવી પોતાનાં કુશળ એવા નામને સાર્થક કરવાના યચથી મંડિત થયા હતા, એટલું નહીં પરતુ સ્વર્ગ ગમન ખાહ પણ અદ્યાપિ લક્તોની આકંક્ષાઓ પરિપૂર્ણ કરવાને સહૈવ તત્પર રહે છે. એટલે લક્તાજોનાં વાંछિત પ્રેરણને કદ્યતર સમાન છે. સમય સમય પર વિશેષ પ્રકારે સમરણ કરવાથી શ્રદ્ધાળુંનો પ્રત્યક્ષ દૃપમાં પ્રગટ દર્શન પણ આપે છે અને અપ્રત્યક્ષ ઇંપે પણ કષ્ટ નિવારણ કરે છે. એમના સરબનધમાં ધણા પ્રકારના ચમત્કારીક વૃત્તાંતો સાંભળવામાં આવે છે. જે બધાયેને લિપિબદ્ધ કરી મૂર્તિ ઇમું આપવામાં આવે તો એક મોટા કદ્યતું પુસ્તક થઈ જય માટે અસે. અન્ય વિસ્તારના જયથી કેવલ થોડી ધર્મનાઓ કે જેમનો ઐતિહાસિક ઉદ્દેશ મળી આવે છે, તેઓનેાજ માત્ર સંક્ષિપ્ત નિર્દેશ કરી સંતોષ માનીશું.

૧ વેગડ શાખાની પણાવલિમાં લખ્યું છે કે “જેસલમેર પાશ્વનાથ ભૂલનાયક પ્રતિહા દેહરાની ચાપી. મંગલઉરિ ઉવતાં આલિયો. ચાપ્યો તે આજ લગી પ્રલિંગ છે. એકદા વખાણ કરતાં જાણ્યો શ્રીશત્રુંજયના દેહરા દીવાની વાટ ઉદ્દિરે તાણું ચન્દ્રયો લાગો તિવારે સુંધરપતિ ઉતારી મસલી તિંદાં યાંત્રાં તે યુઝાણું. વલી એકદા રત્નોદીટ વાહણ આવતૌ યૂદ્વા લાગો, તિવારે શુર ઓરામાંહૈ પેસી મંત્રઅસે તિંદાં જાધ પાર ઉતાર્યો, કૃપાએ ભીને બાહિર આયા, શ્રાવકે પૂદ્યથો તિવારે શુરે કૃપડો નીચની સ્વાદ ખાડો ચખાવ્યો” કહ્યો ન માનો તો આજથી સાતૈ હિને શ્રાવક જીવરસ્યે, તિવારે સાત દિને આવ્યા, પ્રત્યે ઉપનો છમ અનેક અવધાત-હે. તિરસ્યાં ને પાણી ખાવે, સમર્યાં સાંદ દે.”

૧ બીજાનેરનાં મંત્રી વર વસ્થાવતકુલાવતાં સીધુત કર્મ-
ચંદ્રળના પૂર્વજ મંત્રી વરસિંહજ હેરાઉરની યાત્રા માટે અતિ
જિકાંડિત હોવા છતાં પણ રાજવિષયવાહિ કોઈ કારણું જઈ
ન શક્યા. ત્યારે એમની મનોકામના પૂર્વી કરવા માટે શુરૂદેવે
બિકાનેરથી ૪ ગાઉ ઉપર ગદાલય (નાલ) નામક સ્થાનમાં સમુખ
આવી સ્વચ્છ દ્વારા દર્શાયાં, અને કહ્યું કે હું તમારી
આંતરિક સક્રિતથી બહુજ સંતુષ્ટ થયો હું, તમારી યાત્રા
અહીંજ સફ્લ છે. મંત્રીશરે શુરુ મહારાજનાં દર્શનની સમૃતિ
સ્થિર કરવા માટે ઉપર્યુક્ત સ્થાન પર શુરુમંહિર નિર્માણ
કરાવ્યું. આજે એટલો કાળ વ્યતીત થઈ ગયો છતાં તે સ્થાને
સુરિલુ મહારાજનો પ્રભાવ સર્વવિહિત છે. સાંસારા પ્રમાણે ત્યાં
એમના ચરણ પણ હેરાઉરથી આવેલાં છે. સોમવાર તથા દરેક
પૂર્વી માટે બીજાનેરના તમામ ગચ્છના સેંકડો નરનારીઓ
દર્શનાર્થ આવી કૃતાર્થ થાય છે, કાર્તિક પૂર્વી મા અને દ્વાગણ
વહ અમાસને દ્વિસે ત્યાં દર વર્ષે મેળેા ભરાય છે.

૨ કુવિર શ્રીસસ્યસુદરળ અધિકારી ન્યારે સિનંધ પ્રાલતમાં
શિવાસયુ કરતા હતા ત્યારે જંધ સહિત ઉચ્ચનગર જતાં આર્ગમાં
ફંચાનદી પાર કરવા વહુણુમાં એઠા હતા. તે કાળે આંધારી
રાત પૂર્ણોરના વરસાદ સહિત એકાએક ભયંકર તોકાન આવી
જવાથી નૌકા ભયમાં આવી પડી, ત્યારે એક માત્ર ઈષ્ટ હાહા-
સાહેભાંજ દ્યાન ધર્યું. ઇણસ્વરૂપ તરતાજ સુરિલુના હેવા-
ત્માએ સહુયતા કરીને સંકટ દૂર કર્યું, કવિ પોતે પોતાના
અષ્ટહોંસાં આ ઘટનાનું લખ્યાન આ પ્રમાણે કરે છે.

આયો આયો રી સમરંતા હાહોળ આયો।

સંકટ હેખ સેવકું સદગુરુ, દેરાઉરતે ધાયો, સ. ॥૧॥

વરસે મેહનૈ રાત અંધારી, વાય પિણુ સખળો વાયો.

પંચ નહી હુમ ઐડે એડી દરિયે, હા હા દરિયે ચિત્તડરાયો, સારા હાહા ઉચ્ચય લણી પહુંચાવણુ આયો, અરતર સંઘ સવાયો।

“સમયસુદર” કહે કુશલ કુશલ ગુરુ, પરમાનન્દ સુખ પાયો, સાડા,

૩ એવીજ રીતે જલવૃષ્ટિન! અલાવમાં એમતું સમરણ-
જ્યારે કયું ત્યારે તત્કાલ વર્ષા થઈ તેનું પણ કવિવરે “માંગયો
મેહનૂડેતુરત” એવાં પદ્ધની રચના કરી સાન્નિધ્ય રવીકાર્યું છે.

૪ કવિવર ધર્મવર્ષનાલુચો પણ સ્વરચિત કુશલ સુરિણા
સ્તવનેમાં બૂડતી નૌકાને એકદમ બચાવી લેવાનું વર્ષન
કેટલીએ વાર કયું છે.

૫ આચાર્ય શ્રીજિન લાડિત સુરિણ નિર્મિત શ્રીજિન-
કુશાસૂરિસ્તવનમાં બીકાનેરનરેશ શ્રીસુલણુસિંહની શત્રુઓના
બધથી રક્ષા કરવામાં આવી જેનો ઉલ્લેખ આ પ્રમાણે છે.

“પરતિખ પરયૌ પામીયૌ, શ્રી બીકાંણુ નરેશ.”

x x x

“સુલણુસિંહ નરરાજને, અરિલય લિયો ઉખાર”

શુદ્ધગુણ રલાવલી ૫ ૬૨

ખીજ પણ ધર્માચે ચયતકારેના ઉલ્લેખો રામલ્ગાવળ ગણું-
કૃત “દાહાસાહેખની પૂજા” તથા સ્તવનો એવાં અન્યાન્ય કવિઓએ
દ્વારા નિર્મિત સ્તોત્ર સ્તુતિ સાચેયા સ્તવનાદિમાં મળી
આવે છે. જે સર્વજનપ્રસિદ્ધ છે.

જ્યાં જ્યાં ગુરુહેવના ચરણુષાહુડા અને પ્રાચીન સ્તૂપ-
સ્થાનો છે ત્યાં ત્યાં લિઙ્ગ લિઙ્ગ સમય પર યાત્રીઓએ તથા
ધ્યાવના કરનારાએને જે જે ચયતકારો થયા તથા કામના
પૂર્ણ થઈ તેના સેંકડો ઉદ્ઘાટણા વિદ્યમાન છે, એટલે સર્વ-
પ્રસિદ્ધ વસ્તુને વ્યક્ત કરવાનું આ સ્થાન નથી.

એમના અલોકિક પ્રભાવનું જ્વલંત ઉદ્ઘાટણ એટલું જ
ખસ છે કે જ્યાં જુઓ ત્યાં સેંકડો સ્તુતિ સ્તોત્રો, અષ્ટક,
નિશાની, પદ, છંદ, સ્તવન અને સેંકડોએ સ્મૃતિ મંહિરો
ચરણો, પ્રતિમાઓ જ્યાં જુઓ ત્યાં મળે છે. આજ હિંસ સુધી
શુગપ્રધાન આચાર્ય શ્રીજિનહતસૂરિલુભ્રારાજ શિવાય કોઈ જીવ
આચાર્યના આટલાં મંહિર અને સ્તવનો મળ્યાં નથી જેટલાં
આપના મળ્યાં છે જેનોના લોછહદ્ય પર આજ સુધી એમનું ડેટલું
પ્રલુંત છે. આચાર્યશ્રીને સ્વગચ્છ પરગચ્છ સ્થાનકવાસી અને
કટૂર તેરાપંથી આહિ અધારે લોકો અક્ષિતલાબ પૂર્વક ભાને છે.
એમતો સમસ્ત લારતમાં જ્યાં જ્યાં જૈન મંહિરો અને તીર્થો
છે ત્યાં ત્યાં એમના ચરણ પાહુડાઓ મળે છે, ધર્મ ડેકાણું
એમની “દાહાવાડીઓ” પણ ગામથી જરા ફૂર અથવા તો
સમીપ સ્વતન્ત્રજ મળી આવે છે. એમ છતાં વાંચકોની વિશિષ્ટ
નાણુકારી માટે થાડાં સ્થાનોની સૂચિ આપવી ઊચિત ગણ્યાશે.

પ્રતિષ્ઠા સમય	સ્થાન	લેખપત્રિ*
સં. ૧૪૮૬ જાન્યે. સુ. ૫ શુક્ર, મૂર્તી આહિનાથમં. માલપુરા હરિં		
સં. ૧૬૨૩ માઘ વદ્દ ૫, પાદુકા. દાદાવાડી. નાગોર		„
સં. ૧૬૫૪ જાન્યે. સુ. ૧૧ રવિ, „, વિમલવસહી શત્રુંજય યુ. પ્ર.નિ.		
સં. ૧૬૫૬ જાન્યે. સુ. ૧૨ શનિ, „, દાદાવાડી સાંગાનેર હરિં		
સં. ૧૬૬૩ વૈ. સુ. ૬ શનિ, „, દાદાવાડી ભમનગર		„
સં. ૧૬૭૫ વૈ. સુ. ૧૫, મૂર્તી અસ્ત્રલવસહી શત્રુંજય. „		
સં. ૧૬૮૨ જાન્યે. સુ. ૩ શુક્ર „ „ „ „		
સં. ૧૬૮૨ મિ. સુ. ૫ પાદુકા દાદાવાડી પટના. ના૦ ૩૩૨		
સં. ૧૬૮૮ વૈ. સુ. ૧૫ „ મંહિર શુણ્યાયાળ ના૦ ૧૭૬		
સં. ૧૭૦૨ મા. સુ. ૧૩ સેચ. „, ગામમંહિર પાવાપુરી ના૦ ૧૯૮		
સં. ૧૭૩૭ જૈ. વ. ૧. „, નાપાસર સં૦		
સં. ૧૮૨૧ મા. સુ. ૧૫, „, દાદાવાડી સુર્ચિદાવાદ ના૦ ૬૪		
સં. ૧૮૩૧ ક્રા. સુ. ૭, „, નેમાય સં૦		
સં. ૧૮૪૮ જાન્યે. વ. ૮ શુક્ર, „, હિનાજપુર ના૦ ૬૩૩		
સં. ૧૮૫૦ વૈ. સુ. ૩ વૃદ્ધ, „, શાંતિમંહિર ચૂર્દ. સં૦		
સં. ૧૮૫૦ મા. સુ. ૫. પાદુકા. દાદાવાડી ચૂર્દ સં૦		
સં. ૧૮૫૦ મિ. વ. ૧ સેચમ „, કર્મભાયાદ હરિં		
સં. ૧૮૫૬ વૈ. સુ. ૩ શુક્ર, „, ચર્ચપાપુરી ના. ૧૬૪		
સં. ૧૮૬૨ મધ્યમ સુ. મ. „, જયપુર હરિં		

* આ સંગ્રહમાં સાડેતો આ પ્રમાણે સમજવાં. હરિ=શ્રીનિનહિનિ=સાગરસ્તુરિનો વ્યાપક સેખસંગ્રહ. ના=શ્રીપુરથ્યાદ્રાળ નાહારનો સેખસંગ્રહ કેદ્યાંછું, સં.=અમાસે સેખસંગ્રહ અને યુ.૦૫૦નિ=અમારં લખેલું. મુગપ્રધાન નિનચાદ્રસ્તુરિ=પુરસ્તક અમાલસું.

પ્રતિષ્ઠા સમય સમારક સ્થાન લેખપ્રાચિ

સં. ૧૮૬૭ અધાર સુ. ૯ પુધ,,	કાસમ અનાર ના. ૮૪
સં. ૧૮૭૧ વૈ. સુ. ૮ પુધ,,	છોટા હાદાળ. દિલ્હી. ના. ૫૨૭
સં. ૧૮૭૫ મિ. સુ. ૬ રવિ,,	મધુવન (શિખરાળ) ના. ૧૮૪૧
સં. ૧૮૭૬ મા. સુ. ૫. ,,,	હસ્તિનાપુર હરિં
સં. ૧૮૭૭ વૈ. સુ. ૫ ચન્દ્ર,,	પટના ના. ૩૨૦
સં. ૧૮૭૭ વૈ. સુ. ૫ ચન્દ્ર,,	,, ના. ૩૨૧
સં. ૧૮૭૭ વૈ. સુ. ૧૫ „,	અચોંધા ના. ૧૬૫૬
સં. ૧૮૭૯ ઝા. સુ. ૪ શાન્તિ,,	દૈલખાદ ના. ૧૬૭૬
સં. ૧૮૮૨ ક્રિ. શા. ૧. ૧૨ શુકૃ,,	(અણ્ણોદ્વાર) નાચોર હરિ
સં. ૧૮૮૮ મા. સુ. ૫ „,	ચંદ્રાવતી ના. ૧૬૮૩
સં. ૧૯૦૪ મા. સુ. ૧૨ „,	હાદાવાડી, લખનગ હરિં
સં. ૧૯૦૮ ચૈ. સુ. ૧૨ રવિ,,	(અણ્ણોદ્વાર) દિલ્હી હરિં
સં. ૧૯૧૦ માઘ સુ. ૨ સોમ,,	હાદાવાડી લખનગ,,
સં. ૧૯૧૦ માઘ સુ. ૨ „,	ગામમંહિર, પાવાપુરી ના. ૧૬૬
સં. ૧૯૧૦ માઘ. સુ. ૨ „,	રત્નપુરી ના. ૬૬૮
સં. ૧૯૧૨ ઝા. વ. ૭ શુકૃ,,	હાદાવાડી, ડેશરિયાળ ના. ૬૪૬
સં. ૧૯૧૩ માઘ. સુ. ૫ શુકૃ,,	જૌહરી બાગ, લખનગ ના. ૧૬૩૭
સં. ૧૯૧૩ „ „ „ „,	શાંતિ મંહિર લખનગ હરિં
સં. ૧૯૧૩ „ „ „ „,	લખનગ હરિં
સં. ૧૯૧૪ જાય. .. ૨ „,	ઝીરાલાલ હેરાસર ના. ૦૧૬૨૨
સં. ૧૯૧૪ જાય. સુ. ૬ ૨ „,	હરિં
સં. ૧૯૧૪ „ „ „ „	„
સં. ૧૯૧૪ „ „ „ „	„

પ્રતિધા અભય	સમારકે	સ્થાન	લેખપ્રાપ્તિ
સ. ૧૬૧૭ મા. કૃ. ૬ શાનિ રત્ના		અમરસાગર ના. ૨૫૪૨	
સ. ૧૬૧૯ વૈ. કૃ. ૨	પાહુકા		હુરિં
સ. ૧૬૨૩ જાન્યે. સુ. ૪ ગુ.			ખાલોતરા સ.
સ. ૧૬૨૪ મા. સુ. ૧૩			લખનાઉ હુરિં
સ. ૧૬૨૮ મા. સુ. ૧૩ ગુ.			કાનપુર „
સ. ૧૬૨૯			હસ્તિનાપુર „
સ. ૧૬૩૩ મા. સુ. ૩			સુનાનગર સ.
સ. ૧૬૩૬ જાન્યે. સુ. ૧૩ સો.			લાગલપુર હુરિં
સ. ૧૬૩૮ આ. ૧. ૧૩	ઘણા મંહિર	કલકત્તા સં૦	
સ. ૧૬૩૯ દ્વા. ૧. ૭ ગુ.			જયપુર હુરિં
સ. ૧૬૪૬ દ્વા. ૧. ૭ ગુરુ		દાહાવાડી બિહાર ના. ૧૦ ૨૩૩	
સ. ૧૬૪૦ મિ. ૧. ૭		કુંયુનિનાલય બીકાનેર	સં૦
સ. ૧૬૪૦ આષા. સુ. ૮ શુ.	દાહાવાડી	જયપુર સં૦	
સ. ૧૬૪૫ પો. સુ. ૧૫ શુ.	દાહાવાડી	અનારસ હુરિં	
સ. ૧૬૬૫ જાન્યે. સુ. ૧૨ શુ.		મેડનાડાડ સં૦	
સ. ૧૬૭૦	૧.	ગંગાશહુર „	
સ. ૧૬૭૬ વૈ. ૧.		લખનાઉ હુરિં	
સ. ૧૬૭૬ આ. સુ. ૩ સો. મૂર્તિ		હાપુડ „	
સ. ૧૬૭૬ વૈ. સુ. ૮	પાહુકા		” ”
સ. ૧૬૭૬ આ. સુ. ૧ સો.		કલકત્તા ના. ૧૦૦૮	
સ. ૧૬૮૭ જાન્યે. સુ. ૫ રવિ. મૂર્તિ	રેલ દાહાળુ	બીકાનેર સં૦	
સ. ૧૬૮૮ આષિ. સુ. ૧૨ પાહુકા		નાકોડા સં૦	
સ. ૧૬૯૩ જાન્યે. ૧. ૮ ગુરુ	નવા દાહાળુ	બીકાનેર સં૦	

સતરમી સહીના ઉપાધ્યાય લલિતકીર્તિના શિષ્ય શ્રી રાજહુરે “શ્રીનિનકુશલસૂરિ અણ્ટોચરશત સ્થાન થુંબ નામ ગર્ભિત સ્તવન” ખનાંથું છે કે માં એ સમયના રતૂપ સ્થાનોની સૂચના છે. તે આ પ્રમાણે છે.

હેરાઉર	આગરા	સાંગાનેર	સાચોર
ગામ ગઠાલા	પટુણુ(આલાણુ)	બિહાર	સોવનગિરી
ઉદ્યપુર	અલવર	માલપુરા	સિરાઢી
સિદ્ધપુર	અમરસર	જ્યતારણુ	નૂતનપુર
કિરણાર	ઓરંગાબાદ	કિસનગઢ	શનુંજય
નેસલમેર	નાડુલાઈ	રાજગઢ	સુરત
ઝેધપુર	વર્ધનપુર	ચમ્પાપુરી	ગિરનાર
નાગૌર	નવાદુર	રતલામ	દીવનગર
મેડતા	ઉદ્ઘોતનપુર	સમિયાણુ	ઠડર
હેવલવાડા	અમદાવાદ	સોજત	આસોપ
ખાલાત	ડેરા(ગાળુભાન)	ખીમસર	મહેલા
પાટણ	શોરગઢ	ખાહુડમેર	ગુંડોણી
પાલી	કંતેપુર	પોકરણ	અહુસનપુર
હિંદ્લી	લાનેર	પાલનપુર	સેત્રાવા
મંગલઉર	કુલોધી	ચન્હેરી	કૈતપુર
વીરમપુર	મેડીચક્ક	તોડાઈ	બિલાડા
અંજર	મરોટ	કુંભલમેર	બડલુંદા
લુજ	અમરકોટ	રિણી	પીપાડ
માંડવી	સમગલ	સરસા	કાપરડા

“આ સ્તવન મૂળ નામ એજ પુરતકના પરિશાસમાં આપેલ છે.

મહિમપુરી	કંબળ	લૂણુકરણુસર	લવેરા
લાલ્દોર	હેવીઝર	એજડલા	આલરવા
સેડરાઈ	બ્યાસેર	પચિયાખ	તિમરી
અન્નમેર	સિરવાડી	હેવીએડા	કુષ્ટિકી
પુંગવ	સિરંજઈ	સાંભર	રોલીઠ
જંગલ	વિકમપુર	ઝુટ્ટઈ	મુલતાન
પુનાસર	બડલી	રાયપુર	ડેરા (હાલુખાન)
ડીડવાણી	વીળપુર	રાધનપુર ઉરા(ઈસમાઇલખાન)	

ઉત્તર વિષિન સ્તૂપોમાંછેના કંઈક તો કાલચકના બોગ બની ચૂક્યાં છે. તેમ ઘણે ડેકાણે નવાં નવાં પણ નિર્માણ થયાં છે. જેમાંના ઘણાખરા લેણો અમો આ સંખ્યામાં આપી શક્યા નથી, આશા છે બીજા સંસ્કરણમાં આપી શકીશું.

પ્રકરણ ચાઠમુ



સાહિત્ય સેવા

શુદ્ધદેવ શ્રીજિન કુશળસૂરિણ મહા-
રાજ વ્યાકરણ ન્યાય, સાહિત્ય આલંકાર,
નાટક નાયોત્ત્વ, મંત્ર તંત્ર, છંહ, તુરગાહ,
કોષ્ટકપૂરણ શાખાલંકાર અને જટિલ સમ-
સ્યાચોની પૂર્ણ આહિ વિવિધ કલાઓમાં
મહાન् સિખ્ખદુસ્ત વિદ્ધાન હતા, એટલે તેઓએ જૈનધર્મની
વિવિધ પ્રકારે પ્રકાવના દ્વારા મહત્ત્વ વધારવા માટે અન્યાન્ય
અનેક મહત્ત્વાપૂર્ણ કાર્યો કર્યાં જેથી સાહિત્યિક સેવા વધપણે
વિશેષ પ્રમાણુમાં નહોતાં કરી શાદ્યાં છતાં જે કંઈ રચનાઓ

કરી હતી તેમાંથી કેટલી એ રચનાઓનો ઉદ્વિષ આગળના પ્રકરણુમાં કરાયું છે. તે પણ કમ ભાગે અધી ઉપલખન નથી, છતાંએ જે કૃતિઓ આજે મળી આવે છે તે પણ એમની અપ્રતિમ પ્રતિલા તથા વિશાળ વાંચન એવાં અનેડ વિચાર-શૈલીની મૌલિકતા એવાં પ્રામાણિકતાનો પૂર્ણ આભાસ આપી રહી છે. આપની આજ સુધી પ્રાપ્ત કૃતિઓ આ પ્રમાણે છે—

૧ ચૈત્યવંદન કુલક વૃત્તિ, આ ૨૭ ગાથા પ્રમાણ લઘુકુલકના મૂળના રચયિતા તો મોટા દાહાસાહેબ યુગપ્રધાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિલુ મહારાજ છે, પણ એના ઉપર ૪૦૦૦ શ્લોક પ્રમાણ અતિસુરોચક વૃત્તિ આચાર્ય શ્રીજિન-કુશાળ સૂરિલુ મહારાજે રચી છે. તેમાં આ લઘુકૃતિના સુંદર ભાવોનું વિશાદ રીતે સ્પષ્ટીકરણ કરવા સાથે અનેક મૂળભૂત અન્થરતનોના આધારે વિષયની પરિપુષ્ટિઓ તો ખાસ સુંદર શૈલીએ ફરી છે જ કિંતુ સાથેસાથે પ્રસંગાનુસાર ધર્મકથાઓ પણ એવી સુંદરતમ આપવામાં આવી છે. કે જેથી અંધની શોભામાં ખૂબજ અલિવૃદ્ધિ થઈ છે. કથાઓ પ્રાયે અધીયો અનુષ્ટુપ શ્લોક બદ્ધ છે. જેની સૂચી શ્લોકસંખ્યા સહિત વિષયવાર નીચે આપવામાં આવે છે.

વિષય સહિત કથાઓના નામ શ્લોક સંખ્યા

૧ સુગુરુ-કુગુરુ વિષયે સિંહ-શૃગાલ કથા	૪૧
૨ ગીતાર્થ શુરુ વિષયે સર્પ-શીર્ષપુચ્છકા કથા	૧૬
૩ „ કુગુરુ „ વૈદ્ય પુત્ર કથા	૨૬
૪ શાસન પ્રભાવના વિષયે સિંહસેન સૂરિ કથા	૧૩૦

૫ શાસન પ્રલાવના વિષયે શ્રેણીક મહારાજ કથા	૬૪૫
૬ ચૈલ્પાંચક વિષયે મંગલ ચૈત્ય કથા	૧૭
૭ કુદેવત્યાગ વિષયે હિંગુશિવ કથા	૨૨
૮ કૃગુડ્યાગ વિષયે જમાલી નિન્હલ કથા	૮૧
૯ ચૈત્યબંદન વિષયે ધનદાત શ્રેણી કથા	૨૮
૧૦ નવકાર ઇલ વિષયે શિવકુમાર કથા	૪૬
૧૧ " " શ્રીમતી "	૩૪
૧૨ " " ધરણોન્દ્ર "	૫૫
૧૩ " " " હુણિકક્યક્ષ કથા	૩૭
૧૪ તપ્યાંકળ વિષયે નાગદાત કથા	૫૬
૧૫ સોદાસ રાજકુમાર કથા	૪૬
૧૬ રાત્રિલોજન વિષયે સુમિત્રા પ્રાન્હુણી કથા	૧૨૫
૧૭ અસાત ઇલ ત્યાગ વિષયે વંકચૂલ તસ્કર કથા	૧૮૬
૧૮ વિચલિત રસાહાર વિષયે પંડિત ધનપાલ કથા	૧૧૫
૧૯ ત્રસળવ રક્ષા વિષયે ચંદ્રરાજ કથા	૬૩
૨૦ અલીક વાક્ય પરિહાર વિષયે હંસરાજ કથા	૭૫
૨૧ અદ્દાહાન વિરતી વિષયે દાતશ્રેણી કથા	૧૦૩
૨૨ શીલ મહાત્મ્ય વિષયે સુદર્શનશ્રેણી કથા	૧૮૪
૨૩ પરમાર્થિત આનંદ શ્રાવક કથા	૬૨
૨૪ જીવરક્ષા વિષયે વજાયુધ ચડી કથા	૧૪૫

આ રીતે એકંદર ૨૪ કથાઓનો સન્દર્ભ બહુ સુંદર શૈલીએ સંદર્ભિત કર્યો છે. વલી આ અન્યમાં પ્રસંગે પ્રસંગે નિચેના અન્યોના નામ નિર્દેશ સાથે ઉદ્ધરણો આપ્યાં છે—

૧ આવશ્યક સૂત્ર	૧૦ બોગશાસ્ત્ર ટીકા.
૨ „ નિર્ણયકિત	૧૧ નિશીથચૂણ્ણુ
૩ „, ટીકા હારિલદ્રીયા	૧૨ વિવાહચૂલિકા સૂત્ર.
૪ પંચલીંગી ટીકા (જિને શવરસ્ફુર્કૃત)	
૫ ઉપદેશમાલા પ્રકરણ	૧૩ નિશીથસૂત્ર
૬ નિશીથલાઘ્ય	૧૪ દશાવૈકાલિક સૂત્ર
૭ ઓધનિર્ણયકિત	૧૫ સ્વધમીંવાત્સલ્ય કુલક (અભયહેવસ્ફુર્કૃત)
૮ દશાશુતરકંન્ધ લાઘ્ય	૧૬ મિથ્યાત્વ કુલક સંપૂર્ણ
૯ મહાનિશીથ સૂત્ર.	૧૮૦ રૂપ (પૂર્વાચાર્ય કૃત)

આ ચૈત્યવંદન કુલક વૃત્તિ ‘શ્રીજિનદત્તસ્ફુરિ જાન બંડાર’ સૂતરથી પ્રકાશિત થઈ ચૂકી છે. એટલે વિશેષ જાણુવા માટે મૂળ અન્ય જોવાની વાંચકોને લલામણ કરીએ છીએ.

૨. શ્રીજિનચંદ્રસ્ફુરિ ચતુ:સમતિકા—આ લઘુ કૃતિમાં પોતાના ગુરુહેવ શ્રીમાન् કલિકાલકેવલી શ્રીજિનચંદ્રસ્ફુરિલું મહારાજનું સંક્ષિપ્ત પણ રોચક ચરિત્રનું ચૈતિહાસિક દસ્તિએ પ્રાકૃતની ૭૪ ગાથામાં વર્ણિત છે.

૩. કુલોધી પાર્થીજિન સ્તોત્ર, ૧૮૦ ૧૧

આદિ—“ સકલભૂતલભૂષણશોખરમ् ”

૪. પાર્થીનાથ સ્તોત્ર, ૧૮૦ ૫

આદિ—“ ઊં હ્રીં શ્રીં ધરણોરગેન્દ્રમહિતાઃ ”

૫. સ્તંભન પાર્થીનાથ સ્તોત્ર, ૧૮૦ ૬

આદિ—“ સ્તંભનસ્મોજવિકાશમિત્રમ् ”

૬. શેરીષકાલંકાર પાર્થી જિન સ્તોત્ર, ગાઠ ૫
આદિ—“શ્રીશેરીષકપત્તનાવનિશિરः”
૭. ચિદ્ધક્ષેત્ર મંડન આદિનાથ સ્તવન, ગાઠ ૧૬
આદિ—“શ્રીવિમલાચલવિમલાચૂલો”
૮. બહુવિહૃણંક શ્રીશાંતિજિન સ્તવન, ગાઠ ૩૨
આદિ—“સિરિસંતિનાહચરિયો”
૯. શ્રીપાર્થી જિન જન્માભિપેક સ્તુતિ, ગાઠ ૪
આદિ—“દ્રોદ્રોકિધપમયો”
૧૦. ચતુર્વિંશતિ જિન નામ ગલ્ભિત સ્તુતિ, લોક ૪
આદિ—“નામેણાજિતવાસુપૂજ્યસુવિધિં”+
૧૧. પંચમી તપ્યઃઇદ્ગલ્ભિત નેમિજિન સ્તુતિ, લોક ૪
આદિ—“શ્રીનેમિઃ પञ્ચરૂપત્રિદશપતિકૃતો”+

પ્રકરણ નવમું



શિષ્ય પરંપરા

આર્ય મહારાજના વરદ હુસ્તકમલથી
દીક્ષિત થયેલાં સાધુસાધીઓનાં નામેણ
કેટલાંએ ગત પ્રકરણોમાં આવી ગયાં છે.
નેમાં મહોપાઠ્યાય શ્રીવિન્યપ્રકા અને

+આ બન્ને સ્તુતિઓના અંતે ‘કુશલ’ શખદ આવેલ હોવાથી અને.
રચનાસૌલી જોતાં ચરિત્ર નાયકની કૃતિનું અતુમાન સહેને થઈ આવે છે

સોમપ્રકાશ, વિશેષ ઉલ્લેખનીય મુનિપુંગવે હતા. એટલે એમનાં
અને એમની શિષ્ય પરંપરાને બોડાપરિથિય આપવે જરૂરી છે.

૧ મહોપાદ્યાય શ્રીવિનયપ્રલ

એમની દીક્ષા સંં ૧૩૮૨ વૈશાખ સુદિ ૫ ને હિવસે
થઈ એવું ઉલ્લેખ પૂર્વના પ્રકાર્ણોમાં થઈ ચુક્યો છે. સંવત્
૧૩૮૩ અને ૧૪૧૨ના વચ્ચગાળામાં એઓશ્રીને ઉપાદ્યાય પદ
મજૂરું હોય એમ અનુમાનથી જણ્યાય છે, આપ જુહુ ઉચ્ચકારિના
વિદ્ધાન હતા. એમની સાહિત્યિક સત્કૃતિઓ આ પ્રમાણે છે.

૧ નરવર્મ ચારિત્ર-સંવત્ ૧૪૧૨ કાર્તિક પૂર્ણિમાએ
ખંસાતમાં આ ચારિત્રની ર્થયના કરી. તેજ સમયમાં લખાયલી
૧૦ પત્ર અને ૪૬૪ શ્લોકની પ્રતિ બાલોતરાના ભાવહૃદ્ધિ
શંદારમાં અમોાયે લોધ હતી. અંતિમ ઉલ્લેખ આ પ્રમાણે છે.

“સંવત્ ૧૪૧૨ વર્ષે શ્રીવિનયપ્રમોપાદ્યાયૈः શ્રીસ્તમ્ભષુરે
સ્થિતૈઃ સમ્ય(કત્વ)ક(?)સારા(યા) ચક્રે હિ નરવર્મનૃપકથા”

આ અન્યનું પ્રકારણ જામનગરવાળા પંડિત લીરાલાલ
હંસરાજે કર્યું છે. પરંતુ આશ્ર્યને વિષય છે કે પ્રકારણકે
નામજ ઉડાવી દીધું છે. સાહિત્ય સાધનામાં આવા પ્રયાસો
અન્યકર્તાનું ધાતક અને નિધ છે.

૨ ગૌતમ રાસ્-સંવત્ ૧૪૧૨ કાર્તિક સુદિ ૧ ના હિવસે
ખંસાતમાં આ રાસ દેશી ભાષામાં બનાવ્યો છે, ખરેખર આ ગૌતમ-
રાસની ભાષાશૈલી લાલિત્યપૂર્ણ અને પ્રાસાદિક આદિ આશ્ર્યો-
ર્પાદક સાહિત્યિક શુદ્ધોથી ચુક્લા છે, આજે સેકડો જ્ઞાનબંડારોમાં

આ રાસની પ્રતિચો જડે છે. એટલું જ નહિં, કિનુ અનેકો અંગ્રેજીમાં એતું મુદ્રણું પણ થઈ ચુક્યું છે. એ એની લોક પ્રિયતાનું પ્રધાન પ્રતીક છે. કોઈ પણ ઉત્તમ પ્રકારની કૃતિ અતિ પ્રચારિત હોય છે ત્યારે ધીરુર્ભળ માણુસના મને થાય છે કે આમાં કર્તા તરીકે મારું નામ જોડાય તો કેવું સારું ? આ રાસની ઉપર પણ ગોલું થયું છે. વિજયલદ્ર તથા ઉદ્ઘવંત નામના કોઈ અજ્ઞાત વ્યક્તિચોએ આ રાસને પોતાને નામે અજ્ઞાત રીતે ચઢાવી હીધેં છે, જે કે પ્રાચીન પ્રતિચોમાં તો વિનયપ્રલ ઉપાધ્યાયનું નામ રૂપણ છે, છતાં ક્ષુદ્રમાણુસો સ્વપ્રકૃતિનું પરિચય આપ્યા વગર કોઈ રીતે રહી શકતા નથી. સાધુ થધને આવા ફુઝુત્યે કરવામાં શું લાલ મળે છે એ એને ખાસ વિચારવા જેવી વાત છે. સાહિલિક ચોરી કેટલા હિસ છુપાઈ રહેશે ? સમયસું દરળની સજાયોને પણ આવી રીતે ચોરી કરી પોતાને નામે કેટલાકોએ ચઢાવી હીધી છે, ઉપરના રાસની બધાયથી જૂની પ્રતિ સં ૧૪૩૦ ની મળી છે જેમાં વિનયપ્રલનું નામ રૂપણ છે. સાંભળવા પ્રમાણે ઉપાધ્યાળએ પણ ગાથાવાળા આ રાસની રચના પોતાના અકિંચન લાઈને હારિદ્રય ફૂર કરવા માટે કરી હતી. અને તેનું સમરણ કરતાં તેની સાવના સકળ પણ થઈ હતી, વિ ૦ સં ૦ ૧૪૩૦માં લખેલી આ રાસની પ્રતિમાં આપની નિર્મનાકૃત છ કૃતિચોને નામ નિર્દેશ કરેલ છે.

૩. મહાવીર સ્તવન, ૩૧૦ ૨૪

આદ્ય—“સાનન્દનમુસુરકૌદિકિરીટીઠી”

૪ વીતરાગ સ્તવન, ગીતો ૨૫

આદિ-દેવિંદનાર્ંગદનરિંદચંદ"

૫ શાનુંજ્યમંડન મંડપક જિન સ્તવન, ગીતો ૨૬

આદિ-“વિમલશૈલશિરો મુકુટાયિતમ્”

૬ શાંતિનાથ સ્તવન. ગીતો ૧૬

આદિ-“સર્જાનભાનુહતમોહતમોવિતાનકમ્”

૭ તીર્થયાગા સ્તવન, ગીતો ૪૧

આદિ-“મહાનન્દ મહાનન્દ મહાનન્દ વિધાયકના”

૮ ચતુર્વિંશતિ જિન સ્તવન, ગીતો ૨૬

આદિ-“મોહમહામડમયમહણરિસહો”

ઉપાધ્યાયલુના શિષ્ય વિજયતિલકજી રચિત કર્મઅન્થ વિચારગર્ભિત શાનુંજ્ય સ્તવન(ગાથા ૨૧) સુપ્રસિદ્ધ છે. આ સ્તવન ઉપર બહુસંખ્યક વિદ્ધાનેા દ્વારા અન્નથેલ ટીકાએને અને ટણખાએને મળી આવે છે. ભાંડારિ કુલાવતાંસ શ્રીનેમિચાંડ રચિત “ષષ્ઠિશતકવૃત્તિ” ના નિર્માતા શ્રીતપોરતન ગુણુરતને વિજય-તિલક ઉપાધ્યાયને પેતાના વિધાગુરુ તરીકે વર્ણુંયા છે.

ઉપાધ્યાય શ્રીવિજયતિલકજીના શિષ્યોમાં વાચક મુનિશેખર અને ક્ષેમકીર્તિ વિખ્યાત છે, એમને ઉલ્લેખ પણ “ષષ્ઠિશતકવૃત્તિ” માં વિધાગુરુ અને પ્રતાગુરુ તરીકે મળે છે, વાચક ક્ષેમકીર્તિને શિષ્ય પરિવાર બહુ વિશાળ હુતો. એવી કિંવદન્તિ પ્રસિદ્ધ છે કે વાચકશ્રીએ ૫૦૦ ધાડપાડુઓ અથવા તો જાનના દોકાને પ્રતિષોધ આપી એકીસાથે દીક્ષિત કર્યા હુતાં જેના અંગે એમનાથી ક્ષેમધાડ નામની શાખા પ્રચલિત

અઈ હુતી. એમના અનેકો શિષ્યો માણેથી ૧. મોહરાજ, ૨. તપોરલ ઉ ગુણુરલ અને ૪. ક્રેમહુંસ એ ચારનાંજ નામના ઉદ્ઘેષો મળે છે. આજે પણ એમની શિષ્ય પરંપરા યતિરૂપે વિદ્યમાન છે. આ શાખામાં અનેકો વિદ્યાનો થયાં છે જેમાંથી કેટલાક અન્યકારોનો નિર્દેશ અહીં કરવામાં આવે છે.

૧ તપોરલ અને ગુણુરલ “બાણિજીતક વૃત્તિ”ના કર્તા, આ વૃત્તિ વિ. સં. ૦ ૧૫૦૧માં બની છે અને આચાર્ય શ્રીજિનલદ્ર-સ્થાનિ મહારાજે સંરોધિત કરી છે.

૨ મહોપાઠ્યાય જ્યસોમળ. જૂઓ “યુગપ્રધાન જિનચંદ્ર સ્ફુરિ” નામનું પુસ્તક. ૫૦ ૧૬૭

૩ મહોપાઠ્યાય ગુણુવિનય „ „ „ „ ૨૦૦

અને મહોપાઠ્યાયો. સત્તારમી સહીનાં પ્રકાંડ અન્યકાર વિદ્યાનો હુતા. ઉપર્યુક્ત પુસ્તકમાં એમની કૃતિઓનો પરિચય આપ્યા આહ પણ એમની ધણી નવીન રચનાઓ અમો પ્રાપ્ત કરી શકયા છીએ જેના પર અમારો વિચાર સ્વતંત્ર નિખાંધ રૂપે લખવાનો. હોઠ અતે તેનો વિશેષ ઉલ્લેખ નથી કરતા.

૪ મતિકીર્તિ જૂઓ ચુ. ૫૦ જિન૦ ૫૦ ૨૦૨

૫ વિદ્યાકીર્તિ „ „ „ „ ૩૧૨

૬ લાલાલુયકીર્તિ „ „ „ „ ૧૬૬

૭ રત્નલાલ „ „ જૈન ગુર્જર કવિઓ. લા. ઉનો

૮ કનકવિલાસ „ „ ચુ. ૫૦ જિન૦ ૫૦ ૨૦૩

૯ કુંસપ્રમોદ „ „ „ „ ૨૦૩

૧૦ ચાર્દુંત „ „ „ „ ૨૦૪

૧૧. કનકનિધાન „ „ „ „ ૨૦૪

૧૨ પુષ્યકીર્તિ	સું પ્ર૦ જિં	પૃં ૨૦૪
૧૩ લખિધ્યાંદ્ર	" "	" ૩૧૩
૧૪ શ્રીસાર	" "	" ૨૦૭
૧૫ હેમનનદન	" "	" ૨૦૬
૧૬ સહજકીર્તિ	" "	" ૨૦૬
૧૭ યતીન્દ્ર	" "	" ૨૦૮
૧૮ નંનલાલ	" જૈન સિધ્યાંત ભાસ્કર માસિકમાં અમારો દેખ	
૧૯ વિનયમેર્દ	" સું પ્ર૦ જિં	પૃ. ૨૧૦-૩૧૫
૨૦ જિનહૃષ્ટ	" જૈ. ગુ. ક. લા. રણે	
૨૧ લાલવર્ધન	" " " " "	રણે
૨૨ રામવિજય (૩૪-ચાંડ)	" " " " "	ઉને
૨૩ શિવચાંડ	" " " " "	ઉને
૨૪ રામચાંડ્ર	" " " " "	ઉને
૨૫ લક્ષ્મીવલલસ	" " " " "	રણે
૨૬ સિંહા	" " " " "	ઉને
૨૭ ભુનનકીર્તિ	" " " " "	૧દો
૨૮ મતિકુશળ	" " " " "	રણે
૨૯ યશોવર્ધન	" " " " "	રણે
૩૦ રત્નવિમલ	" " " " "	ઉને
૩૧ અમરસિન્હુર	" " " " "	ઉને
૩૨ રામલાલજીમહેઠો	ખીકાનેરમાં વિદ્યમાન હતા, એમનું પણ મૃત્યુ યોડાજ ટાઈમ પહેલાં થયું છે.	

૧ એમના શિષ્ય ઉદ્યરાજ શિષ્ય નેમચાંડ શિષ્ય સ્યામલાલજી જ્યાપુરમાં
વિદ્યમાન હતા, હમણા યોડા બખત પહેલાંજ જેમનો અવસરન થોડો છે.

આ અધ્યાતે વિદ્વાનોની પરંપરાના ધ્યાનાંચે વંશવૃક્ષો તથા અન્યસૂચિઓ અમારા સંખ્યામાં છે. પરંતુ સ્થાન ન હોવાથી અને વિષયાંતરના લયથી અતે આપતાં નથી.

૨ ઉપાધ્યાય શ્રીસોમપ્રલ

પાલનપુરના માલૂગોત્ત્રીય રૂદ્રપાલની સુશીલા ધર્મપત્ની ધારાલહેવીની રત્નકુક્ષીથી વિ. સં૦ ૧૩૭૫માં આપને જન્મ થયો હતો. જન્મ નામ સમરા કુમાર હતું. એકવાર ચરિત્રનાયક શ્રીજિનકુશલસૂરિલુ મહારાજ પાલનપુર પધાર્યા ત્યારે સમરા-કુમારનાં શુભલક્ષણો લેઈ તેના પિતાને દીક્ષાની વિશિષ્ટતા સ્નોચક ઉપદેશ આપતાં કહ્યું કે તમારો પુત્ર દીક્ષિત થશે તો મહાનાંશાસન પ્રભાવના કરનારો થશે એમ કહી ગુરુદેવ લીમપ્રલી પધાર્યા. પાછળથી રૂદ્રપાલ પણ સપરિવાર ત્યાં જઈ સમરા-કુમાર અને તેની બહેન કીલ્લુ ને સં૦ ૧૩૮૨ વૈશાખ સુ. ૫ ને રોજ દીક્ષા અપાવી સોમપ્રલ અને કમલશ્રી કમશા: બાઈ બહેનનાં નામો રાખ્યાં. સં૦ ૧૪૦૬ જેસલમેરમાં સોમપ્રલ મુનિને વાચનાચાર્ય પદ આપ્યું. સં૦ ૧૪૧૫ આષાઢ સુહિ ૧૭ના ઘંલાત નગરમાં તરણુપ્રભાચાર્યલુએ શ્રીજિનચંદ્રસૂરિલુના પટ્ઠપર સ્થાપિત કર્યાં, દિલ્હીના શ્રીમાલ શાહ રતના, પુના આદિએ પદોત્ત્સવ કર્યો. એમણે પાંચ સ્થળોમાં બૃહુત્તર પ્રતિષ્ઠાએ. ૨૪ શિષ્ય અને ૧૪ શિષ્યાએને દીક્ષાએ. આપી, કેટલાએ લોકોને સંધ્યપતિ આચાર્ય ઉપાધ્યાય વાચનાચાર્ય આદિપદો આપ્યાં. સં૦ ૧૪૩૨ના લાદ્રપદ કૃષ્ણા એકાદશી ને હિવસે લોકિતાચાર્યલુને ગણવિષયક શિક્ષા આપી સ્વર્ગવાસી બન્યા સંચે દાહુસ્થળ ઉપર સુંદર સ્તૂપ બનાવ્યો. એમના પદ્ધતિ શ્રીજિન રાજસૂરિલુ. થયા. એમના વિશેષ જ્ઞાતવ્ય માટે બુઝો ઔતિહાસિક જૈન કાળ્ય સંખ્ય.

૩ શ્રીજિનપદમસુરિલુ

આપ સુવિષયાત ખીમડ કુલીન શેડ લક્ષ્મીધરના પુત્ર આંખાની સુશીલા ધર્મપત્ની શ્રીમતી કીકીબાઈના પુત્રરત્ન હતા; સંં ૧૩૮૪ માઘ સુહિ પમને દિને દેરાઉરમાં ચરિત્રનાયક શ્રી જિનકુશળ સૂરિલુ મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સંં ૧૩૯૦ જેઠ સુ. ૬ના દેરાઉરમાં શ્રીતરણુપ્રલસ્યરિલુએ સૂરિપદ આપ્યું. અને સંં ૧૩૯૦નું ચોમાસું જેસલમેર કર્યું, જેનું વિસ્તૃત વર્ણન અમે છુટુ પ્રકરણુમાં આપી ગયા છીએ. અના પછીનું વિશેષ વર્ણન ગુર્વાવલીમાં આ પ્રમાણે મળે છે.

સંં ૧૩૯૧ ચોખ સુહિ ૧૦ ના રોજ લક્ષ્મીમાલા ગણુનીને પ્રવર્તનીપદ આપ્યું, માલારાપણુદિ ઉત્સવો થયા, ખાંડ બાડમેર પધાર્યા, ત્યાંના રણ્ણા શિખરસિંહ અને શ્રાવક પ્રતાપ-સિંહ સાતસિંહ સન્મુખ આવી લંઘ પ્રવેશોત્સવ કર્યો, અહીં ૧૦ દિવસની સ્થિરતા કરી સત્યપુર (સાચોર) આવ્યા, અહીં રણ્ણા હુરિયાલહેવ અને નીંબા શેડ કરેલ સામૈયા સાથે લગ્બાન મહુવીર સ્વામીની પ્રાચીન લંઘ પ્રતિમાનાં દર્શન કર્યાં, મિતિ માહ સુહિ દને દિવસે પ્રતાપહુણુ માલારાપણુદિ ઉત્સવો થયાં. નયસાગર અને અલયસાગરની દીક્ષા થર્ધ, એક માસથીએ એાછા દિવસો ત્યાં સ્થિરતા કરીને શેડ વીરહેવના આથહુથી આદિત્ય-પાડા ગયા નયાં પાર્શ્વ પ્રલુના ચરણો લેટાયા, અહીંથી પારણું ભયા. ત્યાં નવલભા દેવાનનંદનાં પુત્ર અમરસિંહ ભાગ સુહિ ૧૫ના.

સ્વાગત પૂર્વક પ્રવેશ કરાવ્યો, સૂરિલુ મહારાજે શાન્તિનાથ પ્રલુને
વંદન કર્યું, મિતિ મહુસુદિ ૧૫ને શેડ જાહુણુના પુત્ર તેજપાદે
સૂરિલુ મહારાજ પાસે ઝષણદેવ આદિ ૫૦૦ મિઅણોની પ્રતિષ્ઠા
કરાવી. મિતિ ઝાગણુ વહિ દના રોજ માલા રોપણુ સમૃક્તવ
અહુણુદિ ઉત્સવો થયા. સં ૧૩૬૮ માગસરવહિ દના ક્ષુદ્રકમુનિ-
ઓની ઉપસ્થાપના અને શ્રાવિકાઓનો માળાઅહુણોત્સવ થયો.

સં ૧૩૬૮ કાર્તિક મહિનામાં તેજપાલ કાર્તિક ઉત્સવ
સહિત સૂરિલુ મહારાજે કર્તિપય શ્રાવક શ્રાવિકાઓને
પ્રથમોપધાન વહુન કરાવ્યું. શ્રીક્રીમાલ મોખદેવ શ્રાવકને
શુરાવલ્લી મંડન શ્રીપાર્શ્વનાથ પ્રલુનાં દર્શન કરવાનો અભિયંત્ર
હતો. અતઃ એમની વિનંતી સ્વીકાર કરી ઝાગણુ વહિ ૧૦૧-
દિવસે પાટણુથી પ્રસ્થાન કરી નારઉદ્ર ગામે ગયા, ત્યાં મંત્ર
ગોહાના પ્રવેશોત્સવ પૂર્વક જે દિવસ રહી આશોટા ચાંચા,
ત્યાં શેડ વીરદેવ શ્રાવકે રાજ સદ્રનનંદન રાજી ગોધા અને
સામંતસિંહ આદિ રાજ્યઅધિકારી સંજનોનો સહિત પ્રવેશો-
ત્સવ કરાવ્યો, ત્યાંના રસ્તામાં ચોર ડાકૂઓનો લય હોવા છતાં
શ્રાધ્યશિરામણુ શેડ મોખદેવના સુપ્રભાધ્યથી નિર્વિઘ્નતયા
ખૂબદ્રી પદ્ધાર્યાં. ત્યાં શેડ છજ્જલના કુલપ્રહીપ શેડ મોખદેવે
ચૌહાણ રાજ ઉદ્યસિંહ આહિની સાથે સન્મુખ જઈ સમ્માન
પૂર્વક પ્રવેશ કરાવ્યો, એજ વર્ષે રાજ ઉદ્યસિંહની સહાય
તાથી શેડ મોખદેવે રાજસિંહ પુત્ર પુર્ણસિંહ ધનસિંહ આદિ
સહ કુદુર્ય આખૂ તીર્થની યાત્રા માટે પૂજયશ્રીને વિનંતી
કરી, સૂરિલુ મહારાજે તેનો સ્વીકાર કર્યાથી સપાદલક્ષ દેશીય
શ્રીમાલ વીજા હેખાલ જિનદેવ સાંગા આહિને કુંકુમપત્રિકા મોકલી

અને માર્ગનો ભાર શાહ મૂલરાજ, પદ્મસિંહ આહિને સોંઘેં. શેડ મોખદેવે ચૈત્ર સુદ્ધિ ૬ રવિવારને હિવસે તીર્થયાત્રા માટે અનવરાવેલ શ્રીશાંતિનાથ પ્રલુના નવીન દેવાલયની વાસક્ષેપ પ્રતિષ્ઠા આચાર્ય મહુરાજ પાસે કરાવી. અષ્ટાંનુકા મહેતસવ કર્યો, ચૈત્ર સુદ્ધિ ૧૫ને દિને ખૂજદ્રોના શા. કાલા કીરતસિંહ, છાતા. લોળા આહિ સંઘસહિત પ્રયાણ કર્યું શ્રીજિનપદ્મસૂરિલુ મહુરાજ પણ લખિધનિધાન ઉપાદ્યાય, વાચક અમૃતચંદ્ર ગણિ, આહિ ૧૫ સાધુ અને જયર્દ્ધી મહુતરાહિ ૮ સાધીએ સહિત સંઘ સાથે પદ્ધાર્યા. યાત્રીસંઘ પૂર્વનિમંત્રિત સપાહલક્ષીય સંઘ સાથે મળી નાણું તીર્થ ગયો, શાંત સુરહેવ આહિએ ઈન્દ્રપદ અહુણુ કર્યું, શેડ મોખદેવે શ્રીવીરપ્રલુના મંદિરમાં ૨૦૦ ચઢાયા.

ત્યાંથી કુમશા: આણુ જઈ સમસ્ત સંદે વિમળશાહ તથા વસ્તુપાલ તેજપાલ કારિત વિમલવસહી તથા લૂણગવસહી અને તેજસિંહવિહારનાં દર્શન કર્યાં. શેડ મોખદેવ આહિ શ્રાવકેએ ઈન્દ્રપદ અહુણુ કર્યું. મહાધ્વલારોપણુ અવારિતસત્ર આહિ એનેકો સુકૃત્યો થયાં, ભગવાનના બંડારમાં ૫૦૦ પાંચસે ઝપિયા સમર્પિત કર્યાં, ત્યાંથી પ્રદૂધાનપુર (પાલણુપુર)ના સ્તૂપની અને સુદ્રસ્થલા ગામમાં શ્રીજિનપતિસૂરિલુની મૂર્તિના સંઘ સહિત દર્શન વન્દન કરી જીરાવલ્લી પદ્ધાર્યા. ત્યાંના બંડારમાં ૧૫૦ની આવક થઈ. અહુંથી બધા લોકો ચંદ્રાવતી ગયા. ત્યાં શાહ આંગણ અને કૂપા આહિએ સ્વધર્મિવાત્સલ્યાહિ કરી સંઘતું સારું બહુમાન કર્યું. ઝખલહેવ ભગવાનના મંદિરમાં ૨૦૦ ઝપિયાની આવક થઈ.

ચંદ્રાવતીથી પ્રયાણુ કરી આરાસણુ(કુલારીયા)માં નેમિનાથ
આહિ પંચતીર્થીને વંદન કર્યું, ત્યાંના ભંડારમાં ૧૫૦ ઝપિયા લેટ
આપી તારંગા આવ્યા જ્યાં ચૌલુક્યવંશહિતમણુ પરમાર્હત
શ્રીમાન્કુમારપાણ ભૂપાલ કારિત ગગનચુંબી લભ્ય મહિરમાં
વિરાજિત શ્રીઅજિતનાથ મહારાજનાં દર્શન કર્યાં, ૨૦૦ ઝપિયા
લેટ આપ્યાં, તારંગાથી પાછા ફરતાં સંઘ ત્રિશુંગમ આવ્યો,
મન્ત્રી સાંગણુ પુત્ર મંડલીક વયરસિંહ નેમા કુમારપાલ
મહિપાલ આહિએ પોતાના રાજ મહીપાલના પુત્ર મહારાજાન
રામહેવને વિનંતી કરી સરકારી વાજિનો સહિત સંઘનો
પ્રવેશોત્ત્સવ કર્યો, પૂજય શ્રીએ બહુ સમારોહથી ચૈલ્પ્રવાડી
કરી, સંઘે પાર્ષ્વપ્રભુની સમુખ ૧૫૦) લેટ કર્યાં.

લઘુવયર્સક પ્રતિભાસમ્પત્ત આચાર્યવર્ય શ્રીજિનપદ્મસૂરતિ
મહારાજના ગુણોની બહુ પ્રશંસા સાંલળી રાજ રામહેવે શેઠ
મોખહેવ અને મંત્રી મંડલીક સમક્ષ સૂરતિ મહારાજનાં દર્શન
કરવાની તીવ્ર ઉઠકંઢા દર્શાવી, તે બન્ને શ્રાવકોના આશ્રદ્ધી
મહેપાદ્યાય શ્રીલભિનનિધાનાહિ સારા વિદ્ધાન સાધુએ સહિત
આચાર્યહેવ રાજસભામાં પથાર્યા, નરપતિએ સિંહાસનથી ઉઠી
સ્વાગત પૂર્વક સૂરતિ મહારાજને વંદન નમસ્કાર કરી પાટપર
બિરાજવા નમ્ર શાણ્દોમાં વિનંતી કરી, આચાર્ય શ્રીએ રાજને ધર્મ
લાલ આશીર્વાહ આપ્યો. જ્યારે મુનિએ બધા કુમણથી યથા-
સ્થાને એસી ગયા ત્યારે સારંગહેવ મહારાજના જ્યાસે પોતાના
અનાવેલ કાળ્યની વિશાહ વ્યાખ્યા કરી. ઉપાદ્યાય શ્રીલભિ-
નિધાનજીએ વ્યાસ મહાશયની રચનામાં કેટલીક કિયા વિષયિક
તુટિએ. બતાવી, જેથી રાજ રામહેવે સંતુષ્ટ થઈ ઉપાદ્યાય-

લુની તીવ્ર પ્રતિલાના ભાડે વખાણું કર્યા, આચાર્ય મહારાજે તત્કાળ નૂતન કાવ્ય નિર્માણ કરી રાજ રામહેવનું આપેહું વર્ણન કર્યું, રાજસાહેણે એ કાવ્યને વિકટ અક્ષરોમાં લખાયું, પૂજય આચાર્યશ્રીએ તે એકજ કાવ્યના અનેક અથો કરી રાજને ચમકૃત કર્યો, તહનાંતર શ્રીસંધ સમસ્ત ચંદ્રાવતી થઈ પાછો ખુજદ્રી આંથો, શેઠ મોખદેવે રાજ ઉદ્ઘસિંહ સહિત કાવ્યપ્રવેશોત્સવ કર્યો, ચાતુર્માસ પણ સુરિલ મહારાજનો અહીંજ થયો. પ્રાચીન ગુર્વાવલીમાં અહિં સુધીનુંજ વર્ણન છે.

અન્યાન્ય પદ્માવલિઓમાં લખ્યું છે કે-જયારે આપ સંં ૧૭૬૦માં બાડમેર પધાર્યા ત્યારે ત્યાંના શેઠ કુલધર દ્વારા નિર્માપિત શ્રીઆહિનાથ અને મહાવીર પ્રભુના વિશાળ ભંહિરામાં દર્શનાર્થ પધાર્યા પ્રવેશદ્વાર નાનું અને પ્રતિમાઓ વિશાળ જોઈ બાલસ્વભાવ વશાત્ પોતાની માતૃભાષા સિન્ધીમાં ઉપાધ્યાયજ ને પૂછ્યું કે-

“કુહા લંઢા વસહી કિઉ માણી આહુદ ? ”

ત્યારે પ્રત્યુત્તરમાં ઉપાધ્યાયજાએ સરસ રીતે તેમનું સમાધાન કર્યું, ત્યાંથી વિહાર કરી પાઠણપધાર્યા, સરસ્વતી નહીને કિનારે આરામ કરતાં કરતાં વિચારવા લાગ્યા કે-પ્રાતઃકાલે પાઠણનો મહાનું સંધ વંદન કરવા આવશે ત્યાં હું જે એમની સમસુણ સુંદર રીતે વ્યાખ્યાન નહીં આપી શકું તો સંધ મનમાં શું સમજશે ? ગુરુદેવે મારામાં શું ગુણો જોઈ આટલા મોટા સંધનું નેતૃત્વ સેંચ્યું હશે ? એવી રીતે આખીયે રાત્રિ ચિન્તામંજ ગાળી, એટલેજ નહીની અધિષ્ઠાતા સરસ્વતી હેવીએ પ્રત્યક્ષ થઈને વરહાન આપ્યું. પ્રાતઃકાલે ઉત્સાહુ પૂર્વક લક્ષિતથી શ્રીસંધ વંદનાર્થ આંથો એટલે સરસ્વતીની

કુપાકટાકથી “અહન્તો ભગવન્ત ઇન્દ્રમહિતાઃ” આ કાળ્ય કોરણાં
લાક્ષણિક શૈલીમાં અતીવ મનોહર શખ્ષિપ્રદૂતિએ ખુલ્લ સુંદર
વ્યાખ્યાન આપેયું, સમસ્ત સંઘે ચમત્કૃત થઈ “ગાલઘવળ-
કુર્ચાલિસરસ્વતી” નામથી પ્રસિદ્ધિ કરી. સંવત ૧૪૦૦ વૈશાખ
સુદ્ધિ ૧૪ના રોજ પાઠથુમાં સ્વર્ગવાસ થયો, સંઘે આપની
સ્મૃતિમાં આપનો સુંદર સ્તુપ નિર્માણ કરાયો. આપ દ્વારા
નિર્મિત કુશલસ્તુરિ “અષ્ટક, સ્થુલિલદ્રક્ષાગ અને કેટલાક
સ્તોત્રો આહિ વિદ્યમાન છે.

શ્રીજિનયધસ્તુરિલુના પદૃપર સં ૦ ૧૪૦૦ આપાઠ વહિ ૧ને
દ્વિને પાઠથુમાં શ્રીતર્ણયપ્રભસ્તુરિલુએ શ્રીજિનલભિધસ્તુરિલુને
બેસાડ્યા, નવલભા અમરસી (આસા) ઈવરે પહોતસવ કર્યો.
અષ્ટાવધાની શ્રીજિનલભિધસ્તુરિલુ સં ૦ ૧૪૦૬નાં વર્ષે નાગોરમાં
સ્વર્ગ સિધ્યાંયા, તરફદોપરિ તર્ણયપ્રભાચાર્યલુએ વિં સં ૦
૧૪૦૬ માધ સુદ્ધિ ૧૦ને દ્વિસે જૈસલમેરમાં શ્રીમાલ શાહ હાજી
કારિત મહોત્સવ પૂર્વક શ્રીજિનયદ્રસ્તુરિલુને સંસ્થાપિત કર્યા.
સં ૦ ૧૪૧૪માં ખંલાતમાં આપ પણ પરલોકવાસી બન્યા,
ત્યાં બગીચામાં આપનો એક સ્તુપ અનાવવામાં આવ્યો હતો.
અમના પદૃધર આપણા ચરિત્રનાયક શ્રીજિનકુશલસ્તુરિલુ
મહુરાજના અંતેવાસી મહોપાધ્યાય શ્રીસોમપ્રભલુ ભયા, જેનું
વર્ણન આગળ પૃષ્ઠ ૭૮માં આવી ગયું છે.

: સમાપ્ત :

૧ આ અષ્ટક પર ધરણીધર કૃત વૃત્તિની ૨ પત્ર વાળી પ્રતિ “શ્રી
બિજયધર્મસ્તુરિ શાનમહિર” આગરામાં નં. ૧૬૭૬ ઉપલખ છે. ખીજુ
પ્રતિ બાળહર્ષિપ શાનલંડાર વાલોતરામાં પણ છે.

परिशिष्ट [क]

एकदा प्रस्तावि श्रीजिनपतिसूरि भगवंत श्रीअजय-
मेरु नगरि संयम प्रतिपालता रहइ छइ, मला ब्याख्यान
मला ध्यान मला ज्ञान दान, ते विस्तारता सुखइ सुखइ
अवस्थान करइ छइ। इम करताँ जिवारइ श्रावक आबी
गुराँ आगइ बड़सइ, देव गुरु संघ श्रावक संबंधिनी जिवा-
रइ वात नीसरइ, तिवारइ श्रीजिनपतिसूरि श्रावक गुण
ग्रहण प्रस्तावि कहइ-जे महस्थली देसि श्रीखेड नगरि
मुहतो श्रीउद्धरणु घणुं भलउ छइ, अत्यंत देवगुरु
साहमीभक्त, धर्म विषइ आसक्त, देवगुरु आज्ञा प्रति-
पालवा विषइ सावधान, कृपासागर, दयावत्सल, विनय
विवेक विचार विषइ विदूर छइ। इसी परि श्रीजिनपतिसूरि
उद्धरण छाज्हड तणी प्रशंसा करइ। श्रावक गुण वर्णन,
करताँ देखी, अनइ श्रीरामदेव साह पणि महर्दिक अनय-
मेरु वसइ छइ देव गुरु विषइ भक्त, हिव श्रीरामदेव साह
श्रीजिनपतिसूरि गुरु उद्धरण वहित्री तणी गुण प्रशंसा
देखि मनइ चिन्तव्यउ-एक बार परीक्षा करी जोखुं।
गुरु घणउ वर्णवइ छइ, महस्थलीमाँहि ते उद्धरण किसउ
छइ?। इमउ चिंतवी घड़ीया जोयणी साँडं पलाणी
पाधरउ खूमउकउ वेस करी तिहाँ थकी चाली श्रीखेड़ि
नगरि आव्यउ। तिसइ उद्धरण तणा बाणउ तणइ हाटि
ऊतरियउ छइ। तेह कन्दा भोजन सामग्री घृत तंदुल

पिष्टकादिक गरथि करि लेवा लागउ, तिसइ श्रीद्वृतरण पणि देवनइ संयोगि तिहाँ आव्यउ। ते श्रावक जाणी जुहार जुहार करी आपणइ गृहांगणि तेडि अंगोहलि करावी, भली पट्ठकूल तणी धोवति बेवइ जणा पहिरी देहरइ देवपूजा करिवा नीकल्या छइ। तिसइ उद्धरण तणी कलत्र पणि मला अपूर्व वस्त्र पहिरी ओढी हाथि कचुलडी लेइ नीकली। कचुलडी मांहे एकइ प्रदेशि कुसुम केसर……एकइ प्रदेशि……पांच सात एकइ प्रदेशि बि च्यार नवा सखर सुरंग चुनडी घाती कचुलडी लेइ उद्धरण तणी कलत्र पणि देहरा भणी जायइ छइ,…… देखि रामदेव साहनइ मनि विस्पथ ऊपनउ, ए किस्यउ स्वरूप? देहरइ जाताँ घाटडी अनइ चूडा कांइ? मनि सांसइ उपनइ हुंतइ कोइ एक पृछयउ एहडी घाटडी कांइ देहरइ लेइ जायइ छइ? तिणि कह्यु-ए श्री उद्धरणनी कलत्र पहा पुण्यात्मा सर्वज्ञतणा शासननइ विषइ चतुर, देहरइ जाताँ कोइ श्राविका चूडा पखइ देहरा जाताँ आवताँ देखइ दूबली दोहली, तेहनइ चूडा पहिरावइह चूनडी पखइ मिलइ, तेहनइ चूनडी ओढावइ, साडी दियइ, तिणि कारणि ए भाग्यवंत श्राविका सहु प्रकारे दीन दुस्थित तणइ कारणि आधार दियइ इसी विवेकवंत श्राविका छइ। इसउ जाणी श्रीउद्धरण तणा घरनउ आचार देखी मनमांहि हर्ष करी हर्षित थयउ, मनि पान्यउ-जे

श्रीजिनपतिसूरि वार्ता कही ते सत्य, संदेह भाग्यउ।
 अनेराह घर तणा मनुष्य देवगुह विषइ मक्किमंत, सम-
 क्षेत्र, दस क्षेत्रह आपणउ वित्त वाचता देखी श्रीरामदेव साहु
 उद्धरण वहित्री तणइ पगइ लागी आपणपाउ जणाव्यउ, ज
 हुं ताहरी परीक्षा करवा भणी आव्यउ हुंतउ, श्रीजिनपतिसूरि
 ताहरी वर्णना करइ, मह जाणीयउ—ते किमउ छइ?
 तिणि कारणि हुं अब्र आव्यउ, तउ सांपत आज ताहरउ
 घर तणउ आचार दीठउ, मन संतोष पहटउ, संशय दूरि
 नाठउ, जिनशामननह विषइ इसा पुरुषरत्न हुवह तउ ए वार्ता
 जुगतीहीजि छह, तउ धन्य अनह ते श्रीजिनपतिसूरि पणि
 धन्य, हुं पिण धन्य, जे इसा साहमी तणउ मुख दीठउ।
 इसी परि आपण पउ धन्य मानतउ हुंतउ भली परि
 श्रीउद्धरण मोकलावी रामदेव साहु श्रीअजयमेरि आपणइ
 नगरि आवी श्रीजिनपतिसूरि वांदी नमस्कार करी
 खमाव्या, आपणउ खेडि नगरि गयां तणउ वृत्तांत कही
 खमत खामणा कीचा। इसा श्रीजिनपतिसूरि हुआ।

अथ उद्धरण तणउ वृत्तांत लिखियह छइ, ऊद्धरण
 आगइ कोमल हुंनउ, पछइ श्रीउद्धरणि खेडि नगरि पहा
 उत्तुग तोरण प्रासाद कराव्यउ, संपूर्ण प्रासाद नीरनउ.
 तिवार प्रतिष्ठा तणउ मुहूर्त गिणाव्यउ, कोमल आचार्य
 प्रतिष्ठा करिवा भणि तेज्या, ते आचार्य अनेरह स्थानकि
 प्रतिष्ठा करिवा पहुंता, तिवारह उद्धरण मर्चित थयउ,

समस्त सामग्री प्रतिष्ठा तणी तउ मेलि हिव किम की-
जियइ ?, तिवारह श्रीउद्धरण तणी कलत्र खरतरानी दीकरी
हुंती, तिण कद्यउ-श्रीजिनपतिसूरि कन्हां प्रतिष्ठा करावउ,
तिवारह प्रतिष्ठा करावी मस्तकि वास घताव्या खरतर हुआ ।

“बारसए पणयाले, विकमसंवच्छराउ वडकंते ।

ऊद्धरणकेडपमुहा, छाजहडा खरतरा जाया ॥ ? ॥

अजे सौम उद्धरण छाजहड तणउ केड खरतर हूवउ ।
श्रीउद्धरण मुंहतानउ पुत्र कुलधर मंत्रीश्वर प्रवर्च्यउ, तिण
कुलधरि श्रीजिनेश्वरसूरि तणइ वारह श्रीबाहडमेरि उत्तुग-
तोरण प्रासाद कराव्यउ । तेह तणइ वंशि श्रीजिनभद्रसूरि
सरीखा गुणवत गुरु प्रवर्च्या ॥ श्री ॥

अभारा संथेना एક प्राचीन पत्रथी उँडूत.

ફ ફ

ફ

परिशिष्ट [ख]

चरित्रनायक दादा श्रीजिनकुशलसूरिकृता
स्वगुरुगुणगर्भितचरित्रवर्णनात्मिका
जिनचन्द्रचतुर्सप्ततिका ।

—५—

सिरि जिणचंद गुणीसर-पाए नमिउं तमस्मि रविपए ।
काहं गुण कण थवणं, नियसुगुरुणं गुणगुरुणं ॥१॥
जइ जगजणे हविज्ञा, परमाऊ ताणि य पउण-महकलिआ ।
तहवि न तीरइ तुह गुण-गणगणणे कहमहं? थविआ (?) ॥२॥
तह वि पह चित्त भत्ती-अचित-चितामणी पसाधाओ
पहविस्सइ मह सत्ती, तुह गुण थुणणे किमच्छेरं? ॥३॥
तुम्हाणं थु(मु)त्ताहल-पवरण नराण जत्थ उप्पत्ती ।
कित्ती पड़ागा रेहइ, सो बंसो भुवण-भवणुवरि ॥४॥
जत्थ पहूणं तुम्हा-ण तिहुअणत्ताणकरणथवयरणं ।
किं चुडजं? सो देसो, वि(चि)रवस्त्वाओ मारवत्ति ति ॥५॥
तुह ससिणे आणाथणं (?), जम्मणमहिमामिसेण जेण कयं ।
तेण पसिद्धं जागं, सम्माणथणिति नामेण ॥६॥
सिरिमंति देवराओ, जाओ जणओ पहूण तुम्हाणं ।
कहमच्छा सरीरे, जयंतकुमरुव रुवसिरि? ॥७॥
भररयण रयणगब्बा, कोमलदेवी य मंतिणि जणणी ।
वेयविलोयणतिहुअण-ससि(१३२४)मिय वरिसे तुहुप्पत्ती ॥८॥

विहिमगसीसमेसो, भविस्सह महियलभ्मि गुरुराओ ।
 इय विहिणा विहिया तुह, उप्पत्ती मग्गसीसम्मी ॥१॥
 जम्मो पहण तुम्हाण, विसुद्धपक्खाण सुद्धपक्खाम्मि ।
 तुह जम्ममहिमपुण्णा, रित्ता वि चउत्थिया पुण्णा ॥२॥
 तुम्हाण नियपहणं, सया पसचाण पिच्छिऊणुदयं ।
 जाया दिसाविभागा, पसचया इरिसिया इव्व ॥३॥
 तुह नीरयस्स गुरुकवि—बुहतारयमंग(मंड)लस्स जम्मम्मि ।
 रयरहियं गुरुकविबुह—तारयमंग(मंड)लजुयं गयणं ॥४॥
 चंदकुलभासयाणं, सयलं कलकलावतिलयाणं ।
 पिच्छिय उदयं तुम्हाण, धवलह भुवणं करेहि ससी ॥५॥
 जग उज्जोयकरागं, जगचक्खूणं च तुम्ह जम्मस्त्रणे ।
 करमिसेण रविणा, कोसुंभधया दिसासु क्या ॥६॥
 अंबे लच्छि—सरस्सह, नियलुंबिदलेहिं कमलपत्तेहिं ।
 बंदणमाळा बंध[इ]ह, जं जम्मो जुगवरस्पङ्हुणा ॥७॥
 जिणधम्मं व सुहयरं, जम्मं तुम्हाण जणियआणंद ।
 जह कस्स वि गेहंगणि, अबयरणं कप्पहवखस्स ॥८॥
 उज्जोयइस्सह एसो, झुलममलं अम्ह खंभराउव्व ।
 इय नाऊणं पियरेहिं, नाम कयं खंभराउत्ति ॥९॥
 तुह बालचंदमस्स व, बालङ्घत्था विलोयमोयवरा ।
 तुम्हाण जुगवराणं, किं किं नवि होइ? सुहजणयं ॥१०॥
 तुह जह सरीखुड़ी, बडुंति तहा तहा कलासु गुणा ।
 जह कप्पहम्मूलो, व[ह]चढ़(?) प[य]टटंति साहाइ ॥११॥

तुम्हाणं संपत्ते, नवमे वरिसे य जणिय जणहरिसे ।
 सिरिजिणपबोह जुगवर, देसणाघणजलहरो बुद्धो ॥२०॥
 तुम्हाणऽकूखिदेसो, हरिसंकुरपूरपूरिओ धणियं ।
 गयभवरविसंताओ, जाओ निवेयकलामिशुहो ॥२१॥
 सिरिजिणपबोहजुगवर-पाए गहिउण विज्ञवह कुपरो ।
 दाऊण दिक्खतरणीं, नित्थारह भवसमुद्धाओ ॥२२॥
 २ ३ ३ १
 युगसिहिभुवणिदु(१३३२)मिये, वरिसे जिडुस्स सुद्धतइयाए ।
 वय नियपयसिरिजुग्मां, जाणिचा देह दिक्ख गुरु ॥२३॥
 एयमिन खेपकित्ती, वित्थरिही वित्थरा मयललोए ।
 इय विहियं तुह गुरुणा, अभिहाण खेपकित्तिति ॥२४॥
 सिक्खाचामरजुयलं, गुहमासण धवलछतसोहिलं ।
 सीलंगमहसजोहं, पंचमहव्ययगयवरडुं (?) ॥२५॥
 संजमसिरिगुहग्जं, अणवज्जं मयल दुडगइमहणं ।
 गुरुरायमाणपत्तं, भुत्तं तु[त]मए तुमए जियमएणं ॥२६॥
 गुणमणिविज्ञानहजुय, आभसेय विवेयवरममुद्धाओ ।
 पुरिसुत्तमेण तुमए, पत्ता पत्तेण विज्ञसिरी ॥२७॥
 वागरण छंद नाडय, पमाणसिद्धत पमुहविज्ञओ ।
 लीणा तुम्ह सरीरे, जहा समुदे असंखनई ॥२८॥
 अह सिरि चरमाजगुत्तम-कमकमलपवित्तविकपपुगओ ।
 झाणबलेण परिभा-विऊण नियआउपजंत ॥२९॥
 जुगपवर नवनवुच्छव-पवरे जावालि पुरवरे पत्तो ।
 सिरिजिण पबोह गुरुणो, वदिय गुरु विबुह कमकमला ॥३०॥

तत्थ सिरिवीर विहि-चेहयम्मि सुरवइविमाणतुल्लम्मि ।
तेरहमय इगयाले(१३४?), बइमाह सुद्रतीयम्मि ॥३१॥
सिरिजिणपबोहगुरुणा, नियहत्थेण सगच्छभाशधुरा ।
गुणरथणाण तुम्हाण, संठविया संघपञ्चकसं ॥३२॥

[चतुर्भिः कलापकम्]

मंतिकुलकमलदिणयर-नाणामइ रथणरोहण गिरिसम ।
तुह सूरिमंतनासो, गुरुराएहिं कओ ठाणे ॥३३॥
जिणतुल्लरुव तिहुअण-आणंदणचंदचंदिमापडिम ।
सिरिजिणचंदमुणीसर, इह नामं देइ तुम्ह गुरु ॥३४॥
सेयंसकुपारेण, अवखयधारा[हि] दिन्नमिकखुरसं ।
स पियामहस्स पुव्वं, अवखयतीया तओ पव्वं ॥३५॥
अवखयनाणनिहीण, दिणम्मि तुम्हाण इन्थ पट्टुमहो ।
संपइ बढ़इ पव्वं, अक्खयतीयत्ति विक्खायं ॥३६॥
तुह वरपत्तनिवेसिय, सगच्छभरमंतसार सुहचित्तो ।
सिरिजिणपबोहसुगुरु, अणमण विहिणा दिवं पत्तो ॥३७॥
गुणसुमगुरुणा गुरुणा, तुमए जणवंछियत्थसुरतरुणा ।
गच्छपहुतं पचं, जुतं वित्थरियसाहेण ॥३८॥
तुह विबुहरायषट्टः-मिसेयसमयम्मि नंदितूरगचो ।
हरिसयरो बिबुहाणं, सज्जो मघटा कलरवुव्व ॥३९॥
पवयणमाया अट्टउ, तुह अविहव रमणि मगलायारं ।
नाणसिरी चरणसिरी, उत्तारणयं करंति भहे ॥४०॥
पद्म अवत्थं स[प]त्ते, नरसदूले तुमम्मि गुरुराए ।

परिहवई नवि कोवि हु, जियगयघडसीहपोएव ॥४१॥
 विबुहाहिवेण पूरिय—कामेणगंघअमियहिक्षेण ।
 सच्चवियं तुमएच्चिय, अथो वियज्ञायए पुत्रो ॥४२॥
 तुह रूवसिरिसरूवं, उवमाईयं मऊहसोहिलं ।
 किर पंचविंसइयमं, जिणावयारं कहेह जए ॥४३॥
 नयरं नरवहणा जह, सग्गो मग्गाहिवेण जह भाई ।
 पामाओ विवेण व, तुमए पहुणा तहा गच्छो ॥४४॥
 सोहम्प्रसामिवंसो, छत्रेण व सोहिही उ एएण ।
 इय तुम्ह उत्तमंगं, छत्तागारं कयं विहिणा ॥४५॥
 सब्बंगमुंदरंगं, बाहु सुसाहं करंगुली पत्तं ।
 नहकिसलयंसि च फलं, सहकारतरुव तुह भाइ ॥४६॥
 भालत्थलं विसालं, अट्ठमिचंद्रोवमं सिरीनिलयं ।
 पुराणसिरी कीडत्थं, कीडाठाणं कयं विहिणा ॥४७॥
 तुह मुहचंदमपुवं, विमल कलकला-कलाव-निवुदयं ।
 कयसययसिरीवासं, तमोहरं अमियनिज्ञरणं ॥४८॥
 कय—जगज्ञ—आणंदं, गहनिग्गहेउं स[य]लजडिमहरं ।
 रयणियरो संपिच्छिय, सुत्तं पत्तो जिओ भपह ॥४९॥
 नियबंधव—नियसेवय, केरव—ताराणयेसणं विहियं ।
 लोयण—दसण—मिसेण, ससिणा तुह सेवणाह कए ॥५०॥
 भइणीव सिरी—बाणी, चिडह तुह वयण कमलकुलतिलए ।
 सइ वेरे तुम्हाणं, अणप्पमाहप्पमिव जयई ॥५१॥
 कलिकालनिविडकदूदम—उद्धरिय सगच्छ—सकड—भारस्स ।

वसह—धवलस्स—मंसल—खंधसिरी रेहए ठाणे ॥५२॥
 करकमले वसह सिरी, पासाय छत—चामर—धयाई ।
 इय करफरिसे तुम्हाण, तज्जोगो जायई नराण ॥५३॥
 हियरयणायरे तुह, गहिरिमगुरुए मईनईभरिए ।
 समयामिय आहारे, वसह सिरिवरजिणा निचं ॥५४॥
 पाया सुरतरुपाया, तुह विहिया विबुह—सेविया विहिणा ।
 नियनिम्पयतिहुअणज्ञण—मणइहुं दाउकामेणा ॥५५॥
 निरहसए काली तुह, साइसय—जङ्घाण—नाणरुवाई ।
 दट्टूण मिच्छदिड्डी, न कोवि इह विम्हिओ जाओ ॥५६॥
 तुह देसणा रसायण—मणुदिवसं जे नरा अणुहवंति ।
 ते सम्मदिड्डी बलिणो, लहंति अजरामरं. ठाण ॥५७॥
 तुह चउहा धम्मकहा, चउदुगगइ—चउक्कमाय—निगहण ।
 काऊ जुगवं जुगवर !, चउजुगवासीण संजाया ॥५८॥
 तुह मुहहिमसेलाओ, सरस्सई निस्सप्पवरा ।
 अक्खलिया अच्छेरा, मुत्तिसिरी सग्गसुह—जणया ॥५९॥
 सिरिकण्णदेव सिरिजित्त—सीह सिरिसमरसीहरायाणो ।
 तुह पयंकय—छप्पय—लीलं कलयंति गुणलुद्धा ॥६०॥
 कयजुगजुगं सब्बं, कलिम्मि तुडेण तुह कयं विहिणा ।
 कयजुगभावा दीसई, जत्थ तुमं विहरसे नूण ॥६१॥
 बिषपइट्टा—दिक्खा—पयदावण पमुह पमुह किचेहि ।
 सुप्पसत्था तुहि हत्था, जर्यम्मि न हवंतिै कस्सत्था ॥६२॥
 सिरिसत्तुंजय—रेवइ—जिणवर—गुरुतित्थ पमुह तित्थेसु ।

जत्ता जुगल-मिसेण, पाया दिव-सिवकरा जाया ॥६३॥
 देसे सु गुजरत्ता-सु मारवत्ता-सवायलक्खेसु ।
 सिधु-मरुत्थल--वागड—दिल्ली देसे सु य विहाण ॥६४॥
 महिमदिलावच्छत्थल—लच्छी जणया कया तए पढुणे ।
 महुरा गयउरत्ता, भवरिउजत्ता असुहचत्ता ॥६५॥
 लद्धीए सिरिगोयम, रुत्राइगुणेहिं वयरसामिगुरु ।
 सीलेण थुलिमहो, पभावणाए सुहत्थी य ॥६६॥
 नियआउयपजंतं, जाणिता उण नाणओ तुमए ।
 भेरव रोशवविसमं, आगामियकालपसिवकरं ॥६७॥
 नियसिस्साणं राइंद—चंदमूरीण मइपस्साणं ।
 नियपयजुगं सिकख, संघसमक्खं कहेऊणं ॥६८॥
 कायब्बं गुणपवरे, वाणारियकुसलकित्तिगणिसिस्से ।
 जिणकुसलमूरिसुगुरु—त्ति नामपुछ्वेव अम्ह पयं ॥६९॥
 मिच्छादुकडगयवर—पाहो भाववज्जसन्नाहो ।
 जिणचंदमूरुवीरो, अणसणखगेण हणियरिऊ ॥७०॥
 रिउमुणिसिहिससि१३७८परिमिय-बच्छर आसादसुद्धनवमीए ।
 पत्तो सुरवरलच्छीं, पुराड सिरिकोसवाणाआ ॥७१॥
 चंदकुलनहदिवायर !, रयणायर ! सुगुण-पवर रयणेहिं ।
 वाणी मुहा सुहायर !, नमोनमो तुज्ज्ञ जुगपवर ! ॥७२॥
 मह तुह चरियसमुहं, वाणी पाणी पहारिया पप्प ।
 घित्तूण गुणजललवं, पायउ भुवणं मया [प]तियं ॥७३॥
 सिरिजिणकुसलगुरुहिं, जुगवर जिणचंद नियगुरु एवं ।
 परमाए भत्तीए, थुणिओ संघस्स दिसउ सिरि ॥७४॥

इति श्रीजिनचन्द्रमूरि चतुस्सप्तिका सपासा ॥

परिशिष्ट [ग]

ॐ श्रीमद्विजनकुशलसूरि सद्गुरुभ्यो नमः ।

श्रीमद्जयसागर महोपाध्याय विरचिता

जिनकुशलसूरि चौपाइ ।



रिसइ जिणेसर सो जयउ, मंगल केलि निवास ।
 वासवबंदिय पयकपल, जगह जु पूरइ आस ॥१॥
 आसणि तपि जपि जोगि द्वदु, जो समरइ सिरिसंति ।
 तसु घरि सरवरि हंस जिम, नवनिधि नितु विलसंति ॥२॥
 संति करण भवभय हरण, हरिवंसह सिणगार ।
 वण्णिहि सामल मनि विमल, नमह सुनेमिकुमार ॥३॥
 मार विडारण पास जिण, बलि[वारि]जाउं तुय नाम ।
 जसु लाणि[नामि]हि क्लिमलु गलइ,टलइ ति विघ्न विराम ॥४॥
 रामामाहि सलक्खणी, मनउ तिसला नारि ।
 जसु नंदण सिरिबीरजिण, सलहिज्जइ संसारि ॥५॥
 पणमिय गोयमसामिगुरु, अनुगुरु सोहम्मसामि ।
 तसु बंसिहि जे केवि गुरु, तिहि बंदउ सिरि नामि ॥६॥
 इणिपरि समरिय देवगुरु, महिममहिरुह कंद ।
 गाइसुं गुरु आणंद भरि, सिरिजिणकुमलमुर्णिंद ॥७॥

मरुमंडलि समिथाणउ गाम, धणकणकंचणहुसुमाराम ।
 तहिं निवमइ जेलहागरमंति, जसु जसु पसरइ दूरि दिगंति ॥८॥
 चंदकुलंबर पूनिमचंद, बंदह श्रीजिनहुमल मुण्डिंद ।
 नाम मंतु जप्तु महिम निवास, जो समरइ तसु पूरइ आस ॥९॥
 जइतसिरी सुकुलीणी नारि, तसु घरि मंडणि अतिसुविचारि ।
 तासु पुत्र 'करमण' इय नाम, सहजिहिं जसु उत्तम परिणाम ॥१०
 हमइ हेलि खणि खेलइ गेलि, सयणमांहि मणमोहण वेलि ।
 जिमजिम सो परिवाधइ बाल, तिमतिम महियलहरषविमाल ॥११
 देखहु एवहु पुण्य पयोर, वग लहुडउ पुणि बुद्धिहिं धोर ।
 अबदिवसि जिणमसि गुरुमंगि, कुंबर मुचडियउ संजमरंगि
 तउ घरि आवी जणणी पाउ, पणमिय पयड़इ सो मनभाउ ।
 कथनि तुम्हागइ लेयु दीख, अब मति देज्यो काँइ मीख ॥१३॥
 ताम जणणी ताम जणणी, भणइ सुणि बच्छ ! ।
 बलिहारी तुह बयण हु अच्छ, जीवजीव लावण्ण मंदिर ।
 तउ बालउ भोलउ सहिय तमिय, चिन्नुं कहकहवि सुंदर ।
 जे तउ मग्गइ दिक्खसिरि, इय मह मनि न समाइ ।
 जाइ फूल कह किम न रहइ, गयदंतुय सिरिथाउ ॥१४॥
 तउ लहुडउ गरुयउ ब्रतभार, बच्छ ! बहंतउ जाणइ सार ।
 वृषभभार वृषमे ऊपडइ, बाल्लरुए ते अधविचि पडइ ॥१५॥
 रहिरहि कहइ कहावइ लागि, जे तुय भावइ तं तुय मागि ।
 परिणाविसुं वर उत्तम नारि, सुखमोगवी ब्रत पाखइ सारि ॥१६

जम्ह हू[द]इं हुंती मोटी आस, इणि परि मेलहइ ? कांइ निरास
 हुयइ पुत्र कुलवंता जेउ, मातपिता मनि चालइ तेउ ॥१७॥
 थोड़ामांहि कण्ठ मइ घण्ठ, पूछि बच्छ ! हिव मन आपणुं ।
 जयतसिरी तब बोली रही, कुंयरि वात तब निश्चल कही १८
 अहह !! दिखाइय जइं तइं लोभ, तिणि मुझ चित्त न
 आवइ खोभ ।

पड़इ लोह जिणि सुक्तियवेह, मा किमि पाड़इ ? पत्थर रेह १९
 लोकमांहि जे कहीयइ भोग, अंतरंग ते जाण्या रोग ।
 नवनव परि जे झगड़त, भवि भवि आपइ दूक्ख दूरंत ॥२०॥
 किहाँ कवणु छुं कुण तू मात !, कुणु परियणु बंधव कुण तात
 हियइ विचारि जोवउ मान !, मायामय सहु देखउ तात ॥२१॥
 कुड़ कपट नट विट संबंध, द्रोह वंच मद मूर्छा बन्ध ।
 भवि ममतां मइ कीधां सही, दीक्षा विणु तसु औषध नहीं
 जग आवइ जग जावइ तोइ, आवत जान न पूछइ कोइ ।
 आहर जाहर इमहइ करइ, पुण्य विणु ओडालउ किगइ ॥२३॥
 मइं मन कीधउ दृढ आपणुं, रणिचडियां केहउं कापणुं ।
 तोरइ बचनि करि गृह त्याग, काराविसुं सुकृत संभाग ॥२४॥
 माइ मनाविय तिणि करि बुद्धि, निश्चय एकमनां छइ सिद्धि ।
 हिव कुंयर उतावल थई, तउ सामहणी ततखिणि थई ॥२५॥

ताम धवल मंगल [तू]रवर, मन मेलहइ दरषिअ कूर।
 वाजइ तिबलि तूर निसाण, पड़इ सोह भूमिपति प्राण ॥२६॥
 तरल तुरंगम चड़इ कुमार, अंगि अनोपम तसु सिणगार।
 सिरिबरि सीकरि छत्र ऊमाल, पाछइ लूण उतारइ बाल ॥२७॥
 माइ बधावेव दियइ आसीम, 'करमण' नामइं तसु प्रति सीम
 क्रमि नहनारी चाल्यूं सहं, तिणि खणि विरलउ हुय घर रहू
 मारगि पगिपगि नाटक रंग, सुपरिहिं पसरइं दानज रंग।
 दानसुर अनुयाच्चकबृद, इहु बिहुं पूगउ मन आणंद ॥२९॥
 जेलहासुत विस्तरि गुरु पासि, आबइ गहुअह मन उल्लासि ।
 तसु संगमि दरषिउ गुरु सोइ, षात्र लाभि नहु रीझइ कोइ
 विविधरूपि तहिं मंडियनंदि, गायइ गायन नव नव छंदि।
 ध्यान जलणि आहुति अन्यान, की जइ तिल जवसरसव ध्यान
 मास

जोसिय सिरिजिण चंदगुरु, लाडण तहिं करमण रूपिसुर
 सज्जन मेलावह आवीयउए, संयमसिरिनह परणाविउए ॥३२॥
 कुसलकित्ति तसु नामूए, जगि जंगम सोहग ठामूए ।
 नारि दियइ तव चाचरीए, गुरु गहुअडी दहदिसि संचरीए
 सद्वज मनोहर सरि करीए, किर कंठिहिं कोइल अवतरीए ।
 कड़ि कसमसत पटोलडीए, कवि गायइ भंभर भोलडीए ३४
 उरलिय लहकइ हारुए, पगि नेऊर रणझण कारुए ।
 बाला ताला रसि रमईए, खलकत करि कंकण चूडम[ई]ए
 केलिगब्ब सुकुमालतनु, धन लावण्ण धन लीला मवनु ।
 लड़हिय रंगिहिं ललिषमणि, किवि जोयइ टगमग निय नयणि

सहूयह कउतिग देखि करे, तउ पहुतउ आपण आप धरे ।
 सुहगुरु वासिहि महमद्यउए, गुहहरि इग कुसलिग मुनि रद्धउए
 सो लघु मुणि वर सुद्धाचार, विनयविवेक विचाराधार ।
 नमह खपह खमावह सवि दीस, एवहु पुणिहि लाभह सीस ३८
 ठामिठामि पामह सोभाग, तसुबरि लोक धरह अनुराग ।
 गुह आपह विद्या आपणी, थानकि कुण न करह थापणी ३९ ।
 पापभीरु ससिसोमाकारु, जो साधह तपु किरिया सारु ।
 वायणायरिय क्रमि कीधउ सोह, पुणिहि गरुअडि बहाठां होइ
 गुहमनि मानिउ सो गुणवंत, जाणिय नियजीविय पञ्चत ।
 पाटसीख आयरियह देह, आपणि सरगह सुखमाणेह ४१ ।
 गुरु आप सकरण सानंद, श्रीराजेंद्र चंद्रसूरिद ।
 सूरिमंत्र तमु आपह ताम, श्रीजिनकुशालसूरि इहु नाम ४२
 भवजलनिधि उत्तारण घाटि, श्रीजिणचंद मृणीसर पाटि ।
 माणिक जिम नव सोवनघाटि, सोहह सूरि सुमुनिवरधाटि ४३
 जमु मंडिय खंडिय बंभंड, खंडिय पाखंडिय पाखंड ।
 जो जगि जागह तेजि पयंड, मोहरायसिरि पाडह दंड ४४
 स्वरि[सि]रि कवणु महं मागह दंड, इम वर चरत लेइय लोहंड
 झूकतउ जिणि जीतउ मोह, सासन चंग चडविय सोह ४५
 ताम मान मायाऽहंकार, लहहु पुलंता ते विक्षार ।
 मूरख कायर जेह असार, कह किम पामह ? ते जयवार ४६ ।

धमधमंत जिणि धरियउ कोप, खमा खद्गि तसु कीधउ^१
लो[प] ए १

इणि परि सुभट पड़इ रणखेत्रि, तरुवर पान जिम धुरि चैत्रि
मयणमल्ल जिणि हेलामाटि, हाहा हणियउ हिययकपाटि ।
ब्रह्मतेज महिमा सा जाणि, लीजइ जं बलबंत विनाणि ॥४८॥
मुहि मुद्रिइ आबइ अन्यान, न्यान लकुटि तसु फेडिउ थान
समकितसिरि जिणि कीधउ घाउ, भागउ मिधयापतभडबाउ ॥
इणि परि मोहसेन भंजेवि, दहदिसि जयजयकार लहेवि ।
जयत्रहस्त जगि उदयउ सूर, गच्छराज परिपालइ पूर ॥५०॥
आचारिज तरुणप्रभसूरि, जिणि थापिउ जिणमासण सूरि ।
किवि वाणारिय किवि उवज्ञाय, किवि दिकिखय उत्तम-
कुलजाय ॥५१॥

संशपति जिणबिंबपतिङ्ग, विजयवंति जिणिविहिय विसिद्धा
मानतुंग सितुंजय संगि, हुय विहार जसु बुद्धि प्रसंगि ॥५२॥
अवरवि कीधा जे उपगार, तिह हुं जाणुं संख न पार ।
जीह महस जउ मुझ मुख हुति, तउ तसु गुण परिमाण लहंति
संयम सिरि उरमंडलि हार, नवकलपियहिं जो करइ विहार ।
खरतरगच्छरायहुं सिगार, पालइ पूरवरिषि आचार ॥५४॥
जुगप्रधान कमला श्रीकंत, उत्सूत्रह परिहार करंत ।
सो मुणिवर पयडंतउ तत्तु, मिधुदेश विहरंतउ पत्तु ॥५५॥
अंतसमय जाणिय तहिं ठाइ, ध्यानि मोनि तपि जपि दृढ थाइ ।
सो सदगुरु कलिकसमलधोइ, देरउरि पहुतउ सुरलोइ ॥५६॥

तहिं थानक थाप्यउ थिर थूभ, सेव करइ जण बइठा ऊभ।
 रत्नप्रय आरोपी तिहाँ, जे पूजइ तिहाँ दूषण किहाँ ॥५७॥
 थूलभद्र वयरादिक जेय, सरगि गया जिम नमियह तेय।
 थूभ जेम जिण गणहर केर, ईहाँ पुणतिम म घरह फेर ॥५८॥
 जसु तेरह सतत्रीसह जम्म, छहतालह सिरिसंबमधम्म।
 पाटणि सतहुतरह जु पाट, नवासियह जसु सगगह वाट ॥५९॥
 भूमंडलि सग्गिहिं पायालि, सचराचरि जगि इणि कलिकालि
 प्रभु प्रताप नवि मानइ जोइ, मइ नयणे नहु दीठउ सोइ ॥६०॥
 निरधन लहइ धणधन्न सुषण, पुणहीण पामह बहु पुण।
 असुखी पामह सुखसंतान, एकमनां करतां प्रभु ध्यान ॥६१॥
 प्रभु सपरणि आपद मवि गलइ, श्रेय शांति सवि संपद मिलइ
 आधि व्याधि चिता संताप, सवि छंडइ नहु मंडह व्याप
 पाप दोष नवि लागह ताँह, प्रभुदरिमणि उतकेठा जाँह।
 सेवंतह सुरतरु चिय छाँह, दालिद्व निश्चय मेलहइ बाँह ॥६३॥
 विस विसहर विसतर नरनाहु, भूत प्रेत ग्रह व्यन्तर गाहु।
 प्रभु नामहिं तेह न करइ थीड़, भाजह भवभय भावठि भीड़
 रोग सोग मवि नासइ दूरि, अंधकार जिम ऊगह सूरि।
 मूरख फिटी पंडित थाइ, प्रभु पसाइ सवि दुरिय पुलाइ ६५
 दिनिदिनि जिनशामनि उद्योत, जहिं प्रभु छहु भवमागर पोत

सो जुगदर महं भेद्यउ आज, रलिय रहसि सवि कीधा काज
भास-

आज घरंगणि सुरतरु फलियउ, चितामणि महं करयलि
कलियउ।

उदयउ परमाणंद भरे, आज जीह महं धक्षिय गणियह।
जुग पवरागम जह महं शुणियउ, चंद्रगच्छ महिमा निलउए॥
काँइ करहु पृथिवीपति सेवा, काँइ मनावउ देवी देवा।
चिता आणह काँइ मनि, वार वार इहु कवित्तु भणीजह।
श्रीजिनकुशलसूरि समरीजह, सरह काज आयाम बिणु॥
संवत् चउद इगासिय बरिसिहिं, मष्टिकवाहण पुरवरि
मनहरिसिहिं।

अजिय जिणेस पमाय बसि, कियउं कवित इहु मंगल कागणु
विधन हरह पर पापनिवारणु, कोइ म संमउ करह पनि ६९
जिमजिम सेवहं सुरनरगया, श्रीजिनकुशल मुणीमर पाया।
जयमागर उत्तज्ञाय तिम, इम जो सुहगुरुगुण अभिनदह।
रिद्धि समृद्धिहिं सो चिहु नंदह, मनवंछिन फल तसु इवइए॥

इति श्रीमद्युगप्रधान श्रीजिनकुशलमूरीन्द्राणां
चतुष्पदिका ममतिका संपूर्णा ।

श्रीजयसागर महोपाध्यायकृता । श्रीजिनसिंहसूरिशिष्य
पण्डित हेममन्दिरसुनि लिखिता सुखाय । श्री शम् ।

परिशिष्ट [घ]

**दादा श्रीजिनकुशलसूरि स्तुम्भाष्टोत्तरशतस्थान
नामगमित-स्तवन—**

बंदीजइ सदगुरु बरदाई, श्रीजिनकुशलसूरि सिरदार ।
 महियल माहे मोटइ दावइ, दीपइ जिम पूर्व दिनकार ॥१॥ वं०
 मूल थूंभ देराउर महियल, गुणगिरुओ श्रीगाम गडाल
 परचा पूर्हं परतिख पगि पगि, पाउषगारी परमदयाल २
 महिमावंत अधिक मुलताणइ, उच्च अनोपम छाइ अधिकार
 सिद्धपुरइ समरुं सचवायउ, नयर किरहोरइ नवसरहार
 जेसलमेर सकल जोधाणइ, नागोरइ प्रणमइ नरवृद
 मेदनीतटइ देखी मन उच्छसइ, देवलघाड़इ जाणि दिणंद
 उग्रसेनपुर पाटण अलवर, अमरसरइ अउरंगाबाद
 नाढुलाइ वर्द्धनपुर नवहर, उच्छोतनपुर अहम्मदाबाद
 सांगानेर विहार सुशेभित, मालपुरइ मनमोहन रूप ।
 जयतारणि अरियण सहु जीपइ, भाव धरीनइ बंदे भूप ६
 किमनगढ़इ कल्पतरु कहीयइ, राजगढ़इ चंपा रतलाम
 ममियाणइ सोऽक्षत अतिसोहड, साचोरइ सारे मध काम
 सोषनगिरि मंडण सीरोही, नूतनपुर नित चहतउ नूर ।
 पूजउ शात्रुजइ पदपंकज, घरति बंदु ऊगत सूर ॥८॥
 गिरनारइ तुझ गुण महु गावइ, जावइ दुख दोहग जंजाल ।
 दीव नगर देख्या तुझ दरसण, माँगि फलइ मनोरथ माल

ईडर थूंभ अनोपम ओपइ, आसोपइ सुरतह अवतार।
 पुर खंभाइत पाटण पाली, दिल्लीगढ दउलति दातार
 मांगलउर वीरमपुर मनहर, अंजारइ मन अधिक उल्हास
 भली वात करइ भुजनगरइ, मंडही मंदिर महिम निवास
 लखपति महिमपुरि लाहोरइ, बंदइ करजाड़ी वडगात।
 भेहरइ मांहे दालिद्र मंजइ, अजमेरइ मोटी अखियात।
 पूगल जंगल पूनासर प्रभु, पहुचाड़इ सब वात प्रमाण।
 डिंझआणइ आनइ सहुडेरइ, सेरगढ़इ सबलउ मनमाण
 फतेपुर बहु फल फूलइ करि, पूजइ गुरुपदपंकज सार।
 माव भगति भटनेर भलीविधि, फलवर्धिपुर फलियउ महकार
 मइडीचक सुथान मरोटइ, अमरकोट मानइ सहु आण।
 सम्बल कम्बल महं सदगुरुना, सेवइ पदयुग चतुर सुजाण
 दुखभंजन कहीयइ देवीझर, ग्वालेइं कहीयइ गुणगेह।
 सलहीजइ सिरचाड़ी सिजरुंइ, देखी विकसइ मारी देह
 विक्षमपुर वडली वीजापुर, खीमसरइ प्रणम्या नितुखेम
 बाहडमेरु सनूर विशालइ, पहुकरणइ पालहणपुर प्रेम
 चंदसमान कहुं चंदेरी, तोड़इ वंछित घइ ततकाल।
 कुंभलमेरु सकल सुखकाशक, यहर रिणी मांहे सुविशाल
 सरसइ धनवरमइ सेवकघरि, लूणकरणसर लील विलास
 खरी वात कहां खेजड़लइ, पचीयाखइं नितु पुण्यप्रकाश
 देवीखेड़इ दुसमण फेरइ, सइंभर पूरइ सगल। थोक
 झुटइ रायपुरइ जस झलकइ, राधनपुर घइ वंछितरोक

पउज करइ सेवकनईं महेवह, गुंदवचह सद्गुरु गुणवंत
सारणपुर सुणीयह सेत्रावह, जयतपुरहं जुगवर जयवंत
बीलाडह बंदु बड़लुंदह, पीपाडह जस प्रबल पहूर।
कामितदायक कापरहेडह, दुखीयां दुख गमाडह दूर २२
लाभ घणउ यह सुगुरु लवेरह, बालरवह तिमरी सुखवास।
कीरति अधिकी कुंडकी कहीयह, रोहिठ पिण सुणीयउ

रहवास ॥२३॥ चं०

महर करी महाजन प्रतिपालह, संभालह निजसेवक आय।
सुप्रसन्न होवह सांनिधकारी, पड़ियां अटबी पाणी पाय २४
आसति अधिकी जे मन आणी, चरणकमल सेवह चितलाय
तिहां घरि नवनिधि होवह ततखिण, कलिमे निरमल सुमस
कहाय ॥२५॥ चं०।

बड़दरवारह दोषी दुरजन, करी न सकइ कांड भूंडउ काम।
सद्गुरु सुनिजरि करी सेवकनी, महीयलमांहि बधारइ मांप
पूरव दक्षिण उत्तर पश्चिम, जोति सकल त्रिहुं लोकइ जाम।
एक अनेक प्रकारहं इणि जुगि, ईहक जननी पूरइ आस २७
तीर वहइ जिहां बखतर तूटइ, तेज असम झालवहं तरवारि
जलबट थलवट जंगलमांहि, एहवी ठामइ तूं आघारि २८
पाठक 'ललितकीरति' सुपसायइ, 'राज्ञहरव' वंदइ घरि राग
अद्वोत्तर सउ नामइ अद्वृत, सुख संपति होवह सोमाग २९

